



તે વાતો, જેનાથી એક મુસલમાન અજાણ રહી શકતો નથી

કુક્તર ખાલિદ બિન હમ્ર અલ ખરીફ

ما لا يسع المسلم جهله

— ગુજરાતી - —



أركان الإيمان

أركان الإسلام

حقوق وآداب

معاملات وأخلاق



ح جمعية خدمة المحتوى الإسلامي باللغات ، 1445هـ

الخريف ، خالد بن حمد
ما لا يسع المسلم جهله - غوجاراتي. / خالد بن حمد الخريف ؛
جمعية خدمة المحتوى الإسلامي باللغات - ط١. . - الرياض ، 1445هـ

ص ؟ .. سم 178

رقم الإيداع: 1445/18171
ردمك: 978-603-8442-09-8

Partners in Implementation



Content
Association



Rowad
Translation



Rabwah
Association



Byenah

This publication may be printed and disseminated by any means provided that the source is mentioned and no change is made to the text.



Tel : +966 50 244 7000



info@islamiccontent.org



Riyadh 13245-2836



www.islamiccontent.org

غوجاراتી: મા લા યસુ મહિલે જહાન

તે વાતો, જેનાથી એક મુસલમાન અજાણ
રહી શકતો નથી

લેખક

દુક્તૂર ખાલિદ બિન હમ્ડ અલ્ ખરીફ

પ્રસ્તાવના

દરેક પ્રકારની પ્રશંસા ફક્ત અલ્લાહ માટે જ છે, અમે તેની જ પ્રશંશા કરીએ છીએ, તેની પાસે જ મદદ માંગીએ છીએ, અને તેની પાસે જ માફી માંગીએ છીએ, અને પોતાના નફસ અને કાર્યોની બુરાઈથી અલ્લાહ પાસે પનાહ માંગીએ છીએ, જેને અલ્લાહ હિદાયત આપે તેને કોઈ ગુમરાહ નથી કરી શકતું, અને જેને અલ્લાહ ગુમરાહ કરે તેને કોઈ હિદાયત નથી આપી શકતું, અને હું સાક્ષી આપું છું કે અલ્લાહ સિવાય કોઈ ઈબાદતને લાયક નથી, તે એકલો છે, તેનો કોઈ ભાગીદાર નથી, અને એ પણ સાક્ષી આપું છું કે મુહમ્મદ ﷺ અલ્લાહના બંદા અને તેના રસૂલ છે.

ત્યાર બાદ: દરેક મુસલમાન માટે તેના દીનની તે વાતો જાણવી જરૂરી છે જેનાથી તે અજાણ છે, ભલેને તે અકીદને લગતી હોઈ કે ઈબાદતને લગતી અથવા વ્યવહારને લગતી હોઈ, અને તેના માટે અલ્લાહના દીનથી આ રીતે મોઢું ફેરવવું કે તે ન તો દીનની વાતો શીખે અને ન તો તેના પર અમલ કરે, જાઈજ નથી. પરંતુ તેના માટે તેટલું જ્ઞાન પ્રાપ્ત કરવું જરૂરી છે, જેનાથી તેનો દીન કાયમ રહી શકે, જેથી તે અલ્લાહની ઈબાદત જ્ઞાન સાથે કરી શકે, ન તો તે નસાનીઓની જેમ અનુસરણ કરે, જેઓ ઇલમ (જ્ઞાન) વગર અમલ કરે છે, ન તો યહૂદીઓની જેમ અનુસરણ કરે, જેઓ ઇલમ (જ્ઞાન) તો ધરાવે છે પણ અમલ નથી કરતા, અલ્લાહથી દુઆ છે કે તે આપણને યહૂદીઓ અને નસાનીઓના માર્ગથી દૂર રાખે, (આમીન)

તે સત્યતા જોઈ કે લોકોની વધુ સંખ્યા દીનના નિયમોથી અજાણ છે, સિવાય કે અમુક લોકો જેમના પર અલ્લાહની કૃપા થઇ છે, મેં

નક્કી કર્યું કે અકીદહ અને ઈબાદતની તે બાબતો વિષે કઈક લખું,
જેની જરૂરત દરેક મુસલામન પુરુષ અને સ્ત્રીને હોઈ છે.

આ કિતાબ ત્રણ ભાગમાં વહેંચાયેલી છે:

પહેલો ભાગ: અકીદહનું વર્ણન.

બીજો ભાગ: ઈબાદતનું વર્ણન.

ત્રીજો ભાગ: મુઆમલા (બાબતો) વિષેનું વર્ણન.

ઇઝ્ઝતવાળા અલ્લાહ સમક્ષ દુઆ કરું છું કે આ કિતાબને દરેક વિદ્યાર્થી
માટે ફાયદાકારક બનાવે, અને આ કિતાબને ફક્ત તેના માટે જે એક
નિખાલસત્તા સાથે અમલ તરીકે કબૂલ કરે, ખરેખર તે ધણો જ ઉદાર અને
કૃપા કરવાવાળો છે. અને ધણા દરૂદ અને સલામતી ઉત્તરે આપણા નબી
મુહમ્મદ ﷺ, તેમના સંતાન અને તેમના દરેક સાથીઓ પર.

લેખક: દુક્તરૂર ખાલિદ બિન હામ અલ ખરીફ

પહેલો ભાગ

અકીદહનું વર્ણન.

પહેલો વિભાગ: ઇસ્લામનો અર્થ અને તેના અરકાન (સ્તંભ)

ઇસ્લામ તે છે: અલ્લાહની તોહીદનો સ્વીકાર કરવો અને અલ્લાહ સમક્ષ માથું જુકાવી દેવું, આજ્ઞાકારી બની તેનો આદેશ માની લેવો અને શિર્ક અને શિર્ક કરવાવાળાઓના માર્ગથી દૂર રહેવું.

તેના પાંચ અરકાન (સ્તંભ) છે:

પહેલો રુકન: ગવાહી આપવી કે અલ્લાહ સિવાય કોઈ ઈબાદતને લાયક નથી અને મુહમ્મદ ﷺ અલ્લાહના રસૂલ છે.

બીજો રુકન: નમાઝ કાયમ કરવી.

ત્રીજો રુકન: ઝકાત આપવી.

ચોથું રુકન: રમઝાન મહિનાના રોજા રાખવા.

પાંચમો રુકન: જો શક્તિ હોઈ તો અલ્લાહના પવિત્ર ધરની હજ કરવી.

તોહીદની મહત્વતા:

જાણી લો કે અલ્લાહ એ પોતના સર્જનીઓને ફક્ત એટલા માટે પેદા કર્યા છે કે તેઓ ફક્ત તેની જ ઈબાદત કરે અને તેની સાથે કોઈને ભાગીદાર ન હેરવે, અલ્લાહ તથાલાએ કહ્યું: {અમે જિનો અને માનવીઓ ને ફક્ત અમારી ઈબાદત માટે પેદા કર્યા છે} [અઝ અરિયાત: ૫૬], અને તેની ઈબાદત ફક્ત ઈલમ (જ્ઞાન) વડે જ થઈ શકે છે, જેવું કે અલ્લાહ તથાલા એ કહ્યું: {તો (હે પચ્ચાંબર) તમે જાણી લો કે અલ્લાહ સિવાય કોઈ બંદગીને લાયક નથી અને પોતાના માટે અને ઇમાનવાળા પુરુષો અને ઇમાનવાળી સ્ત્રીઓના માટે

પણ ગુનાહોની માફી માંગતા રહો, અલ્લાહ તથાલા તમારા લોકોની હરવા-
કરવા અને રહેઠાણને ખુબ સારી રીતે જાણે છે} [મુહમ્મદ: ૧૬], જેવુ કે
અલ્લાહ તથાલા એ આ આયતમાં વાત અને કાર્ય પહેલા ઇલમ (જ્ઞાન) નું
વર્ણન કર્યું, અને જેમાં સૌથી મહત્વની વાત શીખવાની છે, તે ઉચ્ચ
અલ્લાહની તૌહીદ છે; કારણકે તે દીનનો પાયો છે, અને તૌહીદ વગર દીન
કાયમ નથી થઇ શકતો, અને આ જ એક મુસલમાનનું પહેલું અને છેલ્લું
વાજિબ કાર્ય છે, અને તૌહીદ ઇસ્લામનો પહેલો રૂકન (સ્તંભ) છે, દરેક
મુસલમાન પર ઇસ્લામના પાંચેય અરકાન નું ઇલમ પ્રાપ્ત કરવું અને તેમના
પર અમલ કરવો જરૂરી છે, જેવું કે અબુલ્લાહ બિન ઉમર રહી. ની હદીષમાં
વર્ણન કરવામાં આવ્યું તે કહે છે: મેં નબી ﷺ ને કહેતા સાંભળ્યા: «ઇસ્લામના
પાંચ (સ્તંભો) છે: સાક્ષી આપવી કે અલ્લાહ સિવાય કોઈ સાચો મખબૂદ
(ઈબાદતને લાયક) નથી અને મુહમ્મદ ﷺ અલ્લાહના રસૂલ છે, નમાઝ
કાયમ કરવી, અકાત આપવી, રમજાન મહિનાના રોજા રાખવા, અને
બૈતુલ્લાહની હજ કરવી». મુતફકુન અલૈહ (બુખારી અને મુસ્લિમ).

જેથી એક મુસલમાન માટે તૌહીદને સમજવી વાજિબ અર્થાત્ જરૂરી છે, જે
ફક્ત એક અલ્લાહની ઈબાદત કરવી છે, અને તેની ઈબાદતમાં કોઈને ભાગીદાર
ન બનાવવા, ન તો કોઈ નજીકના ફરિશતાને ન તો કોઈ પથગંબર ને.

**«“લા ઇલાહ ઇલ્લલાહ” (અલ્લાહ સિવાય કોઈ સાચો ઇલાહ
નથી)» નો અર્થ:**

બંદો સંપૂર્ણ યકીન સાથે તે વાતનો એકરાર કરે કે ઉંચ્ચ અલ્લાહ સિવાય
કોઈ સાચો ઇલાહ નથી, તે ફક્ત એક અલ્લાહની ઈબાદત કરે અને

ઈબાદતના દરેક પ્રકારને ફક્ત તેના માટે જ નિખાલસ કરે, જેમકે દુઆ,
ડર, ઉપ્મીદ, ભરોસો કરવો વગેરે જેવી ઈબાદતો.

આ સાક્ષી બે ભાગ વગાર પૂરી થઇ નથી શકતી:

પહેલો ભાગ: અલ્લાહ સિવાયના દરેક જુઠા પૂજ્યો, ઈલાહો અને
મઅબૂદ્ધો અને તેમની ઈબાદતનો ઇન્જાર કરવો.

બીજો ભાગ: ફક્ત એક અલ્લાહ માટે દરેક પ્રકારની ઈબાદત અને
એકતાને સાબિત કરવી, અલ્લાહ તાથાલાએ કહ્યું: {અને દરેક કોમમાં
એક પચંબડ મોકલ્યા, (જે તેઓને કહેતા હતા કે) અલ્લાહની
ઈબાદત કરો અને તાગૂતથી બચો} [અનુનાત: ૩૬].

(લા ઈલાહ ઈલ્લાહ)ની શરતો:

પહેલી શર્ત: ઈલમ (જ્ઞાન) જે અજ્ઞાનતાની વિરુદ્ધ હોઈ.

બીજી શર્ત: એવું યકીન જે શંકાની વિરુદ્ધ હોઈ.

ત્રીજી શર્ત: ઈલાસ જે નિષ્ઠાક (દંભ) ની વિરુદ્ધ હોઈ.

ચોથી શર્ત: સત્ય, જે જુઠની વિરુદ્ધ હોઈ.

પાંચમી શર્ત: મોહબ્બત જે નફરત વિરુદ્ધ હોઈ.

છઠી શર્ત: આજ્ઞાકારી જે અવજ્ઞા વિરુદ્ધ હોઈ.

સાતમી શર્ત: સ્વીકાર જે અસ્વીકાર વિરુદ્ધ હોઈ.

આઠમી શર્ત: અલ્લાહ સિવાયના દરેક જુઠા પૂજ્યોનો ઇન્જાર.

અને આ દરેક શર્તો પર અમલ કરવો વાજિબ છે.

અને આ ગવાહી ફક્ત નિખાલસતા સાથે અલ્લાહની ઈબાદત કરવાથી સાબિત થશે અને તેમાં અલ્લાહ સાથે કોઈને ભાગીદાર ન બનાવે, અને તેની માંગ એ છે કે અલ્લાહ સિવાય કોઈને પોકારવામાં ન આવે, અને તેના પર જ ભરોસો રાખે, તેના સિવાય કોઈનાથી ઉમ્મીદ ન રાખે, અને અલ્લાહ સિવાય બીજા કોઈના માટે ન તો નમાઝ પઢે ન તો જાનવર ઝબેહ કરે. કેટલાક લોકો જે કબરોની આસપાસ તવાફ (પરિકમા) કરે છે, કબરની અંદર રહેલા લોકોથી ફરિયાદ કરે છે, અને અલ્લાહને છોડી તેઓ પાસે દુઆ માંગે છે, આ અલ્લાહની ઈબાદતમાં શિર્ક છે, જેથી આ પ્રકારના કામોથી ચેતીને રહેવું અને બચવું જરૂરી છે, કારણકે આ પ્રકારના કામ મુશર્કો (શિર્ક કરવાવાળા) જેઓ અલ્લાહને છોડી, વૃક્ષ, પદ્ધતર અને મૂર્તિઓની ઈબાદત કરે છે તેઓ કરે છે, આ તે જ શિર્ક છે, જેનાથી સચેત કરવા અને બચાવવા માટે કિતાબો ઉતારવામાં આવી અને પચ્ચાંબરો મોકલવામાં આવ્યા.

આપ ﴿ માટે ગવાહીનો આપવાનો અર્થ:

આપ ﴿ ના આદેશોનું પાલન કરવું, અને જેના વિશે તેમણે ખબર આપી છે, તેને સત્ય માનવું, અને જે કાર્યોથી તેમણે રોક્યા છે, તેનાથી રુકી જવું, અને તેમણે બતાવેલા તરીકા મુજબ અલ્લાહની ઈબાદત કરવી, એક મુસલમાન તે વાતનો એકરાર કરે છે કે મુહમ્મદ બિન અબ્દુલ્લાહ કુરૈશી, હાશમી દરેક માનવજાતિ અને જિજ્ઞાતો માટે અલ્લાહના પચ્ચાંબર છે, જેવું કે અલ્લાહ તથાલા એ કહ્યું: {તમે કહી દો કે હે લોકો ! હું તમારી સૌની તરફ તે અલ્લાહનો પચ્ચાંબર છું} [અલ અખરાફः ૧૫૮].

અને તે વાતનો એકરાર કરવો કે અલ્લાહ તાદીલા એ તેમને પોતાના દીનનો પ્રચાર કરવા અને લોકોની હિંદાયત (સત્ય તરફ માર્ગદર્શન) આપવા માટે મોકલ્યા છે, જેવું કે અલ્લાહ તાદીલા એ કહ્યું: {અમે તમને દરેક લોકો માટે ખુશભબર આપનાર અને સચેત કરનાર બનાવી મોકલ્યા} [સબા: ૨૮]. જેવું કે અલ્લાહ તાદીલા એ કહ્યું: {અને અમે તમને સૃષ્ટિના લોકો માટે દયાળું બનાવીને જ મોકલ્યા છે} [અલ અંબિયા: ૧૦૭].

અને આ સાક્ષીનો ઉદ્દેશ્ય તે છે કે તમારો તે બાતેલ અકીદો (માન્યતા) ન હોઈ કે નબી ﷺ નો રૂભૂબિયત (પાલનહાર) અથવા ઈબાદતમાં કોઈ ભાગ છે, અથવા આ બ્રહ્માંડની વ્યવસ્થામાં કોઈ અધિકાર છે, પરંતુ આપ ﷺ બંદા છે મઅબૂદ (પૂજ્યને લાયક) નથી, અને એક પયગંબર છે, જેમને જુઠલાવી શકાય નહીં, અને તેઓ જ્યાં સુધી અલ્લાહ ન ઈચ્છે, ત્યાં સુધી તે પોતાને પણ ફાયદો અને નુકસાન પહોંચાડી શકતા નથી, જેવું કે અલ્લાહ તાદીલા એ કહ્યું: {હે પયગંબર) તમે તેમને કહી દો કે ન તો હું તમને એવું કહું છું કે મારી પાસે અલ્લાહના ખજાના છે અને ન તો હું ગેબ(અદૃશ્ય)ની વાતો જાણું છું અને ન તો હું તમને એવું કહું છું કે હું ફરિશ્તો છું, હું તો ફક્ત જે મારી પાસે વહી આવે છે તેનું અનુસરણ કરું છું}[અલ અન્ઝામ: ૫૦].

બીજો વિભાગ: ઈમાનનો અર્થ અને તેના અરકાન (સ્તંભો)

ઈમાન: તે દિલથી યકીન કરવું , જુબાન વડે કહેવું, અને અંગો વડે અમલ કરવું છે, જે અનુસરણ કરવાથી વધે છે અને અવજ્ઞા કરવાથી ઘટે છે. ઈબાદતને સાચી કરવા અને તેને કબૂલ થવા માટે ઈમાન એ મહત્વની શર્ત છે, જેવું કે શિર્ક અને કુફ દરેક ઈબાદતોને બરબાદ કરી દે છે, જેમકે

વજ્ઞ વગર નમાઝ કબૂલ નથી થતી, એવી જ રીતે ઈમાન વગર કોઈ ઈબાદત કબૂલ કરવામાં આવતી નથી, અલ્લાહ તઆલા એ કહ્યું: {અને જે કંઈ સારા કાર્યો કરશે, ભલેને તે પુરુષ હોય અથવા કે સ્ત્રી, શરત એ કે તે મોભિન હોય, તો આવા લોકો જ જન્મતમાં દાખલ થશે અને સહેજ પણ તેમનો હક મારવામાં નહિ આવે} [અન્ નિસા: ૧૨૪]. અને શિર્ક તે અમલોને બરબાદ કરી દે છે, જેવું કે અલ્લાહ તઆલા એ કહ્યું: {નિઃશંક તમારી તરફ વહી કરવામાં આવી ચૂકી છે અને તમારાથી પહેલાના લોકો તરફ પણ વહી કરવામાં આવી છે કે (હે પયગંબર !) જો તમે (પણ) શિર્ક કરશો તો તમારા કાર્યો (પણ) બરબાદ થઇ જશો અને ખરેખર તમે નુકસાન ઉઠાવનારાઓમાંથી બની જશો} [અઝુ જુમર: ૬૫].

ઈમાનના છ અરકાન (સ્તંભો) છે, અલ્લાહ પર, ફરિશ્તાઓ પર, કિતાબો પર, પયગંબરો પર, આખિરતના દિવસ પર તેમજ સારી અને ખરાબ તકદીર પર ઈમાન.

અ- અલ્લાહ પર ઈમાન:

અલ્લાહ પર ઈમાન ધરાવવુ તે ત્રણ વાતો પર આધારિત છે:

૧- અલ્લાહની તુબૂબિયત (પાલનહાર) હોવા પર ઈમાન લાવવું: અર્થાત् અલ્લાહ તઆલાને તેના દરેક કામોમાં એક માનવું, જેવું કે પેદા કરવું, રોજુ આપવી, જીવિત કરવું, મૃત્યુ આપવું, અલ્લાહ સિવાય કોઈ પેદા કરવાવાળો નથી, અલ્લાહ સિવાય કોઈ રોજુ આપનાર નથી, અલ્લાહ સિવાય કોઈ જીવિત

કરનાર નથી અને અલ્લાહ સિવાય કોઈ મૃત્યુ આપનાર નથી, અને પવિત્ર અલ્લાહ સિવાય સૃષ્ટિની વ્યવસ્થા કરનાર કોઈ નથી, અને સૃષ્ટિમાં કોઈ એવો વ્યક્તિ નથી, જે પવિત્ર અલ્લાહના પાલનહાર હોવાનો ઇન્કાર કરતો હોય, હા અહંકારી વ્યક્તિ પોતાના અહંકારમાં કહી શકે છે, પરંતુ ખરેખર તે માનતો ન હોય, જેવું કે ફિરઓને તેની કોમને કહ્યું:કહેવા લાગ્યો, હું તમારા સૌનો ઉચ્ચ પાલનહાર છું} [અન્ન નાઝિઆત: ૨૪]. પરંતુ તેનું યકીન ન હતું જેવું કે અલ્લાહ તથાલા એ મૂસા વિશે કહ્યું: મૂસાએ જવાબ આપ્યો કે તું ખૂબ સારી રીતે જાણો છે કે આ દરેક નિશાનીઓ તે હસ્તીએ ઉતારી છે, જે આકાશો અને ધરતીનો માલિક છે, અને હે ફિરઓન ! હું તો સમજુ રહ્યો છું કે તું ખરેખર બરબાદ થઈને રહીશ] [અલ્લ ઇસા: ૧૦૨], અલ્લાહ તથાલા એ કહ્યું:તે લોકોએ અહંકાર અને જુલમનાં કારણે ઇન્કાર કરી દીધો, જો કે તેમના હદ્ય માની ગયા હતાં, (કે મૂસા સાચા છે)} [અન્ન નમલ: ૧૪], કારણકે જરૂરી છે કે આ સર્જનીઓનો કોઈ સાચો સર્જક હોય, તેઓ પોતાને જ પેદા કરી દે, આવું કેવી રીતે શક્ય છે; કારણકે કોઈ વસ્તુ પોતાને જ પેદા નથી કરતી અને આ પણ શક્ય નથી કે તે અચાનક અસ્તિત્વમાં આવી જાય; કારણકે કોઈ સર્જક વગાર સર્જનનું અસ્તિત્વ શક્ય જ નથી, અને એટલા માટે પણ કે આ સૃષ્ટિનો જબરદસ્ત સિસ્ટમ એ વાતનો ઇન્કાર કરે છે કે તે જાતે જ અસ્તિત્વમા આવી ગઈ હોય, એટલા માટે કોઈ સર્જકનું હોવું નિશ્ચિત છે, અને તે સમગ્ર સૃષ્ટિનો પાલનહાર અલ્લાહ છે, અલ્લાહ તથાલા એ કહ્યું: રું આ લોકો કોઈ પણ (સર્જનહાર) વગાર પેદા થઈ ગયા છે અથવા એ પોતે જ સર્જનહાર છે (૩૫) શું આકાશો અને ધરતીને તે લોકોએ પેદા કર્યા છે? સાચી વાત એ છે કે તેઓ (અલ્લાહની કુદરત પર) યકીન જ નથી રાખતા (૩૬)} [અત્ત. તૂર: ૩૫-૩૬].

અને અરબના મુશરીક લોકો અલ્લાહની સાથે અન્યની બંદગી કરતા હોવા છતાંય અલ્લાહને પાલનહાર માનતા હતા, પરંતુ તેના કારણે તેઓ ઇસ્લામમાં દાખલ ન થયા, જો કે આપ એ તેમની સાથે યુદ્ધ કર્યું અને તેમના માલ અને જાનને હલાલ સમજ્યા, કારણકે તેઓ અલ્લાહ સાથે બંદગીમાં અન્યને ભાગીદાર સમજુ તેમની ઈબાદત કરતા હતા, અને તેની સાથે અન્યની ઈબાદત કરતા હતા, જેવું કે મૂર્તિ, પથ્થર, ફરિશ્તાઓ વગેરેની ઈબાદત કરતા હતા.

૨- અલ્લાહના ઈલાહ હોવા પર ઈમાન: ઉલ્લભિયત પર ઈમાનનો અર્થ: ઈબાદતને લાયક ફક્ત એક અલ્લાહ જ છે, તેનો કોઈ ભાગીદાર નથી, (ઇલાહ) અર્થાત् (મઅબૂદ) જેની બંદગી (ઈબાદત) મોહબ્બત, પ્રતિષ્ઠતા અને વિનમ્રતા સાથે કરવામાં આવે. અલ્લાહ તથાલા એ કહ્યું: તુમારો ઈલાહ એક જ છે, તેના સિવાય કોઈ સાચો ઈલાહ નથી, તે ઘણો જ દયા કરવાવાળો અને રહેમ કરવાવાળો છે} [અલ બકરહ: ૧૬૩]. અને જેને અલ્લાહ સાથે ઈલાહ સમજુ બંદગી (ઈબાદત) કરવામાં આવે તે બાતેલ અને ખોટા છે, અલ્લાહ તથાલા એ કહ્યું: આ બધું એટલા માટે કે અલ્લાહ જ સાચો છે અને તેના સિવાય જેમને પણ આ લોકો પોકારે છે તે ખોટા છે. અને નિઃશાંક અલ્લાહ જ પ્રતિષ્ઠિત અને ખૂબ જ મોટો છે} [અલ હજજ: ૬૨]. અને એટલા માટે જ નૂહ અ.સ.થી લઈ મુહમ્મદ એ સુધી દરેક પથગંબરે પોતાની કોમને તૌહીદ અને ફક્ત એક અલ્લાહની બંદગી કરવા પર જોર આપ્યું, અને મુશરીક લોકો જેઓ અલ્લાહને છોડીને અન્યની બંદગી કરતા હતા, તેમની સામે ફરિયાદ કરતા હતા અને તેમની પાસે મદદ માંગતા હતા, તેમને અલ્લાહ તથાલા એ બે તાર્કિક પુરાવા સમજાવી બાતેલ કહ્યું: એક: જે લોકોને તેઓએ મઅબૂદ બનાવી રાખ્યા છે,

તેમાં ઉલ્હિય્યત (ઈલાહ) હોવાની ગુણવત્તા નથી, કારણકે તે પોતે જ સર્જન થયા છે, કોઈ વસ્તુને પેદા કરવી તેમના માટે શક્ય નથી, તે લોકો પોતાની બંદગી કરવાવાળાને કોઈ નુકસાન પહોંચાડી શકતા નથી, અને ન તો કોઈ તકલીફને તેમનાથી હટાવી શકે છે, ન તો તેઓ કોઈને જીવન આપી શકે છે અને ન તો મૃત્યુ અને ન તો ફરીવાર જીવિત કરવાના માલિક છે, જેવું કે અલ્લાહ તથાલા એ કહ્યું:અને (લોકોએ) અલ્લાહ સિવાય કઇ ઇલાહ બનાવી દીધા છે, જે કોઈ વસ્તુ થોડી પેદા કરી શકવાના છે, પરંતુ તેમને પોતે પેદા કરવામાં આવ્યા છે, આ ઇલાહ તો પોતાના ફાયદા અને નુકસાનનો પણ અધિકાર નથી ધરાવતા, અને ન તો તેમને કોઈનાં મૃત્યુ અને જીવન આપવા પર અધિકાર છે અને ન તો મૃતકને ફરી જીવિત કરવાનો કઇ અધિકાર છે} [અલ ફુરકાન: ૩].

બીજુ: મુશર્ફિક લોકો સ્વીકાર કરતા હતા કે પાલનહાર અને સર્જક ફક્ત એક અલ્લાહ જ છે, જો તેઓ રૂભૂભિય્યતનો સ્વીકાર કરતા હોય તો જરૂરી છે કે તેઓ અલ્લાહને ઇલાહમાં પણ ફક્ત એક જ માને, જેવું કે અલ્લાહ તથાલા એ કહ્યું: ર(હે પયગંબર) તમે તેમને પૂછો તો ખરા કે ધરતી અને તેની બધી વસ્તુઓ કોણી છે ? જણાવો જો તમે જાણતા હોય? (૮૪) તરત જ તેઓ જવાબ આપશે કે “અલ્લાહનું” છે. તમે તેમને કહી દો કે પછી તમે શિખામણ પ્રાપ્ત કેમ નથી કરતા. (૮૫) પૂછો તો ખરા કે સાત આકાશો અને ઘણા જ ઉચ્ચ, પ્રતિષ્ઠિત અર્થનો માલિક કોણ છે? (૮૬) તે લોકો જવાબ આપશે કે “અલ્લાહ” જ છે, કહી દો કે પછી તમે ડરતા કેમ નથી? (૮૭) સવાલ કરો કે દરેક વસ્તુનો અધિકાર કોના હાથમાં છે? જે શરણ આપે છે અને જેની વિરુદ્ધ કોઈ શરણ આપનાર નથી. જો તમે જાણતા હોય તો જણાવો? (૮૮) આ જ

જવાબ આપશે કે “અલ્લાહ” જ છે, કહી દો કે પછી તમારા પર જ્યાંથી જાદુ કરી દેવામાં આવે છે? (૮૮) } [અલ મુઅમ્નીન: ૮૪-૮૮].

એટલા માટે જો તેઓ તૌહીદે રુભૂબિય્યતનો સ્વીકાર કરતા હોય તો જરૂરી છે કે તેઓ ફક્ત એક અલ્લાહની જ ઈબાદત કરે, અને તેની ઈબાદતમાં કોઈને ભાગીદાર ન ઠેરવે.

૩- અસ્માવ સિફાત પર ઈમાન (અલ્લાહના નામો અને તેના ગુણો પર ઈમાન લાવવું):

અર્થાતઃ જે નાનો અને ગુણો અલ્લાહએ પોતાની કિતાબમાં સાબિત કર્યા છે, તેના પર ઈમાન, અથવા જે અલ્લાહના રસૂલ ﷺ એ હદીષમાં જણાવ્યા હોય, તેના પર ઈમાન લાવવું; અને તે નાનો અને ગુણોને તેની શાન અને પવિત્રતા પ્રમાણે સાબિત કરવા, કોઈ ફેરફાર અને બદલ્યા વગર. ઉપમા, ઉદાહરણ અને સરખામણી આપ્યા વગર, અલ્લાહ તચાલાએ કહ્યું: {અને અલ્લાહના સારા સારા નામો છે, તો તમે તે નામો વડે જ અલ્લાહને પોકારો અને એવા લોકોને છોડી દો જેઓ તેના નામમાં ખામી શોધે છે, જે કઈ પણ તેઓ કરી રહ્યા છે, નજુક માંજ તેમને તેનો બદલો મળી જશે} [અલ અઅરાફ: ૧૮૦]. અને અલ્લાહ તચાલાએ કહ્યું: {કોઈ વસ્તુ તેના જેવી નથી, અને તે સાંભળવાવાળો અને જોવાવાળો છે} [અશ શૂરા: ૧૧].

શિર્કના પ્રકારો:

- ૧- શિર્ક અકબર (મોટું શિર્ક).
- ૨- શિર્ક અસ્ગાર (નાનું શિર્ક).
- ૩ શિર્ક ખફી (ધૂપાયેલું શિર્ક).

૧- શિર્કે અકબર (મોટું શિર્કે):

તેનો નિયમ: અલ્લાહ તથાલાની ગુણવત્તામાં અલ્લાહને છોડીને અન્યને તેના બરાબર સમજવું, જેવું કે અલ્લાહ તથાલા એ કહ્યું: {જ્યારે તમને અલ્લાહ-સમગ્રસૃષ્ટિના પાલનહારના ભાગીદાર સમજું બેઠા હતાં} [અશ્ શુઅરાઅ: ૮૮]. અને અલ્લાહની ગુણવત્તામાં અલ્લાહને છોડીને અન્યન સાથે તેની સરખામણી કરવી, અને કેટલીક ઇબાદતોને અલ્લાહને છોડીને અન્ય માટે કરવી; જેવું કે ઇબાદતો માંથી દુઅા કરવી, મદદ માંગવી, નજર પુરી કરવી અને ઝબેહ કરવું વગેરે. અથવા આ પણ કે જે વસ્તુ અલ્લાહએ હરામ કરી હોય તેને હલાલ સમજવી, અથવા જે હલાલ કરી હોય તેને હરામ સમજવી, અથવા જે વસ્તુ અલ્લાહએ જરૂરી કરી હોય તેને વ્યર્થ સમજવી, જેવું કે કોઈ એવી વસ્તુને હલાલ સમજવું, જેને દીન દ્વારા સ્પષ્ટ રીતે હરામ કરી દેવામાં આવી હોય, ઉદાહરણ તરીકે વ્યભિચાર, શરાબ, માતાપિતાની અવજ્ઞા તેમજ વ્યાજ વગેરે. અથવા તે પાક વસ્તુઓને હરામ સમજવી જે અલ્લાહ તથાલાએ હલાલ કરી હોય, અથવા કોઈ જરૂરી વસ્તુને જરૂરી ન સમજવી, ઉદાહરણ તરીકે એવું સમજવું કે નમાઝ જરૂરી નથી, અથવા રોઝા રાખવા જરૂરી નથી અને ઝકાત આપવી પણ વાળ્ખિય નથી. અને શિર્કે અકબર પર મૃત્યુ પામનારના દરેક કામ વ્યર્થ બની જશે અને તે હંમેશા માટે જહજીમમાં જશે. જેવું કે અલ્લાહ તથાલા એ કહ્યું: {અને જો આ લોકો (ઉપર જણાવેલ લોકો માંથી) પણ શિર્કે (અલ્લાહ સાથે ભાગીદાર) કરતા, તો જે કંઈ કાચો

કરતા તે સૌ વ્યર્થ થઈ જાત} [અલુ અનંધામ: ૮૮]. અને જે શિર્કું અકબર પર મૃત્યુ પામશે તો અલ્લાહ તેને ક્યારેય માફ નહીં કરે અને તેના માટે જજીત હંમેશા માટે હરામ થઈ જશે. જેવું કે અલ્લાહ તચાલા એ કહ્યું: {નિઃશંક અલ્લાહ તચાલા પોતાની સાથે ભાગીદાર ઠેરવનારને માફ નથી કરતો અને તે સિવાયના જે ગુનાહ હશે જેને ઇચ્છશે તેને માફ કરી દેશે} [અનુ નિસા: ૪૮], અને અલ્લાહ તચાલાએ કહ્યું: {જે કોઈ અલ્લાહની સાથે અન્યને ભાગીદાર ઠહેરાવશે, તેના પર જજીત હરામ થઈ જશે, તેનું ઠેકાણું જહજમ હશે} [અલુ માઈદહ: ૪૨].

૨ શિર્કું અસગાર (નાનું શિર્ક):

જેને કુરાયાન અને હદીષમાં શિર્ક કહ્યું હોય પરંતુ તે શિર્કું અકબરના દરજજા સુધી ન પહોંચતું હોય, તો તેને શિર્કું અસગાર (અર્થાત् નાનું શિર્ક) કહેવામાં આવે છે, જેવું કે અલ્લાહને છોડીને અન્યના નામની કસમ ખાવી; ઉદાહરણ તરીકે કઅબા, પયગંબર અમાનત અને કોઈના જીવનની કસમ ખાવી વગેરે, જેવું કે આપ એ કહ્યું: «જે કોઈએ અલ્લાહના નામને છોડીને અન્યના નામની કસમ ખાધી તો તેણે કૂફ કર્યું અથવા શિર્ક કર્યું»^૧ આ હદીષને અહમદ, અબુદાવૂદ અને તિમિઝી રહ. એ સહીહ સનદ સાથે રિવાયત કરી છે, અને દિલની માન્યતા પ્રમાણે ક્યારેક શિર્કું અસગાર શિર્કું અકબર પણ બની શકે છે, જેવું કે કોઈ વ્યક્તિ પયગંબર અથવા કોઈ શૈખની કસમ ખાનાર એ માન્યતા સાથે કસમ ખાઈ કે તેઓ અલ્લાહના

^૧ મસુન્દ અહમદ: (૧૦૭૨) અને (૧૦/૨૪૯), તિમિઝી: (૧૫૩૫) અને તિમિઝી રહ. એ આ હદીષને હસન દરજજાની કહી છે. (૪/૧૧૦).

બરાબર છે, અથવા તેમને અલ્લાહને છોડીને પોકારવામાં આવે અથવા એવું સમજવામાં આવે કે આ સૃષ્ટિમાં ફેરફાર કરવાનો અધિકાર ધરાવે છે, તો તે શિર્ક અકબર ગણાશે, પરંતુ આ પ્રમાણે કોઈ માન્યતા ન હોય અને ફક્ત આદત પ્રમાણે કસમ ખાતો હોય તો તે શિર્ક અસગર ગણવામાં આવશે, અને આ પ્રમાણે ઘણી વખત થતું હોય છે, એટલા માટે તૌહીદની અકીદાહના કારણે આનાથી સચેત રહેવું ખૂબ જ જરૂરી છે.

3- શિર્ક ખફી:

અર્થાત દિલોનો દેખાડો છે; જેવું કે કોઈ દેખાડો કરવા માટે નમાઝ પઢે, કુરાયાન પઢે, અથવા તસ્બીહ પ્રશંસા માટે કરે, અથવા પોતાની પ્રશંસા માટે સદકો કરે, જે અમલ તેણે દેખાડો કરવા માટે કર્યા, તે અમલ વ્યર્થ કરી દેવામાં આવશે, અન્ય નેક કામ નહીં જે તેણે સાચા દિલથી ફક્ત અલ્લાહ માટે કર્યા હોય, અલ્લાહના રસૂલ ~~એ~~ કહ્યું: «શિર્ક આ કોમમાં અંધારી રાતમાં કાળા પથ્થર પર કાળી કીડીની આહટ કરતા પણ વધુ છુપાયેલ છે, અને તેનો કફ્ફારો (પ્રાયશ્ચિત) આ છે: હું તારી પનાહમાં આવું છું કે મેં જાણતા હોવા છતાય તારી સાથે શિર્ક કર્યું, અને જે હું જાણતો નથી તેની હું માફી માંગું છું».²

² બુખારી, અલ્લ અદબુલ મુફરદ, (૭૧૬) (૧/૩૭૭), મસુનદ અહમદ: (૧૯૬૦૬), (૩૨/૩૮૩) અને જિયાઉલ મકદિસી શ્રી અહાદીખીલ મુખતારતુઃ (૧/૧૫૦), આ હદીખને ઇમામ અલ્બાની રહ. એ સહીહુલ જામિયમાં સહિહ દરજાની કહી છે, (૩૭૩૧) ૧/૫૮૪).

કુફના પ્રકારો:

પહેલો પ્રકાર: કુફે અકબર:

જેના કારણે બંદો હંમેશા માટે જહન્નમમાં રહેશે, અને તેના પણ પાંચ પ્રકાર છે:

૧- કુફે તકાવીબ (જુઠલાવવું):

પયગંબરોને જુઠા હોવાની માન્યતા રાખવી, અને આ પ્રકારનું ફૂફ કાફિરોમાં ઘણું ઓછું જોવા મળે છે, કારણે અલ્લાહ તાલાલાએ પોતાના પયગંબરોને સ્પષ્ટ પુરાવા આપ્યા હતા, આ ફૂફ કરનારની સ્થિતિ તદ્દન એવી જ હતી જેવું કે અલ્લાહએ આ આયતમાં વર્ણન કરી છે: {અહંકાર અને ઝુલ્ભનાં કારણે ઇન્જાર કરી દીધો, જો કે તેમના હદ્ય માની ગયા હતાં, (કે મૂસા સાચા છે)} [અનુનમલ: ૧૪].

૨- ઘમંડ અને અવજ્ઞા કરતા કુફ કરવું:

જેવું કે ઇબલિસનું કુફ, તેણે અલ્લાહના આદેશનો ઇન્જાર તો ન હતો કર્યો, પરંતુ તેણે ઘમંડ અને અવજ્ઞા જરૂર કરી હતી, અલ્લાહ તાલાલાએ કહ્યું: {અને (તે સમય પણ યાદ કરો) જ્યારે અમે ફરિશ્તાઓને કહ્યું કે આદમ ને સિજદો કરો, તો ઇબલિસ સિવાય સૌ ફરિશ્તાઓએ આદમને સિજદો કર્યો, ઇબલીસે ઇન્જાર કર્યો અને ઘમંડ કરવા લાગ્યો અને કાફિરો માંથી થઈ ગયો} [અલ બકરહ: ૩૪].

૩- કુફે એઅરાગ:

તેની વ્યાખ્યા: કે સત્યતાને સાંભળવા અને તેને સ્વીકાર કરવાથી મોહું ફેરવવું, એટલા માટે ન તો તે તેની તરફ ધ્યાન આપે છે, ન તો જુએ છે, અલ્લાહ તાલાલાએ કહ્યું: {તેના કરતા વધારે જાલિમ કોણ હોઈ શકે છે ? જેને અલ્લાહની આયતો દ્વારા શિખામણ આપવામાં આવી હોય, તો પણ તે

આનાથી મોઢું ફેરવી લીધું. નિઃશંક અમે પણ પાપીઓ સાથે બદલો લેવાવાળા છે} [અસ્ત્ર સજદહઃ ૨૨], પરંતુ જો આ અવજ્ઞા સંપૂર્ણ ન હોય પરંતુ થોડાક અંશમાં હોય તો પછી તેને ફૂફ ગણવામાં નહીં આવે તેને ડિસક (ગુનો) ગણવામાં આવશે, જેવું કે કોઈ વ્યક્તિ દીનમાં વાજિબ વસ્તુઓ શીખવા ન માંગે, જેવું કે રોઆ અને હજના મસઅલા મસાઇલ.

૪- કુઝ શક (શંકાશપદ):

જ્યારે કોઈ વ્યક્તિ સત્ય બાબતોમાં શંકામાં હોય, જેવું કે અલ્લાહ તાયાલાએ કહ્યું: {અને તે પોતાના બગીચામાં ગયો અને તે પોતાના ઉપર ઝુલ્મ કરી રહ્યો હતો, કહેવા લાગ્યો કે હું કલ્પના પણ નથી કરી શકતો કે આ બગીચો ગમે ત્યારે નષ્ટ થઈ શકે છે. (૩૫) અને હું કયામતના દિવસની પણ કલ્પના નથી કરતો અને જો હું મારા પાલનહાર તરફ ફેરાવવામાં પણ આવ્યો તો પણ મને યકીન છે કે હું આના કરતા પણ વધારે જગ્યા પામીશા} [અલ કહફ: ૩૫-૩૬].

૫ કુઝ નિઝાક:

અને એ કે વ્યક્તિ જબાન વડે તો ઈમાનનો દાવો કરે પરંતુ દિલથી તેને જુઠલાવતો હોય, અલ્લાહ તાયાલાએ કહ્યું: {લોકો માંથી કેટલાક લોકો એવા પણ છે, જેઓ કહે છે કે અમે અલ્લાહ ઉપર અને કયામતના દિવસ ઉપર ઇમાન રાખીએ છીએ, પરંતુ તેઓ સાચા મોભિન નથી} [અલ બકરહ: ૮], આ છે કુઝ અકબરના પ્રકાર, જેના કારણે એક વ્યક્તિ ઇસ્લામ માંથી બહાર થઈ જશે.

બીજો પ્રકાર: કુઝ અસગાર:

આ ફૂફના કારણે કોઈ હંમેશા માટે જહજીમમાં નહીં રહે, આ ફૂફમાં તે દરેક વસ્તુઓનો સમાવેશ થાય છે, જેના વિશે શરીરિતમાં ફૂફ શબ્દનો ઉપયોગ

સામાન્ય રીતે વર્ણન થયો હોય, અર્થાત્ કુફ શબ્દ પર અલિક અને લામ ન આવ્યા હોય, અને આ વિશે ઘણા ઉદાહરણો વર્ણન થયા છે, જેમાંથી:

અભૂ હુરૈરહ રઝી. ની હદીષ, આપ એ કહ્યું: «લોકોમાં બે વસ્તુઓ કુફ છે, એક તો નસબ (ખાનદાન) વિશે મહેણાં-ટોણા મારવા, અને મૃતક પર નવહા (વિલાપ) કરવું».³

બ- ફરિશ્તાઓ પર ઈમાન:

અને આનો સંબંધ ગૈબની વાતો માંથી છે, અલ્લાહ તઆલાએ તેમને નૂરથી પેદા કર્યા, તેઓ સૌ અલ્લાહની ઈબાદત કરવાવાળા છે, અને તેમનામાં રૂભૂબિય્યત અને ઉલ્લુહિય્યતના એક પણ ગુણોનો સમાવેશ થતો નથી, અને તેઓ અલ્લાહના આદેશની અવજા નથી કરતા, પરંતુ તેઓ તેના આદેશો પર અમલ કરે છે, તેમની સંખ્યાનું જ્ઞાન અલ્લાહ સિવાય કોઈને નથી.

ફરિશ્તાઓ પર ઈમાન ચાર વસ્તુ પર આધારિત છે:

૧- તેમના અસ્તિત્વ પર ઈમાન.

૨- જે ફરિશ્તાઓના નામ ખબર હોય, જેવું કે જિબ્રિલ, ઇસરાફીલ, મિકાઈલ વગેરે પર ઈમાન લાવવું, અને જેમના નામની જાણ ન હોય તેના ઉપર પણ ઈમાન લાવવું.

૩- કુરાઓન અને હદીષમાં તેની જે ગુણવત્તા વર્ણન થઈ હોય તેના પર ઈમાન લાવવું, જેવું કે જિબ્રિલ અ.સ. વિશે વર્ણન કરવામાં આવ્યું

³ મુસ્લિમ, હદીષ નંબર: (૧૨૧), નવહા કરવું અને નસબ (ખાનદાન) વિશે મહેણાં ટોણા મારવા પર કુફના આદેશ પર વર્ણન. (૧/૮૩) અને મુસનદ અહમદ: (૧૦૪૩૪), (૧૬/૨૭૦).

કે આપ છે એ તેઓને તેમની અસલ સ્થિતિમાં જોયા તેમની છસો પાંખો હતી, જેનાથી આકાશ ઢંકાય ગયું હતું.

૪- ફરિશ્તાઓને જે કાર્યોનું છબ્મ હોય તેના પર ઈમાન લાવવું: જેવું કે થાક્યા વગર સતત સવાર-સાંજ અલ્લાહની તસબીહ અને તેની ઈબાદતમાં વ્યસ્ત રહેવું, અને અમાનતદાર જિબ્રિલ અ.સ.નું વહીની જવાબદારી લેવી, ઇસરાફિલ અ.સ.નું સૂરમાં ફૂંક મારવા માટેની જવાબદારી લેવી, મોતનો ફરિશ્તા: મોતના સમયે રૂહ ખેંચી લેવી, માલિક: જહન્નમ માટે જવાબદાર, અને રિજવાન: જજીતની દેખરેખ રાખનાર છે, એવી જ રીતે જે ફરિશ્તાઓના કાર્યો વિષે જાણ હોઈ તેના પર ઈમાન ધરાવવું.

૪- કિતાબો પર ઈમાન:

કિતાબો અર્થાત् તે આકાશીય કિતાબો જે અલ્લાહ એ પોતાના પયગંબરો પર ઉતારી, માનવીઓ માટે હિદાયત અને તેમના પર રહેમ કરવા માટે જેથી તેઓ બંને જહાનમાં સારા પરિણામ પ્રાપ્ત કરે, કિતાબો પર ઈમાન ચાર વસ્તુ પર આધારિત છે:

- ૧- તે વાત પર ઈમાન કે આ કિતાબોનું અલ્લાહ તરફથી ઉત્તરવું, સાચું છે.
- ૨- જે કિતાબોના નામ ખબર હોય તેના પર ઈમાન: જેવું કે કુરાયાન મજૂદ મુહમ્મદ છે પર ઉતારવામાં આવ્યું, તૌરાત મૂસા અ.સ. પર ઉતારવામાં આવી, ઇન્જિલ ઈસા અ.સ. પર ઉતારવામાં આવી, ઝ્યુર દાવુદ અ.સ. પર ઉતારવામાં આવી, અને જે કિતાબોના નામની જાણ ન હોય તેમના ઉપર પણ સંક્ષિપ્ત ઈમાન લાવવું જરૂરી છે, તેમાં વર્ણવેલ વાતોની પુષ્ટિ કરવી; જેવું કે કુરાયાન અને પહેલાની ફેરફાર થયા

વગરની જે કિતાબો છે તેમની ખબરો, તે કિતાબોમાં વર્ણવેલ દરેક આદેશો પર ખુશી ખુશી સ્વીકાર કરી તેના પર અમલ કરવો, ભલેને આપણને તે આદેશની હિકમત સમજાતી હોય કે ન સમજાતી હોય, યાદ રાખવું જોઈએ કે પહેલાની દરેક કિતાબ કુરાન મજુદ આવ્યા પછી મન્સુખ (૨૬) થઈ ગઈ છે, એટલા માટે પહેલાની કિતાબો માંથી કોઈ આદેશ પર અમલ કરવો જાઈઝ નથી, હા, જે અમલને કુરાનને મન્સુખ(૨૬) ન કર્યો હોય પરંતુ તે જ અમલ કુરાનમાં પણ હોય.

E- પયગંબરો પર ઈમાન:

રુસુલ રસૂલ શબ્દનું બહુવચન છે, જેમના પર વહી દ્વારા શરીયત ઉતારવામાં આવી, અને તેમને તેના પ્રચારનો આદેશ આપવામાં આવ્યો હોઈ, સૌ પ્રથમ પયગંબર નૂહ અ.સ. અને અંતિમ પયગંબર મુહમ્મદ ﷺ, અને તે સૌ માનવી છે, અને તેમનામાં રુભૂબિયત અને ઉલ્લભિયતના કોઈ ગુણોનો સમાવેશ થતો નથી.

પયગંબરો પર ઈમાન નીચે વર્ણવેલ વાતો પર આધારિત છે:

૧- તે વાત પર ઈમાન કે તેમની પયગંબરી અલ્લાહ તરફથી સાચી છે, એટલા માટે જો કોઈ એક પયગંબરનો ઇન્જાર કરશે તો સૌનો ઇન્જાર કર્યો ગણાશે.

૨- તે પયગંબરો પર ઈમાન ધરાવવું જેમના નામની આપણને જાણ હોય, જેવું કે મુહમ્મદ ﷺ, ઇબ્રાહિમ, મૂસા, ઈસા, નૂહ અ.સ. અને આ સૌ પયગંબરોને ઉલુલ અઝ્મ (ઉંચ્ય હિમત અને હોસલા વાળ) પયગંબર કહેવામાં આવે છે, અને જે પયગંબરોના નામની જાણ ન હોય તેમના ઉપર પણ સંક્ષિપ્ત રૂપે ઈમાન ધરાવવું જરૂરી છે, અલ્લાહ તઆલાએ કહ્યું:
 {નિઃશંક અમે તમારા કરતા પહેલા પણ ધણા પયગંબરો મોકલી યૂક્યા

છીએ, જેમાંથી કેટલાકના (કિસા) અમે તમને બતાવી ચૂક્યા છીએ અને તેમાંથી કેટલાકના તો અમે તમને નથી બતાવ્યા} [ગાફિર: ૭૮].

૩- તેમની જે વાતો સત્ય હોઈ તે વાતોની પુષ્ટિ કરવી.

૪- અંતિમ પયગંબર મુહમ્મદ ﷺની શરીયત પર અમલ કરવો.

હ- આધિકારિક દિવસ પર ઈમાન:

અર્થાતું, કયામતનો દિવસ, જ્યારે લોકોને તેમના કર્મો પ્રમાણે હિસાબ અને બદલા માટે ફરીવાર ઉઠાવવામાં આવશે, તે દિવસનું નામ આધિકારિક એટલા માટે છે, કારણકે ત્યારબાદ કોઈ બીજો દિવસ નહીં હોય, અને જન્મતી તેમજ જહન્જમી લોકો પોત પોતાના ઠેકાણે પહોંચી જશે.

આધિકારિક દિવસ પર ઈમાન ત્રણ વસ્તુ પર આધારિત છે:

અ- ફરીવાર જીવિત થઈ ઉઠાવવા પર ઈમાન:

અર્થાતું જ્યારે સૂરમાં બીજુ કુંક મારવામાં આવશે, ત્યારે દરેક મૃતક લોકો જીવિત થઈ ઉભા થશે, અને પાલનહાર સામે ઉભા થશે, તેમના પગમાં ન તો ચપલ હશે અને ન તો તેમના શરીર પર કપડાં, અને દરેકની ખતના કરેલી નહીં હોઈ, અલ્લાહ તાલાલાએ કહ્યું: {જેવી રીતે અમે પ્રથમ વખત તમારું સર્જન કર્યું હતું, તેવી જ રીતે બીજુ વખત કરીશું. આ અમારા શિરે એક વચ્ચે છે અને અમે તેને જરૂર પૂરું કરીશું} [અંબિયા: ૧૦૪].

બ- હિસાબ અને બદલો મળવા પર ઈમાન:

બંદાના અમલોનો હિસાબ થશે અને તે પ્રમાણે તેને બદલો આપવામાં આવશે, અલ્લાહ તાલાલાએ કહ્યું: {ખરેખર અમારા તરફ જ તેમને પાછા ફરવાનું છે. (૨૫) અને ખરેખર તેમનો હિસાબ અમારા શિરે છે} [અલ્લો ગોશિયાઃ: ૨૫-૨૬].

જ- જજીત અને જહજમ પર ઈમાન:

તે વાત પર ઈમાન ધરાવવું કે આ બજે પ્રકારના બંદાઓ માટે કાયમી ઠેકાણાં છે:

જજીત તે કાયમી ઠેકાણું છે, જેને અલ્લાહ તથાલાએ પરહેજગાર મોમિન બંદાઓ અને અલ્લાહ અને તેના પથગંબરની આજ્ઞાનું પાલન કરનાર માટે તૈયાર કરી છે, તેમાં એવી નેચું મતો છે, જેને અત્યાર સુધી કોઈ આંખે જોઈ નથી અને કોઈ કાને સાંભળ્યું પણ નથી અને ન તો કોઈ માનવીના દિલમાં અત્યાર સુધી તેના વિશે કંઈ વાત આવી છે.

અને હવે જહજમ; તે અજાબ માટેનું ધર છે, જેને અલ્લાહ તથાલાએ કાફિરો માટે જેઓ અલ્લાહ અને તેના પથગંબરની અવજ્ઞા કરતા હતા, તેમના માટે તૈયાર કરી રાખી છે, તેમાં એવા અજાબના પ્રકાર છે, જેની તકલીફનો ખ્યાલ કરવો પણ શક્ય નથી.

વ- સારી અને ખરાબ તકદીર પર ઈમાન:

અને તકદીર પર ઈમાનનો અર્થ: અલ્લાહ તથાલાના પોતાના પાછલા છલ્ભ અને હિકમત પ્રમાણે દરેક કાર્યો થઈ રહ્યા છે.

તકદીર પર ઈમાન ચાર વસ્તુ પર આધારિત છે:

૧- છલ્ભ: એટલે કે એ વાત પર ઈમાન લાવવું કે જે કંઈ થઈ રહ્યું છે અથવા જે થવાનું છે, અને તે કઈ રીતે થવાનું છે તેના વિષે બધું જ સંક્ષિપ્ત રૂપે અથવા વિસ્તારપૂર્વક અને હંમેશાવાળું તેમજ કાયમી છલ્ભ અલ્લાહ પાસે છે, એવી જ રીતે જે થઈ નથી તે પણ અલ્લાહ ખૂબ સારી રીતે જાણે છે કે જો તે થાત તો કંઈ રીતે થાત, જેવું કે અલ્લાહ તથાલા એ કહ્યું: {જો આ લોકો ફરી પાછા મોકલી દેવામાં

આવે તો પણ તેઓ એવા જ કાર્યો કરશે જેનાથી તેઓને રોકવામાં આવ્યા હતા} [અલુ અનામઃ ૨૮].

૨- અલુ કિતાબત (લખાણ): અલ્લાહ તથાલાએ દરેક વસ્તુની કયામત સુધીની તકદીર લખી રાખી છે, જેવું કે અલ્લાહ તથાલા એ કહ્યું: {શું તમે નથી જાણતા આકાશો અને જમીનમાં કે જે કઇ પણ છે તેને અલ્લાહ જાણો છે, અને તે (બધું) કિતાબ મા (લખેલું) છે, અને આ બધું અલ્લાહ માટે સહેલું છે} [અલુ હજ્જ: ૭].

૩- મશીયત (ઈચ્છા): અર્થાત્ એ વાત પર ઈમાન ધરાવવું કે આ સૃષ્ટિમાં તે જ થાય છે, જે અલ્લાહ ઈચ્છે છે, અલ્લાહ તથાલાએ કહ્યું: {અને તમારો પાલનહાર જે ઇચ્છે છે, તેનું સર્જન કરે છે અને જેને ઇચ્છે છે, (પોતાના કામ માટે) પસંદ કરી લે છે} [અલુ કસસ: ૬૮]. અને માનવીની મરજી અલ્લાહની ઈચ્છાથી બહાર નથી જઈ શકતી, જેવું કે અલ્લાહ તથાલા એ કહ્યું: {અને તમે ઈચ્છી નથી શકતા પરતું તે જ, જે સમૃગ સૃષ્ટિનો પાલનહાર ઇચ્છતો હોય} [અત્ તકવીર: ૨૯].

૪- સર્જન: એ વાત પર ઈમાન કે સર્જનીઓ અને તેમના સારા અને ખરાબ કાર્યોનો સર્જક છે, અલ્લાહ તથાલાએ કહ્યું: {અલ્લાહ જ દરેક વસ્તુનો સર્જનહાર છે, અને તેજ દરેક વસ્તુઓ નો કારસાજ છે} [અઝી ઝુમર: ૬૨].

ત્રીજો વિભાગ: અલુ અહેસાન

અલુ અહેસાન: આ એક જ રૂકન છે, એ કે તમે અલ્લાહની ઈબાદત એવી રીતે કરો જેવું કે તમે તેને જોઈ રહ્યા છો, અને જો આ ઘ્યાલ ન કરી શકતા હોઈ તો કમ સે કમ એટલું તો જરૂર વિચારો કે તે તમને જોઈ રહ્યો છે.

અર્થાત്: માનવી અલ્લાહની ઈબાદત એવી રીતે કરે, જાણે કે તે અલ્લાહ સામે ઉભો હોય, અને આ દરજ્જો અલ્લાહ માટે સંપૂર્ણ દર અને સંપૂર્ણ ઝુકાવ પછી પ્રાપ્ત થાય છે, અને તેના માટે જરૂરી છે કે ઈબાદત રસૂલ ﷺ ની સુજ્ઞત પ્રમાણે હોય.

અહેસાનના બે દરજ્જા છે, અને મોહસીન (એહેસાન કરનાર) માટે અલગ અલગ બે દરજ્જા છે:

પહેલો દરજ્જો: અને સૌથી ઊંચો દરજ્જો મુશાહદહનો (જોવાનો) દરજ્જો છે, અર્થાત् બંદો એવી રીતે ઈબાદત કરે જેવું કે તે પોતાની સામે દિલથી અલ્લાહને જોઈ રહ્યો હોય, જેનાથી દિલ ઇમાનના નૂરથી એવી રીતે પ્રકાશિત થઈ જાય છે કે ગેબ જાણે કે નજર સામે જોઈ રહ્યો હોય.

બીજો દરજ્જો: ઇખલાસ (નિખાલસતા) અને મુરાકબહનો (ધ્યાનનો) દરજ્જો, અને તે એ કે બંદો ઈબાદત કરતી વખતે હંમેશા એક વાત ધ્યાનમાં રાખે કે અલ્લાહ તેને જોઈ રહ્યો છે, અને તેને તેના દરેક અમલની જાણ છે, જો બંદાની આવી સ્થિતિ હોય તો તે મુખલિસ (નિખાલસ) છે.

ચોથો વિભાગ: અહલે સુજ્ઞત વલ જમાઅતના ઉસૂલ અને નિયમો:

પહેલો નિયમ: અહલે સુજ્ઞત વલ જમાઅત કિતાબ અને સુજ્ઞતનું અનુસરણ કરે છે, જાહેરમાં પણ અને બાતેનમા પણ,

અને અલ્લાહ તેમજ તેના રસૂલ ﷺ ની વાત પર કોઈની વાતને પ્રાથમિકતા નથી આપતા.

બીજો નિયમ: આપ ના સહાબાઓ વિશે દિલ અને જીવાન સાફ રાખે છે, અને તેમનો અકીદો એ છે કે રસૂલ પછી ખલીઝા અબુબકર, ત્યારબાદ ઉમર ત્યારબાદ ઉષ્માન અને પછી અતી રહીએ.

ત્રીજો નિયમ: રસૂલ ના અહલે બૈત સાથે મોહબ્બત અને લાગણી, અને આપના અહલે બૈતમાં જે લોકો નેક છે, તેઓ જ ખરેખર આપના અહલે બૈત છે.

ચોથો નિયમ: હાકિમ અને ગર્વનર વિરુદ્ધ બળવો ન કરવો, ભલેને તેઓ જીલમ અને વિદ્રોહ કરે, જો કે તેમના માટે નેકી અને આફિયતની દુઆ કરવી, અને તેમને બદ દુઆ ન આપવી, અને જ્યાં સુધી તે ગુનાહનો આદેશ ન આપે, ત્યાં સુધી તેમનું અનુસરણ કરવું ફરજ છે, અને તે અલ્લાહના અનુસરણમાં શામેલ છે, જો તે ગુનાહનો આદેશ આપે તો પછી તેમાં તેમનું અનુસરણ કરવું જરૂરી નથી, તો પણ અન્ય ક્રમોમાં તેમનું અનુસરણ કરવું જરૂરી રહેશે.

પાંચમો નિયમ: અવલીયાની કરામાત (નેક લોકો દ્વારા થતા ચમત્કારો) ની પુષ્ટિ, અર્થાત् આદત વિરુદ્ધ બાબતો, જે અલ્લાહ પોતાના કેટલાક બંદાઓના હાથો વડે જાહેર કરે છે.

છ્યો નિયમ: અહલે કિબલહ (મુસ્લિમાનો) ને સામાન્ય ગુનાહ અને અવજાના કારણે કાઢીર નથી કહેતા, જેવું કે ખવારીઝ કરતા હોય છે, પરંતુ એહલે સુજ્ઞત પાસે ગુનાહો હોવા છતાં પણ તેમની પાસે ઇમાની ભાઈચારો બાકી રહે છે, તેઓ કહે છે કે મોમિન પોતાના ઇમાનના કારણે મોમિન અને કબીરહ ગુનાહના કારણે ફાસિક (ગુનેગાર) બની જાય છે.

બીજો વિભાગ: ઇંડિયાનું વર્ણન પહેલો વિભાગ: પાકી સફાઈનું વર્ણન

તહારત નો શાબ્દિક અર્થ: દરેક પ્રકારની ગંદકીથી પાક સાફ હોવું.

શરાઇ અર્થ (કાચદાકીય અર્થ): હદ્ધ (ગંદકી) ખતમ થવી અને દૂર થવી, પાકી સફાઈ નમાઝ માટેની ચાવી છે, એટલા માટે પાકી સફાઇ વિશે ઇલ્લ પ્રાપ્ત કરવું, દીનના ભવ્ય કાર્યો માંથી એક છે, દરેક મુસલમાન માટે જરૂરી છે કે તેને ધ્યાનપૂર્વક શીખો.

પહેલું: પાણીના પ્રકાર:

૧- તહૂર (તે પાણી જે સંપૂર્ણ રીતે પાક હોય અને બીજાને પણ પાક કરી શકે): તે પાણી જેનાથી સફાઈ પ્રાપ્ત કરવી યોગ્ય છે, તે પોતાની મૂળ સ્થિતિમાં હોય; જેવું કે વરસાદનું પાણી, નહેરનું પાણી અથવા સમુદ્રનું પાણી, અથવા તેમાં કોઈ પાક વસ્તુને ભેગસેળ થઈ હોય પરંતુ તે તેના પર પ્રભુત્વ મેળવતી ન હોય, કે જેનાથી તે પાણીની પાકીની ગુણવત્તા ખતમ થઈ ગઈ હોઈ.

૨- નજિસ (નાપાક); તેનો વપરાશ જાઈએ નથી, ન તો તેનાથી ગંદકી દૂર થાય છે, અને ન તો તેનાથી નજાસત (અશુદ્ધતા) દૂર થાય છે, આ તે પાણી છે, જેનો રંગ, ગંધ, અથવા સ્વાદ કોઈ ગંદકીના કારણે બદલાય ગયો હોય.

બીજું: નજાસત (અશુદ્ધતા):

નજાસત: અર્થાત એક ખાસ પ્રકારની ગંદકી છે, જેના કારણે નમાઝ થતી નથી; જેવું કે પેશાબ, સંડાસ અને લોહી વગેરે, આ ગંદકી શરીર, કપડું અને જગ્યા પર હોઈ શકે છે, વસ્તુઓમાં મૂળ ઇબાહત (હલાલ)

અને તહારત(પાકી) હોય છે, એટલા માટે જો કોઈ વ્યક્તિ કોઈ વસ્તુને ગંદી હોવાનો દાવો કરે, તો તેની પાસેથી દલીલ માંગવી જોઈએ, કથ નીકળવો, માનવીનો પરસેવો, અથવા ગાયેડાનો પરસેવો, તે પાક છે પરંતુ તે ગંદકી જરૂર છે, એટલા માટે દરેક નજાસત (અશુદ્ધતા) ગંદકી છે, પરંતુ દરેક ગંદકી નજાસત (અશુદ્ધતા) નથી.

નજાસત (અશુદ્ધતા) ના ત્રણ દરજા છે:

પહેલું: અનુનાનજાસતુલ્ મુગલઝહ (ધદ અશુદ્ધતા):

ઉદાહરણ: તે વાસણની નાપાકી જેમાં કુતરાએ મોઢું નાખ્યું હોય, અને તેને પાક કરવાનો તરીકો: તે વાસણને સાત વખત ધોવામાં આવે અને પ્રથમ વખત માટી વડે ધોવામાં આવે.

બીજું: અનુનાનજાસતુલ્ મુખફક્ષહ (પાતળી અશુદ્ધતા):

ઉદાહરણ: દુધપિતા બાળકનો પેશાબ, જ્યારે કપડાં વગેરેમાં લાગી જાય, અને તેને પાક કરવાનો તરીકો: તેના પર સારી રીતે પાણી છાંટવામાં આવે, નિચોડવાની કોઈ જરૂર નથી.

ત્રીજું: અનુનાનજાસતુલ્ મુતવ્વસિતહ (મધ્યમ અશુદ્ધતા):

ઉદાહરણ: માનવીનો પેશાબ અને ગંદકી, જ્યારે જમીન અથવા કપડાં પર લાગી જાય.

તેને પાક કરવાની રીત: પાણી અથવા સફાઈ કરવાના અન્ય તરીકા દ્વારા તેની ગંદકીને દૂર કરવામાં આવે, અને જો ગંદકી ચોટી જતી હોય તો તેને ખતમ કરવામાં આવે.

નીચે કેટલાક પ્રકારની ગંદકીનું વર્ણન કરવામાં આવી રહ્યું છે:

૧- માનવીનો પેશાબ અને સંડાસ.

- ૨- મરી અને વડી.^૪
- ૩- તે જાનવર જે હલાલ ન હોઇ તેની ગંદકી.
- ૪- હૈજ અને નિફાસનું લોહી.
- ૫- કુતરાની લાળ.
- ૬- મૃતક, અને જે નીચે વર્ણવેલ છે તેમાંથી નહીં.
- અ: મૃતક માનવી.
- બ- મૃતક માછલી અને તીડ.
- જ- એવું મૃતક જાનવર જેનું લોહી વહેતું ન હોય, જેવું કે માખી, મધમાધી, કીડી વગેરે.
- દ- મૃતક જાનવરના હાડકા, શિંગડા, નખ, વાળ અને પાંખો.
- નજાસત (ગંદકી) ને દૂર કરવાની રીત:
- ૧- પાણીનો ઉપયોગ: નજાસત (અશુદ્ધતા) થી પાકી અને સફાઈની ખરેખર રીત તો પાણી વડે જ છે, એટલા માટે પાણીને છોડીને બીજુ કોઈ વસ્તુનો ઉપયોગ કરવામાં નહીં આવે.
 - ૨- શરીરાયતમાં કેટલીક નજિસ (અશુદ્ધ) વસ્તુઓને પાક કરવા માટે અન્ય રીત વર્ણન કરી છે: જે નીચે મુજબ છે:
- અ- મૃતકના ચામડાને દબાગત (સાફ કરવું) આપી પાક કરવામાં આવશે.

^૪ (અલુ મરી): તે રંગ વગરના પાતળા પાણીને કહે છે, જે પત્ની સાથે છેડધાડ, સંભોગને યાદ કરી, અથવા તેનો ઈરાદો કરતા, અથવા મનેચ્છાને ઉભારવાવાળી વસ્તુઓને જોઈ અથવા તેની માફક જ અન્ય વસ્તુના કારણે પેશાબની જગ્યા પરથી નીકળતા પાણીને કહે છે, અને ઘણી વાર ખબર પણ નથી પડતી, (અલુ વડી): આ જાડું સફેદ પાણી છે, જે પેશાબ કર્યો પછી અથવા ભારે વસ્તુ ઉઠાવવાના કારણે નીકળે છે.

બ- જો કોઈ વાસણમાં ફૂતનું મોકું નાખી દે તો તેને સાત વખત ધોવામાં આવશે અને પહેલી વખત માટી વડે ધોવામાં આવશે.

જ- જ્યારે કપડાં પર હૈઝનું લોહી લાગી જાય, તો તેને ઘસી તેના પર પાણીના છાંટા મારવા પૂરતા છે, તો પણ કોઈ નિશાન રહી જાય તો કોઈ વાંધો નથી.

દ- સ્રીના તે કપડાં જે જમીન પર નીચે અડતા હોય છે, તો તેના પછીની પાક માટી વડે તે પાક, સાફ થઈ જાય છે.

એ- દુધ પીતું બાળક જો કપડાં પર પેશાબ કરે તો તેના પર ફક્ત પાણી છાંટી દેવું પૂરતું છે, અને જો બાળકીનો પેશાબ લાગી જાય તો પછી તે કપડાંને પાણી વડે ધોઈ પાક કરવામાં આવશે.

ફ- મર્જી પર પણ પાણી છાંટવામાં આવે તો તે પાક થઈ જાય છે.

ગ- બુટ, ચઘપલનો નીચેનો ભાગ ઝમીન પર ઘસીને પાક કરવામાં આવશે.

હ- જો નજાસત (અશુદ્ધતા) ઝમીન પર હોય તો તેને પાક કરવાનો તરીકો એ છે કે તેના પર એક ડોલ પાણી વહાવી દેવામાં આવે, અથવા તળકો તેમજ હવામાં સૂકાવવા માટે છોડી દેવામાં આવે, જ્યારે નજાસતનો અસર ખતમ થઈ જાય તો ઝમીન પાક થઈ જાય છે.

ત્રીજો: તે અમલ જે હદ્ધ (નાપાક) વ્યક્તિ માટે હરામ છે:

તે વસ્તુઓ જે હદ્ધે અકબર મોટી ગંદકી હદ્ધે અસગાર અને નાની ગંદકી માટે હરામ છે:

૧- ફર્જ અને નફીલ નમાઝ:

તેની દલીલ ઈંઝે ઉમર રહીની ની હદીષ છે, તેઓ કહે છે કે નબી ﷺ એ કહ્યું:

«لَا يَقْبِلُ اللَّهُ صَلَوةً بَغْرِ طَهُورٍ»

«પાકી વગર નમાઝ કબૂલ કરવામાં નથી આવતી».⁵

૨- મુસહફ (કુરાયાન મજુદ) ને સ્પર્શ કરવું, રસૂલ ﷺ એ અમૃ બિન હિઝમને જે પત્ર લખ્યો હતો તેમાં કહ્યું: «મુસહફ ને ફક્ત પાક વ્યક્તિ જ પકડી શકે છે».⁶

૩- બૈતુલ્લાહનો તવાફ; કારણકે નબી ﷺ એ કહ્યું:

«الطواف بالبيت صلاة، إلا أن الله أباح فيه الكلام»

«બૈતુલ્લાહનો તવાફ નમાઝ છે, ફક્ત અલ્લાહ તઆલાએ તે સમયે વાત કરવાને હલાલ કહ્યું છે».⁷ અને આપ ﷺ એ તવાફ માટે વળ્યુ કર્યું હતું, અને એ પણ સાબિત છે કે આપ ﷺ એ હૈજ વાળી સ્ત્રીને તવાફ કરવા પર રોક લગાવી છે, જ્યાં સુધી તે પાક ન થઈ જાય.

નીચે ફક્ત તે વસ્તુઓનું વર્ણન કરવામાં આવી રહ્યું છે, જે ફક્ત હદ્દે અકબર (મોટી ગંદકી) માટે હરામ છે:

૧- કુરાયાન મજુદની તિલાવત કરવી; કારણકે અલી રહીની ની હદીષ છે:

(لَا يَحْجِبَهُ -يَعْنِي النَّبِيَّ ﷺ- عَنِ الْقُرْآنِ شَيْءٌ، لَيْسَ الْجَنَابَةُ)

⁵ મુસ્લિમ, હદીષ નંબર: (૨૨૪), (૧/૨૦૪૬) બાબ વૃજભૂત તહારતિ લિસ્ સલાતિ.

૬ મુઅત્તા ઇમામ માલિક, હદીષ નંબર: ૬૮૦/૨૧૬ (૨/૨૭૮), સુનન્ દારમી, હદીષ નંબર:

(૩૧૨) (૩/૧૪૫૫), મુસન્જફ અબ્ડુર રાઝાક, હદીષ નંબર: (૧૩૨૮) (૧/૩૪૧), અને ઇરવાઉલ ગલીલમાં ઇમામ અલ્બાની રહ. એ આ હદીષને સહીહ કહી છે. (૧૨૨) (૧/૧૫૮).

૭ મુસન્જિફ નસાઈ: (૧૨૮૦૮) (૩/૧૩૭), મુસન્દ અહમદ: (૧૫૪૨૩) (૨૪/૧૪), અને ઇરવાઉલ ગલીલમાં ઇમામ અલ્બાની રહ. એ આ હદીષને સહીહ કહી છે. (૧૨૧) (૧/૧૫૪).

(જનાબત (નપાકી) વગર કોઈ વસ્તુ અલ્લાહના રસૂલ ﷺ ને કરાયાનથી નહ્તી રોકતી).⁸

૨- વગ્રુ કર્યા વગર મર્સિદમાં રોકાવવું; કારણકે અલ્લાહ તથાલા એ કહ્યું:

(يَأَيُّهَا الَّذِينَ ءَامَنُوا لَا تَقْرِبُوا الصَّلَوةَ وَأَنْتُمْ سُكَّرَى حَتَّىٰ تَعْلَمُوا مَا تَقْوِلُونَ وَلَا جُنْبًا إِلَّا عَابِرِي سَبِيلٍ حَتَّىٰ تَغْتَسِلُوا...) [النساء: ٤٣]

{હે ઈમાનવાળાઓ ! જ્યારે તમે નશામાં હોય તો નમાઝની નજુક પણ ન જાઓ, જ્યાં સુધી પોતાની વાતને સમજવા ન લાગો અને જુનૂબી ગુસલ કર્યા વગર નમાઝની નજુક ન જાય} [અનુનિસા: ૪૩]. પરંતુ જો હદીષે અકબત (મોટી ગંદકી) વાળો વ્યક્તિ વુગ્રુ કરી લે તો મર્સિદમાં રોકાઈ શકે છે, અને જો મર્સિદ માંથી પસાર થઈ જાય તો પણ કંઈ વાંધો નથી,

ચોથું: પેશાબ પાખાનાના આદાબ:

પેશાબ પાખાના વખતે નીચેની વાતો મુસ્તહબ છે;

૧- લોકોથી દૂર જઈ પેશાબ અને પાખાના કરવું.

૨- શરૂઆતમાં આ દુઅા પઢવી જોઈએ,

«اللهم إني أعوذ بك من الخبرة والخبايئ»

«"અલ્લાહમ ઇજી અઉઝુબિક મિનલુ ખુબીસી વલુ ખબાઇસ" (હે અલ્લાહ ! હું નાપાક પુરુષ જિન અને નાપાક સ્ત્રી જિનથી તારી પનાહ માગું છુ)».⁹

⁸ ઈઙ્લે માજાહ, હદીષ નંબર: (૫૮૪) (૧/૧૮૫), ઈઙ્લે હિન્દુન, હદીષ નંબર: (૭૮૮) (૩/૭૮) અને ઇમામ અલ્બાની રહ. એ તિમિઝીમાં ઝઈક કહી છે. (૧૪૬) (૧/૧૪૬).

⁹ બુખારી, હદીષ નંબર: ૧૪૨ (૧/૪૦), મુસ્લિમમ હદીષ નંબર: ૧૨૨ (૨૮૩).

પેશાબ અને પાખાના કરતી વખતે જરૂરી બાબતો:

૧- પેશાબથી બચવું જોઈએ.

૨- ગુપ્તાંગને છુપાવવું.

અને પેશાબ પાખાના વખતે આ કાર્યો હરામ છે:

૧- કિબલા તરફ મોહું અથવા પીઠ કરવી.

૨- રસ્તા પર અથવા લોકોને બેસવાની જગ્યા પર પેશાબ પાખાના કરવો.

૩- જે પાણી વહેનું ન હોય તેમાં પેશાબ કરવી.

પેશાબ પાખાના વખતે મકરુહ બાબતો:

૧- જમણા હાથથી ગુપ્તાંગને અડવું.

૨- જમણા હાથથી પદ્ધતર અથવા ઇસ્તિનજા કરવું.

૩- વાતચીત કરવી, અને ખાસ કરીને અલ્લાહનો ઝિકર કરવો.

પાંચમું: પદ્ધતર વડે ઇસ્તિનજા કરવાનો હુકમ:

ઇસ્તિનજા: અર્થાત् પેશાબ અને સંડાસની જગ્યાએથી નીકળતી ગંદકીને પાણી વડે સાફ કરવું.

ઇસ્તિજમારનો અર્થ: પેશાબ અને સંડાસની જગ્યાએથી નીકળતી ગંદકીને પદ્ધતર અથવા ટિશું પેપર વડે સાફ કરવું.

જે વસ્તુથી ઇસ્તિજમાર કરવું હોય તેના વિશે કેટલીક શરતો:

૧- તે મુખાહ (જાઈઝ) હોય.

૨- તે પાક હોય.

- ૩- તેનાથી સફાઈ કરવી શક્ય હોય.
- ૪- હાડકું અથવા ગોબર (ધાણ) ન હોય.
- ૫- કોઈ પવિત્ર વસ્તુ ન હોય જેવું કે કોઈ વરક, જેમાં અલ્લાહનું નામ લખ્યું હોય.
- જો ફક્ત ઇસ્તિજ્માર જ કરવું હોય તો બે વસ્તુનો ખ્યાલ રાખવો જરૂરી છે:
- ૧- નીકળતી ગંદકી સામાન્ય જગ્યા સિવાય બીજે લાગેલી ન હોય.
 - ૨- ઇસ્તિજ્મારની ગુણવત્તા ધરાવતા ત્રણ અથવા ત્રણથી વધારે પથ્થર વડે ઇસ્તિજ્માર કરવું જોઈએ.

છું: વુઝુના આદેશો:

ત્રણ ઈબાદતો માટે વુઝૂ કરવું જરૂરી છે:

- ૧- નમાઝ: ફરજ હોય કે નફિલ.
- ૨- મુસહફ (કુરાઓન મજૂદ) ને પકડવા માટે.
- ૩- તવાફ.

વુઝૂ માટે શરતો:

- ૧- ઇસ્લામ.
- ૨- બૃદ્ધિશાળી હોવું.
- ૩- તમીજ.

૪- નિયત: જેની જગ્યા દિલ છે, શબ્દો વડે નિયત કરવી બીદઅત છે, અને જેણે વુઝૂ કરવાનો ઈરાદો કર્યો, તેણે નિયત કરી લીધી. જો

સફાઈ અથવા ઠંડક માટે કોઈ શરીરના ભાગને ધોવામાં આવે તો તે વુઝું નહીં ગણાય.

૫- નિયત કરી રાખવી કે જ્યાં સુધી વુઝું ખતમ ન થઈ જાય, આ નિયત ખતમ ન કરવી જોઈએ.

૬- જે વસ્તુ વુઝું કરવાને વાજિબ ન કરતી હોય, આ શર્તના કારણે જેને સતત પેશાબના ટીપાં ટપકતા હોય અથવા ઇસ્તિહાઝાવાળી સ્વીનો સમાવેશ નથી થતો.

૭- પેશાબ અને સંડાસ કરતા વુઝું પહેલા ઇસ્તિનજી અથવા ઇસ્તિજમાર કરવું.

૮- પાણીનું પાક અને હલાલ હોવું.

૯- ચામડી સુધી પાણી ન પહોંચે તે માટે જે વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે તેને હટાવવી.

૧૦- નમાઝનો સમય થઇ જવો જોઈએ.

વુઝુની ફરજો (જરૂરી બાબતો):

૧- ચહેરો ધોવો, કોગળા કરવા અને નાકમાં પાણી ચઢાવવું પણ તેમાં શામેલ છે.

૨- બજે હાથને કોળી સુધી ધોવા.

૩- સંપૂર્ણ માથાનો મસો અને બજે કાનનો મસો કરવો તેમાં શામેલ છે.

૪- ઘૂટી સુધી બજે પગ ધોવા.

૫- વુઝું કરતી વખતે તરતીબનો ઘ્યાલ કરવો.

૬- તસલ્સુલ (કોઈ કામ સતત કરવું: અંગોને ધોતી વખતે બે અંગો વચ્ચે અંતર ન હોવું જોઈએ.

વુજૂનો તરીકો:

- ૧- બિસ્મિલ્હાહ પઢવું.
- ૨- હથેળીઓને ત્રણ વખત ધોવી.
- ૩- ત્રણ વખત ચહેરો ધોવો, જેમાં કોગળા કરવા અને નાકમાં પાણી ચઢાવવું શામેલ છે.
- ૪- ત્રણ વખત કોળી સુધી હાથ ધોવા, પહેલા જમણો હાથ પછી ડાબો.
- ૫- કાન સાથે માથાનો મસો કરવો.
- ૬- ત્રણ વખત ધૂંટી સુધી પગ ધોવા, જમણો પગ પહેલા અને પછી ડાબો પગ.

જેના કારણે વુજૂ તૂટી જાય છે:

- ૧- પેશાબ અથવા સંડાસની જગ્યાએથી કંઈ પણ નીકળવું, ઉદાહરણ તરીકે, પેશાબ, હવા નીકળવી, સંડાસ.
- ૨- શરીર માંથી વધુ માત્રમાં નીકળતી કોઈ નાપાક વસ્તુ.
- ૩- ઊંઘ અથવા બીજા કોઈ કારણસર બુઝિ જતી રહેવી.
- ૪- આગળ પાછળ ગુપ્તાંગને કોઈ પણ આડ વગર સ્પર્શ કરવું.
- ૫- ઊઠનું માસ ખાવું.
- ૬- ઇસ્લામથી ફરી જવું- અલ્લાહ અમને અને દરેક મુસલમાનને બચાવે. (આમીન)

સાતમું: દરેક પ્રકારના મોજા પર મસો કરવાનો આદેશ:

- ૧- ખુફું: ચામડા વગેરેના મોજા.
- ૨- જવરબઃ: ઉલન અથવા રુથી બનેલા મોજા.

મસો કરવાની શરતો:

- ૧- સંપૂર્ણ તહારત પછી પહેરવા.
- ૨- તેનાથી કદમ અને ઘૂઠી છુપાય જાય.
- ૩- બંને મોજા પાક હોવા જોઈએ.
- ૪- મસો તેના સમયમાં કરવામાં આવે.
- ૫- મસો વુગ્ઝુમાં કરવામાં આવશે, ગુસલમાં નહીં.
- ૬- મોજા હલાલ હોવા જોઈએ, ચોરી કરેલા અથવા પુરુષો માટે રેશમના મોજા ન હોવા જોઈએ, કારણકે હરામ વસ્તુઓ દ્વારા આપેલ છૂટ અપનાવી શકતા નથી.

મસો કરવાનો સમયગાળો:

મુકીમ (રહેવાસી): અર્થાત् જે ઘરમાં હોઇ સકરમાં ન હોય તેના માટે એક દિવસ અને એક રાત સુધી. અને મુસાફર માટે ત્રણ દિવસ અને ત્રણ રાત સુધી.

મસો કરવાની રીત:

હાથને પાણીથી લીલા કરી, પગની અંગળીઓથી લઈ પિંડલી (ધૂંટીની ઉપર સુધીના ભાગમાં) મોજા પર એક વાર મસો કરવો.

મસાને બાતલ (અમાન્ય) કરનારી બાબતો:

૧- મસાનો સમયગાળો પૂરો થઈ જવો.

૨- બજે મોજા અથવા એક મોજાને પણ ઉતારી દેવા.

૩- હડખે અકબર (જેના કારણે ગુસલ વાજિબ થઈ જાય) પ્રાપ્ત થવી.

મોજા પર મસોકરવાનો હુકમ:

મસો કરવું પગ ધોવાથી બહેતર છે, કારણે આ અલ્લાહ તાદ્વાલા તરફથી ધૂટ છે, અને જેના કારણે આપ  નું અનુસરણ અને બિદઅતી લોકોનો વિરોધ થાય છે.

બનેજ, ડ્રેસિંગ અને પટી પર મસો કરવો:

જબાઇર: ફેકચર થયેલ શરીરના ભાગમાં કરવામાં આવતું પ્લાસ્ટર અથવા પાઠો.

અસાઈબ: કપડું વગેરે, જે જખમ, બળી ગયેલ અંગ પર બાંધવામાં આવે છે.

લુસૂક: સારવારના હેતુથી ફોલ્લી વગેરે પર બાંધવામાં આવતો પાઠો.

આ વસ્તુઓ પર મસો કરવાનો હુકમ:

જરૂરત વખતે જાઈજ છે, શરત એ કે જરૂરતની જગ્યા કરતા વધારે જગ્યા પર મસો કરવામાં ન આવે.

અને જ્યારે જરૂરત ખતમ થઈ જાય અથવા તેને ઉતારવા પર કોઈ તકલીફ ન થતી હોય તો મસો કરવો જાઈજ નથી.

આ વસ્તુ પર મસો કરવાનો તરીકો:

તેની આસપાસના ભાગને ધોવામાં આવે, અને પાઠ પર મસો કરવામાં આવે, અને જ્યાં પાઠો ન હોય તે ભાગમાં વુજૂ કરવામાં નહીં આવે.

આઠમું: તયમ્મુમના આદેશો:

તયમ્મુમ: પાકીની નિયત કરી માટી વડે એક ખાસ અંદાજમાં ચહેરા અને હાથ પર મસો કરવો.

તેનો આદેશ:

પાણી ન હોય અથવા પાણીનો ઉપયોગ કરવાની શક્તિ ન હોય તે સ્થતિમાં તો વુજૂ અને ગુસલના બદલામાં તયમ્મુમ કરવું વાજિબ છે.

તયમ્મુમ કરવાની હિકમત:

તયમ્મુમ મુહમ્મદ ﷺ ની ગુણવત્તા માંથી એક છે, આ અલ્લાહ તરફથી અહેસાન અને તેના તરફથી મળેલ છૂટ છે, પાછલી કોમ માટે આ આદેશ ન હતો.

જે સ્થિતિઓમાં તયમ્મુમ કરવું જરૂરી છે, તેનું વર્ણન:

- ૧- સફરમાં હોય અથવા ઘરે હોય તો પ્રયલ્ન કરવા છતાંચ પાણી ન મળે.
- ૨- પાણી તો હોય, પરંતુ પીવા માટે અને ખાવાનું બનાવવા માટે જ પૂરતું હોય, જો તેને પીવામાં આવે તો કોઈ માનવી અથવા જાનવર તરસ્યો રહી શકે છે.
- ૩- જો પાણીના ઉપયોગથી બીમારી વધવાનો ભય હોય, અથવા શિક્ષા પ્રાપ્ત થવામાં વાર લાગતી હોય.

૪- બીમારીના કારણે હલનયલન કરી શકતં ન હોય તો એવી સ્થિતિમાં કોઈ વુઝુ કરાવનાર પણ ન હોય અને સમય જતો રહેવાનો ભય હોય.

૫- જ્યારે પાણીના ઉપયોગથી ઠડક ચઢી જવાનો ભય હોય અને ગરમી પ્રાપ્ત કરવાનો કોઈ સ્વોત પણ ન હોય તો તયમુમ કરવું જાઈજ છે.

તયમુમ કરવાની રીત:

ખુલ્લી આંગળીઓ કરી હાથ માટી પર મારવા, પછી સંપૂર્ણ ચેહરા અને હથેળીઓ પર મસો કરવો.

તયમુમને બાતેલ (અમાન્ય) કરી દેનારી બાબતો:

૧- પાણી મળી આવવું, જો તયમુમ પાણીની અછતના કારણે કરવામાં આવ્યું હોય, અથવા પાણીનો ઉપયોગ કરવાની શક્તિ જો શક્તિ ન હોવાના કારણે તયમુમ કરવામાં આવ્યું હોય.

૨- વુઝુ અને ગુસલને બાતેલ કરવાવાળી દરેક વસ્તુઓથી તયમુમ પણ બાતેલ થઈ જાય છે. જેવું કે જનાબત (નાપાકી), હૈઝ અને નિફાસ.

જે વ્યક્તિ પાણી અને તયમુમ બજેનો ઉપયોગ ન કરી શકે તેના માટે ફુકમ:

જેને પાણી અથવા માટી ન મળે અથવા તેની પરિસ્થિતિ એવી હોય કે તે પાણી અથવા માટી ઉપયોગ નથી કરી શકતો, તો તે એવી જ સ્થિતિમાં નમાજ પઢશે, કારણકે અલ્લાહ તાદ્વાલા શક્તિ કરતા વધારે ભાર નથી આપતો અને તે નમાજને ફરી પણ નહીં પઢે, કારણકે તેણે ફરજ અદા કરી દીધું, કારણકે અલ્લાહ તાદ્વાલા એ કહ્યું:

(فَإِنَّكُمْ أَنَّ اللَّهَ مَا مَا أَسْتَطَعْتُمْ...) [التغابن: ٦]

{જ્યાં સધી તમારાથી શક્ય હોઈ ત્યાં સુધી અલ્લાહ થી ડરતા રહે} [અત્ત. તગાબુન: ૧૬].

અને આપ કહે છે:

«إِذَا أَمْرَتُكُمْ بِأَمْرٍ فَأَتُوا مَا مَا إِسْتَطَعْتُمْ»

«જ્યારે હું તમને કોઈ વસ્તુનો આદેશ આપું તો પોતાની શક્તિ પ્રમાણે તેના પર અમલ કરો».¹⁰

ફાયદો: જો જનાબતના (નાપાકીના) કારણે તયમ્મુમ કર્યું હોય અને પાણી મળી આવે તો ફરી ગુસલ કરશે.

નવમુ: હૈઝ અને નિફાસના આદેશો:

પહેલું: હૈઝ:

આ એક પ્રાકૃતિક લોહી છે, જે ખાસ સમયમાં ગર્ભાશય માંથી નીકળે છે, વધારે પડતું એક માસમાં છ કે સાત દિવસ હોય છે, અને ક્યારેક તેનાથી વધારે અથવા ઓછું પણ હોઈ શકે છે, અને સ્વી પોતાના પ્રાકૃતિક ઢાંચા પ્રમાણે તેનો મહિનો ક્યારેક લાંબો અને ક્યારેક ટૂંકો હોય છે.

હૈઝના આદેશો:

૧- હૈઝની સ્થિતિમાં સ્વી ન તો નમાજ પદ્ધશે અને ન તો રોજો રાખશે, અને ન તો તેના તરફથી નમાજ અને રોજા યોગ્ય ગણવામાં આવશે.

૨- હૈઝથી પાક થયા પછી રોજાની કાજા કરશે, નમાજની નહીં.

¹⁰ બુખારી, હદીષ નંબર: (૭૨૮૮) (૧૩/૩૦૮) મુસ્લિમ, હદીષ નંબર: (૫૦૫૬) (૮/૧૦૮).

૩- તેના માટે તવાક કરવો જાઈઝ નથી. અને તે કુરખાન પદ્ધી શક્તિ નથી, ન તો મસજુદમાં બેસી શકે છે, અને તેના પતિ માટે તેની સાથે ત્યાં સુધી સમાગમ કરવું હરામ છે જ્યાં સુધી તેનું હૈઝ ન રોકાઈ જાય, અને તેણી ગુસલ ન કરી લે.

૪- તે સિવાય તેનો પતિ તેની સાથે સમાગમ સિવાય તેણીથી ફાયદો ઉઠાવી શકે છે જેમ કે ચુંબન કરવું વગેરે.

૫- અને હૈઝની સ્થિતિમાં તેનો પતિ તેને તલાક પણ નથી આપી શકતો. અને તુહર (પાકી) નો અર્થ: લોહીનું રોકાઈ જવું, તો જયારે લોહી રોકાઈ જાય તો સ્વી પાક થઇ જાય છે, અને તેણીનો હૈઝનો સમયગાળો પૂરો થઇ જાય છે, અને ત્યારે તેના પર ગુસલ કરવું વાજ્ઞિબ થઇ જાય છે, ફરી જે કઈ બાબતો હૈઝના કારણે હરામ હતી તે દરેક કાર્યો કરી શકી છે. અને જો તે પાક થઇ ગયા પછી (હૈઝનું લોહી આવવાની જગ્યાએ) કોઈ ભીનાશ જેમકે માટી જેવા રંગનું કે પીળા રંગની પાણી જુએ તો તેને ગણવામાં નહીં આવે.

બીજું: નિફાસ:

નિફાસ તે લોહીને કહે છે જે પ્રસુતિના સમયે અથવા તેના પછી નીકળે છે, અને આ તે લોહી છે, જે ગર્ભ દરમિયાન જે ગર્ભાશયમાં રોકાઈ ગયેલું હોઈ છે.

અને નિફાસ, એ હૈઝ જેવું જ છે, પરંતુ તેમાં પણ સમાગમ સિવાય દરેક પ્રકારનો ફાયદો ઉઠાવી શકાય છે.

અને તે દરેક કાચો હરામ થઈ જાય છે જે હૈઝના કારણે હરામ થઈ જાય છે, જેમકે સમાગમ કરવું, નમાજ, રોઆ, તલાક આપવી, તવાફ કરવો, કુરાખાન પઢવું, મસ્જિદમાં રોકાવવું, અને એવી જ રીતે જયારે હૈઝની જેમ જયારે નિફાસનું લોહી રોકાઈ જાય તો ગુસલ કરવું વાજિબ થઈ જાય છે, અને હૈઝ જેવું જ રોઆની કાંઈ કરવી પડશે, નમાજની નહીં.

અને નિફાસનો સૌથી લાંબો સમયગાળો ચાળીસ દિવસ છે, પરંતુ જો ચાળીસ દિવસ પહેલા લોહી રોકાઈ જાય તો તેણીનો નિફાસનો સમયગાળો પૂરો થઈ જશે, જેથી તેણી ગુસલ કરશે, નમાજ પઢશે અને તે દરેક કાચો કરશે જે તેણીના માટે નિફાસના કારણે હરામ થઈ ગયા હતા.

બીજો વિભાગ: નમાઝ

પહેલું: અર્જાન અને ઇકામતના આદેશો:

અર્જાનનો આદેશ એક હિજરીસનમાં આપવામાં આવ્યો, અર્જાનનો આદેશ આપવાનું કારણ: જ્યારે મુસલામનોને નમાઝના સમયો જાણવા વિશે તકલીફ પડી તેઓ ચિંતા કરવા લાગ્યા કે તેની કોઈ નિશાની હોવી જોઈએ, તે દરમિયાન અફુલ્લાહ બિન જૈદ રહી. ને સપનામાં અર્જાન બતાડવામાં આવી, જેને અલ્લાહની વહી દ્વારા માન્ય ગણવામાં આવી.

અર્જાન: નમાઝનો સમય થઇ ગયો છે તેને જાહેર કરે છે, અને ઇકામત: નમાઝ ઉલ્લીલા થઇ જવાને કહે છે.

અર્જાન અને ઇકામત ફરજ નમાજો માટે પુરુષોની જમાયત માટે ફરજ કિફાયા છે, આ ઇસ્લામની દેખીતી નિશાનીઓ માંથી છે તેને છોડવું યોગ્ય નથી.

અર્જાનની શર્તો:

૧- અર્જાન આપનાર મોભિન પુરુષ હોઈ.

૨- અર્જાન તરતીબ પ્રમાણે (સંકલિત) હોવી જોઈએ.

૩- અર્જાન સર્ગા આપવામાં આવે.

૪- અર્જાન નમાઝનો સમય થઇ ગયા પાછી આપવામાં આવે, અને આ શર્તથી બે અર્જાનો અલગ છે ફરજ અને જુમાની પહેલી અર્જાન.

અર્જાનની સુન્નતો:

૧- બંને આંગળીઓ કાનમાં મુકવામાં આવે.

૨- નમાઝના શરૂના સમયે અર્જાન આપવી.

૩- હયા અલસ્ સલા અને હયા અલસ્ ફલા કહેતી વખતે ડાબે અને જમણે મોઢું ફેરવવું.

૪- અજાન આપનારનો અવાજ સારો હોઈ.

૫- અજાનના શબ્દો રુકી રુકીને કહેવા પરંતુ હદથી વધારે ન રોકાવવું.

૬- અજાનમાં દરેક શબ્દની છેલ્લે રોકાવવું.

૭- અજાન આપવી વખતે કિબલા તરફ હોવું.

૮- અજાનના પંદર શબ્દો છે, જેમકે નબી ﷺ ની હાજરીમાં બિલાલ રગી. હંમેશા અજાન આપતા હતા.

અજાનના શબ્દો:

(અલ્લાહુ અકબર): ચાર વખત.

(અશહદુ અલ લા ઇલાહ ઈલ્લલાહ): બે વખત.

(અશહદુ અજ મુહમ્મદન્ રસૂલુલ્લાહ): બે વખત.

(હયા અલસ્ સલા): બે વખત.

(હયા અલસ્ ફલા): બે વખત.

કરી કહેવું: (અલ્લાહુ અકબર) બે વખત.

કરી (લા ઇલાહ ઈલ્લલાહ) કહી અજાન ખત્મ કરવી: બે વખત.

અને ફજરમાં હયા અલસ્ ફલા કહ્યા પછી: (અસ્સલાતુ ઘૈરુમ મિનન્ નવમ) બે વખત કહેવું; કારણકે તે લોકોનો સુવાનો સમય હોઈ છે. અને ઇકામત માટેના બાર શબ્દો છે, જેનો હેતો મલ્લિદમાં બેઠેલા લોકોને સચેત કરવાનો છે તેથી તે શબ્દોને વધુ લાંબા કરી કહેવાની જરૂર નથી.

ઇકામતના શબ્દો નીચે પ્રમાણે છે:

(અલ્લાહુ અકબર): બે વખત.

(અશ્હદુ અલ્ લા ઇલાહ ઇલ્લાહ): એક વખત.

(અશ્હદુ અજ્ મુહમ્મદન્ રસૂલુલ્લાહ): એક વખત.

(હયા અલસ્ સલા): એક વખત.

(હયા અલસ્ ફલા): એક વખત.

(કદ કા મતિસ્ સલાહ): એક વખત.

(અલ્લાહુ અકબર): બે વખત.

(લા ઇલાહ ઇલ્લાહ): એક વખત.

અને અજાન સાંભળનાર માટે જાઈઝ છે તે અજાનના શબ્દોનો તેના જેવો જ જવાબ આપે, પરંતુ, (હયા અલસ્ સલા) અને (હયા અલસ્ ફલા) ની જગ્યાએ (લા હવલા વલા કુવ્વત ઇલ્લા બિલ્લાહ) કહે, ફરી નબી ﷺ પર દર્દું પઢે. ત્યાર પછી આ પ્રમાણે કહે:

«اللهم رب هذه الدعوة الناتمة، والصلوة القائمة، آت محمدًا الوسيلة والفضيلة، وابعثه مقامًا

محمودًا الذي وعدته، إنك لا تخلف الميعاد»

«અલ્લાહુમ રબ્ હાજિહિત્ દખવતિત્ તામ્માતિ, વસ્સલાતિલ્ કાઈમતિ, આતી મુહમ્મદ નિલ્ વસીલતિ વલ્ ફરીલતિ, બ્યાઅષ્ટુ મકામમ્ મહમુદ નિલ્લાજી વઅદતહ, ઇજ્જક લા તુજ્જિકુલ્ મિઅાદ» (હે અલ્લાહ ! તે સંપૂર્ણ દીન અને ઉભી થવાવાળી નમાજના પાલનહાર ! મુહમ્મદ ﷺ ને વસિલો અને મહાનતા નસીબ કર, અને તેમને મહમૂદ

નામની જગ્યા પર ઉભા કર, જેનું વચન તે એમને આપ્યું છે, ખરેખર તું વચન તોડવવાળો નથી).¹¹ અને કહે:

«رضيَتْ بِاللَّهِ رَبِّاً، وَبِالإِسْلَامِ دِينًا، وَمُحَمَّدًا نَبِيًّا». بِاللَّهِ رَبِّ الْعَالَمِينَ

«રાજીતુ બિલ્લાહી રબ્બવ વબિલુ ઇસ્લામિ દીના વબિ મુહમ્મદિન
નબિયા» (હું રાજુ છું અલ્લાહના પાલનહાર હોવાથી, અને ઇસ્લામના દીન હોવાથી, અને મુહમ્મદ ના નબી હોવાથી.)

કોઈ કારણ વગાર, પાછા જવાની નિયતથી અને અઝાન પછી મસ્જિદ માંથી નીકળવું હરામ છે.

અને જ્યારે બે નમાઝો ભેગી કરી પઢવામાં આવે તો અઝાન એક કહેવામાં આવશે અને ઇકામત દરેક નમાઝ માટે અલગ અલગ કહેવામાં આવશે.

બીજું: નમાઝનો દરજો અને તેની મહત્વતા:

નમાઝ શહાદતૈન (અલ્લાહ અને રસૂલની ગવાહી) પછી ઇસ્લામનો એક મહત્વનો રુક્ન (સ્તંભ) છે, અને ઇસ્લામમાં નમાઝનું એક મહત્વનું સ્થાન છે, અલ્લાહ એ તેને મેઅરાજની રાત્રે આકાશ પર પોતાના પથગંબર પર ફરજ કરી, જેનાથી તેની મહાનતા, અલ્લાહ પાસે તેને શ્રેષ્ઠ દરજો અને તેનું સંપૂર્ણપણે વાજિબ હોવું સ્પષ્ટ થાય છે.

નમાઝની મહત્વતા અને તેની ફરજિયાત વિષે ઘણી હદીષો વર્ણન કરવામાં આવી છે, નમાઝની મહત્વતા ઇસ્લામના જરૂરી કાર્યો માંથી છે.

¹¹ ઇને બાઝ રહી. મજમુઅલ ફિતાવા (૨૮/૧૪૧) માં કહે છે: (ઇમામ બ્યાહકી રહી. પાસે જાબીર રગી. ની સહીહ સનદ સાથે રિવાયતમાં નબી ના શબ્દ «અલ્લાહ વઅતાર» પછી «ઇજ્રક લા તુખ્લિકુલ મિયાદ» નો વધારો વર્ણન છે.

નમાજના ફર્જ અને સંપૂર્ણ વાજિબ હોવાની અમુક દલીલો નીચે વર્ણન કરવામાં આવી રહી છે:

૧- અલ્લાહ તથાલા કહે છે:

(إِنَّ الصَّلَاةَ كَانَتْ عَلَى الْمُؤْمِنِينَ كَتَبَنَا مَوْقُوتًا) [النساء: ٢٣]

{નિઃશંક નમાજ ઈમાનવાળાઓ માટે નક્કી કરેલ સમય પર પઢવી જરૂરી છે} [અનુનિસા: ૧૦૩]. અર્થાત്: તે સમયોમાં ફર્જ છે જે નબી ﷺ એ વર્ણન કર્યા છે.

૨- અલ્લાહ તથાલા કહે છે:

(وَمَا أُمِرُوا إِلَّا لِيَعْبُدُوا اللَّهَ مُخْلِصِينَ لَهُ الَّذِينَ حُنَفَاءُ وَبُقِيمُوا الصَّلَاةُ...) [البينة: ٥]

{તેઓને ફક્ત એ જ આદેશ આપવામાં આવ્યો હતો કે તેઓ ફક્ત અલ્લાહની જ ઈબાદત કરે અને અને દીનને નિખાલસતા સાથે અપનાવે, (એકાંતમાં) નમાજ કાયમ કરતા રહે} [અલ બિયનહ: ૫].

૩- અલ્લાહ તથાલા કહે છે:

(فَإِن تَابُوا وَأَقَامُوا الصَّلَاةَ وَءَاتُوا الزَّكُوَةَ فَإِخْرَجْنَاهُمْ فِي الْأَذِينِ) [التوبه: ٦٦]

{હજ પણ આ લોકો તૌબા કરી લે અને નમાજ પઢવા લાગે અને ઝકાત આપતા રહે તો તમારા દીની ભાઇ છે} [અત્ત. તૌબા: ૧૧].

૪- જાબિર રહી. થી રિવાયત છે કે નબી ﷺ એ કહ્યું:

«إِن بَيْنَ الرَّجُلِ وَبَيْنَ الشَّرِكِ وَالْكُفْرِ: تَرْكُ الصَّلَاةِ»

«ખરેખર માનવી, શિર્ક અને કુફ વચ્ચે તફાવત કરનાર: નમાજને છોડવું છે».¹²

¹² આ હદીષને ઈમામ મુસ્લિમ રહી. એ કિતાબુલ ઈમાનમાં વર્ણન કરી છે, હદીષ નંબર: (૮૨) (૧/૮૮).

પ્ર- બુરૈદહ રહી. કહે છે: નબી ﷺ એ કહ્યું:

«الْعَهْدُ الَّذِي بَيْنَا وَبَيْنَهُمُ الصَّلَاةُ، فَمَنْ تَرَكَهَا فَقَدْ كَفَرَ»

«અમારી અને તેમની (કાફિરો) વચ્ચે એક વચન છે અને તે છે, નમાજ, જે કોઈ નમાજ છોડી દેશે તો તેણે કુફ કર્યું». ¹³

અને જે કોઈ વ્યક્તિ નમાજને વાજિબ હોવાનો ઇન્જાર કરે તેના કાફિર થઈ જવા પર આલિમોનો ઈજમાય (એકમત) છે, રહી વાત કે જે વ્યક્તિ આળસના કારણે નમાજ છોડી દે તે સાચા મંતવ્ય પ્રમાણે તે પણ કાફિર થઇ જશે, તેની દલીલ ઉપર વર્ણન થઇ ચુકી છે, વધુ એ કે તે વાત પર સહાબાઓ પણ એકમતે છે.

ત્રીજું: નમાજની શર્તો:

૧- નમાજનો સમય થઇ જવો:

કારણકે અલ્લાહ તાલાલા એ કહ્યું:

إِنَّ الصَّلَاةَ كَانَتْ عَلَى الْمُؤْمِنِينَ كِتَابًا مَوْفُوتًا [النساء: ١٣]

{નિ:શંક નમાજ ઈમાનવાળાઓ માટે નક્કી કરેલ સમય પર પઢવી જરૂરી છે} [અન્ નિસા: ૧૦૩]. અર્થાત്: તે નક્કી સમયોમાં ફર્જ છે. અને ફર્જ નમાજોના સમયો નીચે મુજબ છે:

અ- ફજર: તુલૂએ ફજર (પરોઢ) થી લઇ સ્વોદય સુધી.

¹³ ઈમામ તિભિરી રહી. એ આ હદીષને કિતાબુલ ઈમાનમાં વર્ણના કરી છે, હદીષ નંબર: (૨૬૫) (૫/૧૪) ઈમાં તિભિરી રહી. એ કહ્યું: આ હદીષ હસન સહીહ અને ગરીબ છે, અને શૈખ અલ્બાની રહી. એ આ હદીષને સહીહ અત્ય તગીબ વત્ત તહીબમાં સહીહ કહી છે.

બ- ઓહર: સુરજનું જવાલ (ફળવા) થી લઈ ત્યાં સુધી જ્યારે દરેક વસ્તુના પડછાયાની લંબાઈ તેના બરાબર ન થઈ જાય.

જ- અસર: ઓહરનો સમય પૂરો થાય ત્યાંથી લઈ સુર્યાસ્ત સુધી.

દ- મગરીબ: સુર્યાસ્તથી લઈ સૂર્યની લાલાશ ગાયબ થઈ જાય ત્યાં સુધી.

હ- ઈશા: મગરીબનો સમય પૂરો થાય ત્યાંથી મધ્ય રાત સુધી.

૨- ગુપ્તાંગને ઢાંકવું:

ગુપ્તાંગનો અર્થ એ કે શરીરના તે ભાગ જેને ઢાંકવા જરૂરી છે, અને જેને ખુલ્લી જવા પર શરમ આવે, પુરુષનું ગુપ્તાંગઃ નાભિ થી લઈ ધૂંટણ સુધી છે, અને સ્ત્રી પોતાને ચહેરા સિવાય સંપૂર્ણ શરીર ઢાંકશે, અને ગેર મહરમ (તે પુરુષો જેની સામે સ્ત્રીને પરદો કરવો જરૂરી છે) સામે પોતાના ચહેરાને પણ ઢાંકશે.

૩- નજાસત (ગંદકી)થી દૂર રહેવું:

નજાસત (ગંદકી/અશુદ્ધતા) એટલે તે ગંદકીઓ જેના હોવાથી નમાજ થતી નથી, જેમકે પેશાબ, સંડાસ, લોહી વગેરે, આ ગંદકીઓ શરીર, કપડા અને જગ્યા પર હોઈ છે.

૪- કિબલા તરફ મોઢું કરવું:

કિબલો પવિત્ર કઅબહને કહે છે, તેને કિબલો એટલા માટે કેહવામાં આવે કેમકે લોકો તેની તરફ મોઢું કરી નમાજ પઢવામાં ન આવે તો તે નમાજ નહીં ગણાય; કારણકે અલ્લાહ તાયાલા એ કહ્યું:

(...وَحِينَتْ مَا كُنْتُمْ فَوَلُوا وُجُوهُكُمْ شَظَّرَهُ...) [البقرة: ١٦٦]

{અને તમે જ્યાં પણ હોવ, પોતાનું મોહું તેની જ તરફ કરો} [અલ્ બકરહ: ૧૪૪].

૫- નિયત:

નિયતનો શાબ્દિક અર્થ: ઈરાદો કરવો, અને શરિઅત પ્રમાણે: અલ્લાહ તાદુલની નિકટતા પ્રપાત કરવા માટે કોઈ ઈબાદત કરવાનો પાકો ઈરાદો કરવો.

નિયતનું સ્થાન દિલ છે, શબ્દો વડે તેને કહેવાની જરૂર નથી, પરંતુ તે તો બિદાયત થઇ જશે.

ચોથું: નમાઝના રુકનો:

નમાઝના ચોએ રુકન છે, જે નીચે મુજબ છે:

પહેલું રુકન: જો શક્તિ હોઈ તો ઉભા રહેવું:

કારણકે અલ્લાહ તાદુલા એ કહ્યું:

(...وَقُومُوا لِلَّهِ قَانِتِينَ) [البقرة: ٢٣٨]

{અને અલ્લાહ માટે અદબથી ઉભા રહો} [અલ્ બકરહ: ૨૩૮].
અને ઇમરાન રહીની હદીષ જેમાં તેઓ નબી ﷺ થી રિવાયત કરે છે:

«صل قائمًا، فإن لم تستطع فقاعداً، فإن لم تستطع فعلى جنب»

«ઉભા રહી નમાઝ પઢો, જો ઉભા રહી પઢવાની શક્તિ ન હોઈ તો બેસીને નમાઝ પઢો, અને જો બેસીને પણ પઢી શકતા ન હોવ તો પડખે સુતા સુતા નમાઝ પઢો». ¹⁴

¹⁴ બુખારી, હદીષ નંબર: (૧૧૧૭) (૨/૭૫૮) તિમિતી, હદીષ નંબર: (૩૭૨) (૨/૨૧૮).

અર્થાત् જો કોઈ બીમારીના કારણે ઉભા રહી નમાજ ન પઢી શકતા હોઈ તો બેસીને નમાજ પઢવી અને જો બેસીને પણ ન પઢી શકતા હોઈ તો સુતા સુતા પઢી લેવી, બીમારનું ઉદાહરણ: ભયભીત, નગ્ન વ્યક્તિ અને એવી જ રીતે જે વ્યક્તિને કોઈ બીમારીને કારણે બેસી રહેવું અથવા સૂઈ રેહવાનું હોઈ તો તેને ઉભા થવાની જરૂર નથી, એવી જ રીતે જે વ્યક્તિ કોઈ ઈમામની પાછળ નમાજ પઢતો હોઈ અને તે ઈમામ પાસે ઉભા ના રેહવાનું કારણ હોઈ તો દરેક લોકો તેની પાછળ બેસીને નમાજ પઢશે. અને રહી વાત નફિલ નમાજ, તો શક્તિ હોવા છતાય બેસીને નમાજ પઢવામાં કોઈ વાંધો નથી, પરંતુ આવું કરવામાં નેકીમાં ઘટાડો થઇ જશે.

બીજો રુકન: પહેલી તકબીરે તેહરીમા (અર્થાત् અલ્લાહુ અકબર કહેવું):

કારણકે નબી ﷺ એ કહ્યું:

«ثُمَّ اسْتَقْبِلَ الْقَبْلَةَ وَكَبَرَ»

«ફરી કિબલા તરફ મોહું કરો અને અલ્લાહુ અકબર કહો». ¹⁵

અને તેમાં (અલ્લાહુ અકબર) કહેવું જરૂરી છે અને તે સિવાય બીજું કઈ કહેવું પુરતું નહીં થાય.

ત્રીજો રુકન: સૂરે ફાતિહા પઢવી:

કારણકે નબી ﷺ એ કહ્યું:

«لَا صَلَاةٌ لِمَنْ لَمْ يَقْرَأْ بِفَاتِحَةِ الْكِتَابِ»

«તે વ્યક્તિની નમાજ નહીં ગણાય જેણે સૂરે ફાતિહા ન પઢી હોઈ». ¹⁶

¹⁵ બુખારી, હદીષ નંબર: (૬૨૫૧) (૧૧/૪૪) મુસ્લિમ, હદીષ નંબર: (૮૮૪) (૨/૩૩૦).

¹⁶ બુખારી, હદીષ નંબર: (૭૫૬) (૨/૩૦૯) મુસ્લિમ, હદીષ નંબર: (૮૭૨) (૪/૪૨૨).

ચોથો રુકનઃ દરેક રકાઅતમાં રુક્ષાય કરવું:

કારણકે અલ્લાહ તાયાલા એ કહ્યું:

﴿يَأَيُّهَا الَّذِينَ ءَامَنُوا أَرْكَعُوا وَأَسْجُدُوا...﴾ [الحج: ٧٧]

{હે ઈમાનવાળાઓ ! રુક્ષા, સિજદા કરતા રહો} [અલ્હ હજજ: ૭૭].

પાંચમો અને છઠો રુકનઃ

રુક્ષાથી ઉભા થવું અને પહેલાની જેમ સીધા ઉભા થઈ જવું, કારણકે નબી ﷺ હંમેશા આ અમલ કરતા રહ્યા. અને નબી ﷺ એ નમાઝ પઢવાવાળાને કહ્યું: «ફરી (પોતાનું માથું) ઉઠાવો અહી સુધીકે તમે સીધા ઉભા ન થઈ જાઉ».¹⁷

સાતમો રુકનઃ શરીરના સાત અંગો વડે સિજદો કરવો:

અને તે સાથ અંગો આ છે: કપાળ, બંને હાથ, બંને ધૂંટણો, અને પગાની આંગાજીઓ; કારણકે નબી ﷺ એ કહ્યું: «આપણને સાત અંગો વડે સિજદો કરવાનો આદેશ આપ્યો છે, કપાળ -અને નબી ﷺ પોતાના નાક તરફ ઈશારો કર્યો- બંને હથેણીઓ, બંને ધૂંટણો અને બંને પગાની આંગાજીઓ».¹⁸

આઠમો રુકનઃ સિજદો કરી ઉભા થવું અને બંને સિજદા દરમિયાન બેસવું:

કારણકે આયશા રહી.ની હદીષ છે:

«كَانَ النَّبِيُّ ﷺ إِذَا رَفَعَ رَأْسَهُ مِنَ السُّجْدَةِ، لَمْ يَسْجُدْ حَقِّ يَسْتَوِيَ جَالِسًا»

¹⁷ બુખારી, હદીષ નંબર: (૭૮૩) મુસ્લિમ, હદીષ નંબર: (૩૮૮).

¹⁸ બુખારી, હદીષ નંબર: (૮૧૨), મુસ્લિમ, હદીષ નંબર: (૪૬૦).

«નબી ﷺ જ્યારે સિજદો કરી ઉભા થતા તો ત્યાં સુધી બીજો સિજદો ન હતા કરતા જ્યાં સુધી બેસી ન જતા». ¹⁹

નવમો રુકન: નમાઝના દરેક રુકન શાંતિ પૂર્વક કરવા:

તે શાંતિ, ભલેને થોડી હોઈ, કારણકે નબી ﷺ એ નમાઝ પઢનારને કહ્યું: «અહીં સુધી કે તમે તેને શાંતિ પૂર્વક કરી ન લો». ²⁰

દસમો અને અગ્યારમો રુકન:

છેલ્લી તશહૃદની બેઠક: કારણકે ઇંને મસ્તિદ રહી. નબી ﷺ થી રિવાયત કરે છે:

«إِذَا صَلَى أَحَدُكُمْ فَلِيقلُ: التَّحِياتُ لِلَّهِ وَالصَّلَوَاتُ وَالطَّبَيَّاتُ، السَّلَامُ عَلَيْكَ أَيُّهَا النَّبِيُّ وَرَحْمَةُ اللَّهِ وَبَرَكَاتُهُ، السَّلَامُ عَلَيْنَا وَعَلَىٰ عِبَادِ اللَّهِ الصَّالِحِينَ، أَشْهَدُ أَنْ لَا إِلَهَ إِلَّا اللَّهُ وَأَشْهَدُ أَنَّ مُحَمَّداً عَبْدُهُ وَرَسُولُهُ»

«જ્યારે તમારા માંથી કોઈ નમાઝ પઢે તો કહે: "અત્તહિયાતુ લિલ્હાહિ વસ્સલવાતુ વત્તાયિબાતુ, અસ્સલામુઅલટ અચ્યુહન્ નબીયુ વરસ્તુલ્હાહિ વબરકાતુહુ, અસ્સલામુઅલટના વઅલા ઇબાદિલ્હાહિસ્ સોલિહીન, અશ્હદુ અલ્ લાઈલાહ ઇલ્હલાહુ વ અશ્હદુ અજ્ મુહમ્મદન્ અબ્કુહુ વરસ્તુલુહુ" ((મારી) દરેક પ્રકારની ઇબાદતો, જે જુબાન વડે થતી હોય, જે અંગો વડે થતી હોય, અને જે માલ વડે થતી હોય તે ફક્ત અલ્હાહ માટે જ છે, હે પથગંબર ! તમાર પર સલામતી થાય અને અલ્હાહની રહેમત અને તેની બરકતો નાઝિલ થાય, અમારા પર અને અલ્હાહ ના દરેક સદાચારી બંદાઓ પર પણ સલામતી નાઝિલ થાય, હું ગવાહી આપું છું, કે અલ્હાહ સિવાય કોઈ

¹⁹ મુસ્લિમ, હદીષ નંબર: (૪૮૮).

²⁰ બુખારી, હદીષ નંબર: (૭૨૪), મુસ્લિમ, હદીષ નંબર: (૩૮૮) (૬/૩૮૮).

ઇલાહ(ઇબાદત ને લાયક) નથી અને હું ગવાહી આપું છું કે મુહમ્મદ સલ્લાહુ અલાહિ વસલ્લમ તેના બંદા અને રસૂલ છે)».²¹

બારમો રુકન: છેલ્લા તશહૃદની બેઠકમાં નબી ﷺ પર દર્દે પઢવું:
અને તે કહે:

«اللهم صلّى على محمد»،

«હે અલ્લાહ ! તું અમારા નબી મુહમ્મદ ﷺ પર સલામતી ઉતાર».
અને તેનાથી વધારે કહેવું સુજ્ઞત છે.

તેરમો રુકન: દરેક રુકન એક પછી એક તરતીબ સાથે કરવા:
કારણકે નબી ﷺ તરતીબ સાથે કરતા હતા, તેમણે કહ્યું:

«صلوا كما رأيتموني أصلني».

«તમે એવી રીતે નમાઝ પઢો જીવી રીતે તમે મને નમાઝ પઢતા જુઓ છો». અને ફરી આ તરતીબની શિખામણ નબી ﷺ એ નમાઝમાં ભૂલ કરનાર વ્યક્તિને પણ આપી હતી.

ચૌદમું રુકન: સલામ ફેરવવું:
કારણકે નબી ﷺ એ કહ્યું:

«وختامها التسليم»-

«અને સલામ વડે તેને પૂર્ણ કરો».
અને કહ્યું:

«وتحليلهما التسليم»

«નમાઝ માંથી હલાલ થવાનો તરીકો સલામ છે».²²

²¹ બુખારી, હદીષ નંબર: (૭૮૭), મુસ્લિમ, હદીષ નંબર: (૪૦૨).

²² બુખારી: હદીષ નંબર: (૧૧૧૦) (૨/૪૩૮).

પાંચમું: નમાજની દરજો:

અને તે નવ છે:

- ૧- તકબીરે તહરીમા (પહેલી તકબીર) સિવાયની બધી તકબીરો.
- ૨- દુફ્રાખમાં એક વખત «સુભાન રબ્બી અલ અઝીમ» કહેવું, ત્રણ વખત કહેવું સુજ્ઞત છે અને તે કમાલનો નીચો દરજો છે, અને દસ વખત કહેવું તે ઉંચ્ય દરજો છે.
- ૩- જો ઈમામ હોઈ અથવા એકલો નમાજ પઢનાર હોઈ તો દુફ્રાખમાંથી ઉભા થતી વખતે «સમિઅલ્લાહુ લિમન હમિદ્હ» કહેવું જરૂરી છે.
- ૪- દુફ્રાખ માંથી સીધા ઉભા થતી વખતે «રબ્બના વલકલ હમ્ડ» કહેવું.
- ૫- સિજદામાં એક વખત «સુભાન રબ્બીયલ અખલા» કહેવું.
ત્રણ વખત કહેવું સુજ્ઞત છે.
- ૬- બજે સિજદાની વચ્ચે «રબ્બી કિલ્લી» કહેવું.
ત્રણ વખત કહેવું સુજ્ઞત છે.
- ૭- પહેલી તશહુદની બેઠક: જેમાં આ દુઆ પઢવામાં આવશે:

«التحيات لِلَّهِ، والصلوات والطيبات، السلام عليك أَيُّهَا النَّبِيُّ ورَحْمَةُ اللهِ وبركاتهِ، السلام
علينا وعلى عباد الله الصالحين،أشهد أن لا إله إلا الله، وأشهد أن محمداً عبده ورسوله».»

«"અતાહિયાતુ લિલ્લાહિ વસ્સલવાતુ વત્તાચ્ચિબાતુ, અસ્સલામુઅલટક
અચ્યુહન્ નબીયુ વરક્ષતુલ્લાહિ વબરકાતુહ, અસ્સલામુઅલઅના વઅલા
ઇબાદિલ્લાહિસ્ સોલિહીન, અશ્હદુ અલ લાઈલાહ ઇલ્લલાહ વ અશ્હદુ
અજ્જ મુહમ્મદન્ અબ્દુહ વરસ્લુહ" ((મારી) દરેક પ્રકારની ઇબાદતો, જે

જુબાન વડે થતી હોય, જે અંગો વડે થતી હોય, અને જે માલ વડે થતી હોય તે ફક્ત અલ્લાહ માટે જ છે, હે પચ્ચાંબર ! તમાર પર સલામતી થાય અને અલ્લાહની રહેમત અને તેની બરકતો નાઝિલ થાય, અમારા પર અને અલ્લાહ ના દરેક સદાચારી બંદાઓ પર પણ સલામતી નાઝિલ થાય, હું ગવાહી આપું છું, કે અલ્લાહ સિવાય કોઈ ઇલાહ(ઇબાદત ને લાયક) નથી અને હું ગવાહી આપું છું કે મુહમ્મદ સલ્લાહુ અલહિ વસ્તુભરું તેના બંદા અને રસૂલ છે)»

૮- પ્રથમ તશ્હેહુદમાં બેસવું.

ઇન્દ્રાંજિની સુજ્ઞતો:

સુજ્ઞતો ઇંડી દેવાથી નમાજ બાતેલ (અમાન્ય) નહીં થાય, સુજ્ઞતો એ પ્રકારની હોઈ છે: કહેવાની સુજ્ઞતો અને કરવાની સુજ્ઞતો.

પ્રથમ: કહેવાની સુજ્ઞતો:

૧- દુઆએ ખના, અને તેના ઘણા શબ્દો વર્ણન કરવામાં આવ્યા છે, જે નીચે મુજબ છે:

«"સુખાનકલ્લાહુમ્મ વબિહમિદ્ક વતબારકસ્મુક વતઆલા જદુક
વલા ઈલાહ ગાયકુક" (હે અલ્લાહ તું પાક છે અને દરેક પ્રકારના
વખાણ ફક્ત તારા જ માટે છે, તારું નામ બરકતવાળું છે અને તું
બુજુર્ગ અને ઉંચ્ય છે, તારા સિવાય કોઈ સાચો ઇલાહ નથી)».

૨- સુરે ફાતિહા પઢતા પહેલા અલ્લાહ પાસે પનાહ માંગવી.

અને તેમાં કહેવું: «"અગ્રિજુબિલ્લાહિ મિનશ્ શૈતોનિર્ રજુમ" (કું અલ્લાહની પનાહમાં આવું છું ધૃતકારેલા શેતાનથી)».

૩- કુરઆન પઢતા પહેલા બિસ્મિલ્લાહ પદવું,

«"બિસ્મિલ્લાહિર્ રહમાનિર્ રહીમ" ((શરૂ કરું છું) અલ્લાહના નામથી જે અત્યંત દયાળુ અને કૃપાળુ છે».

૪- રુક્ષાય અને સિજદામાં એક થી વધુ વખત તસ્બીહ પઢવી.

૫- એકથી વધુ વખત કહેવું:

«رَبِ اغْفِرْ لِي»

«"રબિબિગ્ કિલ્લી" (હે મારા પાલનહાર ! તું મને માફ કરી દે)»

બજે સિજદાની વચ્ચે .

૬- કહેવું:

«مَلَءَ السَّمَاوَاتُ، وَمَلَءَ الْأَرْضَ، وَمَلَءَ مَا بَيْنَهُمَا، وَمَلَءَ مَا شَتَّى مِنْ شَيْءٍ بَعْدَ»

«"મિલઉસ્ સમાવાતિ, વ મલઉલ અર્જિ, વ મલઉ મા બધનહુમા, વ મલઉ મા શિઅતમિન શૈઈન બઅદ" (હે અલ્લાહ ! તારા જ માટે પ્રશંસા છે એટલી પ્રશંસા જેનાથી આસમાન અને ઝમીન ભરાઈ જાય અને તે બંનેની વચ્ચેનું પણ ભરાઈ જાય અને તેના પછી જે વસ્તુ ઈચ્છે, તે ભરાઈ જાય)».

«"રબ્બના વલકલ હમદ" (હે અમારા પાલનહાર ! દરેક પ્રકારના વખાણ તારા માટે જ છે)» કહ્યા પછી.

૭- સુરે ફાતિહા પઢયા પછી કુરઆન પદવું.

૮- કહેવું:

«اللهم إني أعوذ بك من عذاب جهنم، ومن عذاب القبر، ومن فتنة الخيا والممات، ومن فتنة المسيح الدجال».»

«" અલ્લાહુમ ઇજી અઉઝુબિક મિન અઝાબી જહન્જમ, વમિન અઝાબિલ્ કબ્રી, વમિન ફિલ્નતિલ્ મહ્યા વલ્ મમાત, વમિન ફિલ્નતિલ્ મસીહીદ દજજાલ" (હે અલ્લાહ ! હું તારી પનાહ માંગુ છું કબરના અઝાબથી અને જહન્જમના અઝાબથી અને જિંદગી અને મૌતના ડિતનાથી અને મસીહ દજજાલના ફિતનાની બુરાઈ થી)».

ત્યારબાદ છેલ્લા તશહુદમાં જે દુઆ ઈચ્છે પઢી શકે છે.

બીજું: કરવાની સુન્નતો:

૧- ચાર જગ્યાઓમાં કાન અથવા ખભા સુધી હાથ ઉઠાવવા.

અ- પ્રથમ તકબીરે તહરીમા કહેતી વખતે.

બ- રુક્ષાયમાં જતી વખતે.

જ- રુક્ષાયથી ઉભા થતી વખતે.

દ- તીજુ રકાયત માટે ઉભા થતી વખતે.

૨- કિયામની સ્થિતિમાં રુક્ષા પહેલા હોઇ કે પછી, જમણો હાથ સાબા હાથ પર મુકવો.

૩- નજર સિજદાની જગ્યાએ રાખવી.

૪- સિજદો કરતી વખતે બંને પડખાને હાથથી દૂર રાખવા.

૫- બંને સિજદા દરમિયાન જાંધને પેટથી દૂર રાખવી.

૬- નમાજની દરેક બેઠકોમાં પગાને ફેલાવેલા રાખવા, પરંતુ ફક્ત ત્રણ અને ચાર રકાઅતવાળી નમાજોમાં આવું ન કરવું.

૭- ત્રણ અને ચાર રકાઅતવાળી નમાજમાં છેલ્લા તશ્હેહુદમાં તવ્વરુક કરવું.

સાતમું: નમાજ પઢવાનો તરીકો:

૧- નબી ﷺ જ્યારે નમાજ પઢવા માટે ઉભા થતા તો કિબલા તરફ મોહું કરી બંને હાથ ઉઠાવતા અને હાથની હથેજીઓ કિબલા તરફ રાખતા, અને કહેતા:

«الله أكبير»

«"અલ્લાહુ અકબર" (અલ્લાહ સૌથી મોટો છે)».

૨- ફરી ડાબા હાથને જમણા હાથ વડે પકડી છાતી પર મુકતા.

૩- ફરી દુઆએ ઘના પઢતા, અને હંમેશા એક જ દુઆ ન હતા પઢતા, દુઆએ ઘના વિષે આપ ﷺ દ્વારા જેટલી પણ દુઆઓ સાબિત છે, તે પઢવી જાઈા છે, તેમાંથી એક નીચે મુજબ છે:

«سُبْحَانَكَ اللَّهُمَّ وَحْمَدُكَ، وَتَبَارَكَ اسْمُكَ، وَتَعَالَى جَدُّكَ، وَلَا إِلَهَ غَيْرُكَ.»

૪- «"સુફ્રાનકલ્લાહુમ્ વાબિહમિદ્ક વતબારકસ્મુક વતઆલા જદુક
વલા ઈલાહ ગાયરુક" (હે અલ્લાહ તું પાક છે અને દરેક પ્રકારના
વખાણ ફક્ત તારા જ માટે છે, તારું નામ બરકતવાળું છે અને તું
મહાન અને ઉંચ્ય છે, તારા સિવાય કોઈ સાચો ઈલાહ નથી)».

૫- ફરી કહેતા: અઉજુબિલ્લાહિ મિનશ શૈતોનિર રજુમ,
બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ.

૬- ફરી સુરે ફાતિહા પઢતા, અને જ્યારે સુરે ફાતિહા પૂરી થઇ જતી
તો કહેતા: «આમીન».

૬- ફરી જેટલું શક્ય હોઈ તેટલું કુરઆન પઢતા, ફજર, મગરીબ અને દીશાની નમાઝમાં પહેલી બે રકાઅતોમાં ઊંચા અવાજથી કુરઆન પઢતા, અને બે રકાઅત સિવાય બીજુ રકાઅતમાં ઊંચા અવાજે કુરઆન પઢતા ન હતા, અને દરેક નમાઝમાં પહેલી રકાઅત બીજુ રકાઅતથી લાંબી હોતી હતી.

૭- ફરી રફુલ યદૈન (બંને હાથ ઉઠાવતા) જેવી રીતે શરૂઆતમાં ઉઠાવ્યા હતા, ફરી «અલ્લાહુ અકબર» કહી, તુફાનમાં જતા, ફરી ખુલ્લી આંગળીઓ સાથે બજે હાથ વડે બંને ધૂંટણ પકડતા, પોતાની પીઠ સીધી કરી માથું તેની બરાબર કરતા, ન તો વધારે ઉપર ન તો નીચે, ફરી કહેતાઃ

«سبحان رب العظيم»

«"સુઘનન રબ્બિયલ અઝીમ" (મારો પાલનહાર ધણો જ બુલંદ છે)». એક વખત કહેવું જરૂરી છે, એ ત્રણ વખત કહેવું તે કમાલનો નીચો દરજો છે, જેવું કે પાછળ વર્ણન થઈ.

૮- ફરી તુફાન માંથી «"સમિઅલ્લાહુ લિમન હમિદહ" (અલ્લાહ એ સાંભળ્યું, જેણે તેની પ્રસંશા કરી)» કહી માથું ઉઠાવતા, ફરી રફુલ યદૈન કરતા (બંને હાથ ઉઠાવતા) જેવી રીતે તુફાનમાં જતી વખતે કર્યું હતું.

૯- ફરી સીધા ઉભા થઈ આ દુચા પઢતાઃ

«اللهم ربنا ولك الحمد، حمداً كثيراً طيباً مباركاً فيه، ملء السماء، وملء الأرض، وملء ما بينهما، وملء ما شئت من شيء بعد، أهل الثناء والحمد، أحق ما قال العبد، وكلنا لك عبد، لا مانع لما أعطيت، ولا معطي لما منعت، ولا ينفع ذا الجد منك الجد».»

«"અલ્લાહુમ્મ રબ્બના વલકલ હ્મદ, હ્મદન કષિરન તાયિબન મુખારકન ફીહ, મલઉસ સમાવાતિ, વ મલઉલ અર્જિ, વ મલઉ મા બથનહુમા, વ મલઉ

મા શિઅત મિન્ શૈઈન બઅદ, અહલુષ ધનાઈ વલુ મજદ, અહક્કુ મા કાલલુ અબદ, વકુલના લકલુ અબદ, લા માનિએ લિમા અઅતયત, વલા મુઅતિય લિમા મનઅત, વલા યન્કડ જલુ જદુ મિન્કલુ જદુ" (હે અલ્લાહ ! અમારા પાલનહાર ! દરેક પ્રકારની બરકતવાળી પ્રસંશા તારા માટે જ છે, એટલી પ્રશંસા જેનાથી આસમાન અને ઝમીન ભરાઈ જાય અને તે બંનેની વચ્ચેનું પણ ભરાઈ જાય અને તેના પછી જે વસ્તુ ઈચ્છે, તે ભરાઈ જાય, હે વખાણ અને વરિષ્ઠતાને લાયક ! -સૌથી સારી વાત જે બંદા એ કહી- જયારેકે અમે સૌ તારા જ બંદા છે, હે અલ્લાહ તું જે આપી હે તેને કોઈ રોકવાવાળું નથી અને જે તું રોકી લે તે કોઈ આપવા વાળું નથી, અને કોઈ વરિષ્ઠને તેની ઉંચ્યતા કોઈ ફાયદો પહોંચાડશે નહીં)».

અને આપ ધણી વાર સુધી આ સ્થિતિમાં સીધા ઉભા રહેતા..

૧૦- ફરી તકબીર (અલ્લાહ અકબર) સિજદામાં જતા, અને બંને હાથ ન ઉઠાવતા, કપાળ, નાક, બંને હાથ, ધૂંટણો અને પગની આંગણીઓ વડે સિજદો કરતા, આંગણીઓ અને પગ કિબ્લા તરફ હોતા, પીઠને સીધી રાખતા, કપાળ અને નાકને જમીન પર મૂકી દેતા, ને બંને હથેળીઓ નીચે મૂકી કોણીને ઉપર ઉઠાવી સિજદો કરતા, બંને બાજુના પડખાને બગલોથી દૂર રાખતા, અને પેટને જાંધોથી અલગ, અને પગને જાંધોથી અલગ રાખતા, અને પોતાના સિજદામાં કહેતા: «"સુખાન રબ્બિયલુ અઝીમ" (મારો પાલનહાર ધણો જ બુલંદ છે)». એક વખત કહેવું જરૂરી છે, એ ત્રણ વખત કહેવું તે કમાલની નીચો દરજો છે, જેવું કે પાછળ વર્ણન થઈ. તે સિવાય બીજુ જે દુઅાઓ સાબિત છે તે પણ પઢી શકાય છે.

۱۱- પછી «અલ્લાહુ અકબર» કહી સિજદા માથું ઉઠાવતા. ફરી ડાબા પગને ફેલાવી તેના ઉપર બેસી જતા, અને જમણા પગને ઉભો રાખતા, ફરી બંને હાથને જાંધો પર મૂકી આ દુઅા પઢતા:

«اللَّهُمَّ اغْفِرْ لِي وَارْحَمْنِي، وَاجْبِرْنِي، وَاهْدِنِي، وَارْزُقْنِي».

«"અલ્લાહુમ્મગ! કિલ્લી વહ્મની, વજ્બુની, વહ્દિની, વર્જુકની" (હે અલ્લાહ ! તું મને માફ કરી દે, મારા પર રહમ કર, મારા નુકસાન પૂરા કરી દે, મને હિદાયત આપ, અને મને રોજુ આપ)».

۱۲- ફરી તકબીર (અલ્લાહુ અકબર) કહી બીજો સિજદો એવી જ રીતે કરતા જેવી રીતે પહેલા કર્યો હતો.

۱۳- ફરી તકબીર (અલ્લાહુ અકબર) કહી પોતાનું માથું ઉઠાવતા, અને ધૂંટણો અને જાંધો પર ભાર આપી સીધા ઉભા થઈ જતા.

۱۴- સીધા ઉભા થઈ ગયા પાછી કુરાન પઢવાનું શરૂ કરતા, પછી બીજુ રકાત પણ પહેલી રકાત જેવી જ અદા કરતા.

۱۵- ફરી પહેલા તશહુદની બેઠકમાં બેસતા, જેવી રીતે બંને સિજદા દરમિયાન બેઠા હતા, અને પોતાનો જમણો હાથ જમણી જાંધ પર અને ડાબ્બો હાથ ડાબી જાંધ પર મુકતા, અને મોટી આંગણીને વાળી હલકો બનાવતા, અને પહેલી આંગણી વડે ઈશારો કરી તેની તરફ જોતા, અને ફરી કહેતા:

«التحيات لله والصلوات، والطيبات، السلام عليك أباها النبي وبركاته، السلام علينا وعلى عباد الله الصالحين،أشهد أن لا إله إلا الله وحده لا شريك له، وأشهد أن محمداً عبده ورسوله»

«"અતહિયાતુ લિલ્લાહિ વસ્સલવાતુ વત્તાથ્યિબાતુ, અસ્સલામુઅલટક
અયુહનું નબીયુ વરભતુલ્લાહિ વબરકાતુહુ, અસ્સલામુઅલઅના વઅલા
ઈબાદિલ્લાહિસ્ સોલિહીન, અશહદુ અલ લાઈલાહ ઇલ્લાહુ વ અશહદુ અજ્ઞ
મુહમ્મદનું અબ્દુહુ વરસૂલુહુ" ((મારી) દરેક પ્રકારની ઈબાદતો, જે જુબાન
વડે થતી હોય, જે અંગો વડે થતી હોય, અને જે માલ વડે થતી હોય તે ફક્ત
અલ્લાહ માટે જ છે, હે પચ્ચાંબર ! તમાર પર સલામતી થાય અને અલ્લાહની
રહેમત અને તેની બરકતો નાજિલ થાય, અમારા પર અને અલ્લાહ ના દરેક
સદાચારી બંદાઓ પર પણ સલામતી નાજિલ થાય, હું ગવાહી આપું છું, કે
અલ્લાહ સિવાય કોઈ ઇલાહ(ઈબાદત ને લાયક) નથી અને હું ગવાહી આપું
છું કે મુહમ્મદ સલ્લાહુ અલહિ વસ્તુલમ તેના બંદા અને રસૂલ છે)»

અને થોડી વાર બેસતા.

૧૬- ફરી તકબીર (અલ્લાહુ અકબર) કહી ઉભા થઇ જતા, પછી
ત્રીજી અને ચોથી રકઅત પહેલી બે રકઅતો કરતા નાની પઢતા, અને
તે બંનેમાં સૂરે ફાતિહા પઢતા.

૧૭- ફરી તવ્વરુક કરી છેલ્લા તશહ્હુદમાં બેસતા, અને તવ્વરુક
કહે છે: નમાજ પઢવાવાળો પોતાના ડાબા પગાને ફેલાવી જમણા
પગાને તેની નીચેથી કાઢી જમણા પગાને ઉભો કરી જમીન પર બેસે.

૧૮- ફરી છેલ્લા તશહ્હુદમાં પણ તે દુઅાઓ પઢવી જે પહેલા
તશહ્હુદમાં પઢી હતી, અને તેમાં આ પણ વધારો કરો:

«اللهم صل على محمد وعلى آله محمد، كما صليت على آل إبراهيم، إنك حميد مجيد،
وبارك على محمد وعلى آله محمد، كما باركت على آل إبراهيم، إنك حميد مجيد».»

«"અલ્લાહુમ સલ્લી અલા મુહમ્મદિવ વઅલા આલી મુહમ્મદ, કમા સલ્લયતા અલા ઈબ્રાહીમ વઅલા આલી ઈબ્રાહીમ ઈજ્રક હમીદુમ મજૂદ, અલ્લાહુમ બારિક અલા મુહમ્મદિવ વઅલા આલી મુહમ્મદ, કમા બારકતા અલા ઈબ્રાહીમ વઅલા આલી ઈબ્રાહીમ ઈજ્રક હમીદુમ મજૂદ" (હે અલ્લાહ ! મુહમ્મદ અને તેમની સંતાન પર રહેમતો નાઝિલ કર જેવી રીતે તે ઈબ્રાહીમ અને તેમની સંતાન પર રહેમતો નાઝિલ કરી, ખરેખર તું વખાણને લાયક અને બુજુગ્ગિવાળો છું, હે અલ્લાહ ! મુહમ્મદ અને તેમની સંતાન પર બરકતો નાઝિલ કર જેવી રીતે તે ઈબ્રાહીમ અને તેમની સંતાન પર બરકતો નાઝિલ કરી, ખરેખર તું વખાણને લાયક અને બુજુગ્ગિવાળો છું)».

ફરી કબરના અજાબથી અને જહન્જમના અજાબથી અને જિંદગી અને મૌતના ફિતનાથી અને મસીહ દજાલના ફિતનાની બુરાઈ થી અલ્લાહ પાસે પનાહ માંગતી, અને જે દુઆઓ કુરાન અને હદીષમાં વર્ણન કરવામાં આવી છે તે દુઆઓ પઢે.

૨૦- જમણી તરફ મોહું કરતા કહે:

«السلام عليكم ورحمة الله،»

«અસ્સલામુ અલયકુમ વરહમતુલ્લાહ».

અને ડાબી બાજુ પણ મોહું ફેરવી આ પ્રમાણે જ કહેશે, કિબ્લા તરફ મોહું કરી સલામ કરવાનું શરૂ કરે અને જ્યાં સુધી તે મોહું ફેરવે ત્યાં ખત્મ કરે.

આઠમું: નમાઝ દરમિયાન ન કરવાના કાર્યો:

૧- કોઈ કારણ વગાર આજુ બાજુ જોવું.

૨- આકાશ તરફ નજર કરવી.

- ૩- કોઈ કારણ વગાર આંખો બંધ કરવી.
- ૪- સિજદો કરતી વખતે પડખા ફેલાવી દેવા.
- ૫- કોઈ કારણ વગાર નાક અને મોઢું ઢાંકવું.
- ૬- પેશાબ પાણીની જરૂરત વખતે અથવા એવા ખાવા પીવાના સમયે નમાઝ પછ્યી જેમાં તેની સખત જરૂરત હોઈ.
- ૭- સિજદો કરતી વખતે કપાળ અથવા નાક પર કઈ ચોટી જાય તેને સાફ કરવું, પરંતુ જો નમાઝ પછી સાફ કરે તો કોઈ વાંધો નથી.
- ૮- જરૂરત ન હોઈ તો પણ દીવાલને ટેક લગાવવો.

નવમું: નમાઝને બાતેલ કરવાવાળી બાબતો:

- ૧- ખાવું-પીવું.
- ૨- નમાઝ બહારની વાતો કરવી.
- ૩- હસવું.
- ૪- જાણતા હોવા છતાં કોઈ રુકન કે વાજિબ કાર્યને છોડી દેવું.
- ૫- જાણતા હોવા છતાં કોઈ રુકન કે રકાયતનો વધારો કરવો.
- ૬- હેતુ સર ઈમામ પહેલા સલામ ફેરવવું.
- ૭- નમાઝ બહારના બિનજરૂરી કાર્યો કરવા.
- ૮- નમાઝની કોઈ શર્ત વિરુદ્ધ કાર્ય કરવું, જેમકે વગ્ની તૂટી જવું, હેતુ સર ગુપ્તાંગ જહેર થવા, બિનજરૂરી કિબ્લાથી હતી જવું અને નિયત ખત્મ કરી દેવી.

દસમું: સજદાએ સહવ (નમાઝમાં કોઈ ભૂલચૂક થઇ હોઈ ત્યારે કરવામાં આવતો સિજદો):

સહવનો અર્થ: ભૂલ છે, અને નમાઝમાં નબી ﷺ થી પણ ભૂલ થઇ હતી, કારણકે ભૂલી જવું એ માનવીની ફિતરત (વૃત્તિ) છે,

અને નબી ﷺ થી ચૂક થવી એ આ કોમ માટે એક નેઅમત (ભેટ) અને તેમના દીનનો એક ભાગ છે, જેથી લોકો ભૂલ થઇ જાય નબી ﷺ નું અનુસરણ કરે.

સજદાએ સહવના કારણો:

૧- પહેલી સ્થિતિ:

નમાઝના કાર્યો અને વાતોમાં વધારો કરવો:

અ- કાર્યોનો વધારો: જો તે કાર્યો નમાઝના ભાગો માંથી હોઈ તો સજદાન સહવ કરવામાં આવે, જેમકે બેસવાની જગ્યા એ ઉલું થઇ જવું, ઉલું થવાની જગ્યાએ બેસી જવું, અથવા વધારે રુક્ખાં અથવા સિજદો કરવો.

બ- વાતોનો વધારો: જેમકે રુક્ખાં અથવા સિજદામાં કુરઆન પઢવું, જે તે ભૂલના કારણે હોઈ તો સજદાન સહવ કરવું જાઈજ મુસ્તહબ છે.

૨- બીજી સ્થિતિ:

નમાઝમાં કોઈ કમી કરવી, અને તે બે પ્રકારની હોઈ શકે છે:

અ- કોઈ રુકન છોડી દેવો: જો તે રુકન તકબીરે તહરીમા (પહેલી તકબીર) હશે તો નમાજ જ નહીં ગણાય, અને સજદાન સહવ કરવાનો કોઈ ફાયદો નહીં થાય, અને જો તે રુકન તકબીરે તહરીમાં સિવાય બીજાં કોઈ

હોઈ, જેમકે તુફાન, સિજદો અથવા બીજુ રકાતમાં કુરઆન શરૂ કરતા પહેલા યાદ આવે તો તે રકાતના બીજા કાર્યોને કરવા વાજીબ છે, અને જો બીજુ રકાતની તિલાવત શરૂ કર્યા પછી યાદ આવે તો તે રકાત બાતેલ થઈ જશે, અને આગળની રકાત તેની જગ્યાએ ગણાશે.

બ- કોઈ વાજીબ કાર્ય છોડી દેવું: જેમકે પહેલું તશહ્હુદ ભૂલી જવું અથવા તુફાનની દુઅા છૂટી જાય, તો આ સ્થિતિમાં સજદહ સહવ કરવામાં આવશે.

૩ - ત્રીજુ સ્થિતિ: શંકા:

ઉદાહરણ: કોઈને જોહરની નમાજ બાબતે શંકા થઈ કે ચાર રકાત પઢી કે ત્રણ, તો તે સ્થિતિમાં:

અ- જો તેને સંપૂર્ણ યકીન થઈ જાય તો તેના પ્રમાણે અમલ કરશે અને સજદહ સહવ કરશે.

બ- જો તેને યકીન ન આવે તો જે વાત પર તેને યકીન આવે તેની ગણતરી કરશે અને સજદહ સહવ કરશે.

અને જો શંકા નમાજ પછી થાય અને વધારે શંકા લાગે તો તે આવી કોઈ શંકા તરફ ધ્યાન ન આપે.

ફાયદો: જો નમાજમાં કોઈ કમી થઈ જાય અથવા શંકા થઈ જાય તો જો તેને કોઈ વાત પર પાંકુ યકીન ન થાય તો સજદહ સહવ સલામ પહેલા કરશે, અને જો કોઈ વધારો થઈ ગયો હોઈ અને તેને પાંકુ યકીન પણ હોઈ તો સજદહ સહવ સલામ પછી કરશે, જોકે સજદહ સહવ સલામ પહેલા પણ કરવું સહીહ છે અને સલામ પછી પણ.

અગ્યારમું: તે સમયો જેમાં નમાજ પઢી શકાય નહીં:

ખરેખર દરેક સમયે નમાજ પઢવી જાઈઝ છે, પરંતુ શરીઅતે અમુક સમયોમાં નમાજ પઢવી જાઈઝ નથી કરી, અને તે નીચે મુજબ છે:

૧- ફજર પછીથી લઇ જ્યાં સુધી સુરજ નીકળી એક ભાલા જેટલો ઉચ્ચો ન થઇ જાય.

૨- જયારે સુરજ આકાશમાં સમાંતર વચ્ચે હોઈ અહીં સુધી કે ફળી ન જાય, અને આ સૌથી ઓછો સમય છે, જેમાં નમાજ પઢવી મનાઈ છે.

૩- અસરની નમાજથી લઇ જ્યાં સુધી સુરજ દૂબી ન જાય, અને આ સૌથી લાંબો સમય છે જેમાં નમાજ પઢવી મનાઈ છે.

તે નમાજો જે મનાઈ કરેલા સમયોમાં પઢી શકાય છે:

૧- છૂટી ગયેલી ફરજ નમાજોની કારણી કરવી.

૨- કારણો વાળી નમાજો, જેમકે: તહયયતુલ મસ્જિદ (મસ્જિદમાં દાખલ થઇ પઢવામાં આવતી નમાજ), તવાફની સુજ્ઞત, સૂર્ય અને ચંદ્ર ગ્રહણની નમાજ અને જનાઓની નમાજ.

૩- ફજરની નમાજ પછી ફજરની સુજ્ઞતોની કારણી કરવી.

બારમું: નમાજની જમાયત:

મસ્જિદમાં જમાયત સાથે નમાજ અદા કરવી તે ઈસ્લામની મહાન નિશાનીઓ માંથી એક છે, અને દરેક મુસ્લામનો આ વાત પર એકમત છે કે પાંચેય નમાજો મસ્જિદમાં જમાયત સાથે અદા કરવી તે એક મહાન ઈબાદત છે.

૧- જમાઅત સાથે નમાજ પઠવાનો આદેશ:

જે પુરુષો પાસે કોઈ કારણ ન હોઈ, તેમના પર પાંચેય નમાજો જમાઅત સાથે મર્જિદમાં પઠવી વાજિબ છે, પછી ભલે ને તે ઘરમાં બેઠા હોઈ કે સફરમાં હોઈ, અમન અને શાંતિની સ્થિતિમાં હોઈ કે ભયની સ્થિતિમાં.

કુરાન અને હદીષ અને શરૂઆતથી લઇ આજ દિન સુધી મુસલમનોનો આ વાત પર અમલ કરવો જમાઅત વાજિબ હોવાની દલીલ છે.

કુરાનની દલીલ માંથી એક દલીલ: અલ્લાહ તાલાલ કહે છે:

[وَإِذَا كُنْتَ فِيهِمْ فَأَقْمِسْ لَهُمُ الصَّلَاةَ فَلْتَقْمُ ظَاهِرَةً مِنْهُمْ مَعَكَ...} [النساء: ١٦٦]

{જ્યારે તમે તેઓની સાથે હોવ અને (યુદ્ધની સ્થિતિમાં) તેઓની વચ્ચે નમાજ પઠવવા લાગો તો, તેઓનું એક જુથ તમારી સાથે પોતાના શસ્ત્રો લઇ ઉલ્લં હોય} [અનુભાવ: ૧૦૨] આ આયત જમાઅત વાજિબ હોવાની દલીલ છે, કારણે ભયના સમયે પણ મુસલમાનોને જમાઅત છોડવાની પરવાનગી નથી, જો જમાઅત વાજિબ ન હોત તો ભય તેના માટે સૌથી મોટું કારણ હતું.

પરંતુ જમાઅત વિષે આળસ કરવી તે મુનાફિકોની એક સ્પષ્ટ નિશાની હતું.

હદીષો માંથી દલીલો: જે ઘણી છે તેમાંથી:

જે સહીહ મુસ્લિમમાં વર્ણન કરવામાં આવી,

أن رجلاً أعمى قال: يا رسول الله، ليس لي قائد يقودني إلى المسجد، فسألته أن يرخص له أن يصلني في بيته، فرخص له، فلما ولّ دعاه فقال: «هل تسمع النداء؟» قال: نعم، قال: «فأجب». ²³

એક અંધ વ્યક્તિએ કહ્યું: હે અલ્લાહના પચાંબર ! મને મસ્જિદ સુધી પહોંચાડનાર કોઈ નથી, તો તેને ધરમાં નમાઝ પઢવાની પરવાનગી માંગી તો નબી ﷺ એ આપી દીધી, જ્યારે તે જવા લાગ્યો તો તેને પાછો બોલાવીને પૂછ્યું: "શું તમને અઝાન સંભળાય છે?" તેણે કહ્યું: હાં, તો નબી ﷺ એ કહ્યું: "નમાઝનો જવાબ આપો અને મસ્જિદમાં આવો".²³

તે વ્યક્તિ અંધ હતો તેને ઘણી પરેશાનીઓ હતી તો પણ નબી ﷺ એ તેને અઝાનનો જવાબ આપવાનો અને મસ્જિદમાં આવી જમાયત સાથે નમાઝ પઢવાનો આદેશ આપ્યો, આ જમાયત વાજિબ હોવાની દલીલ છે.

૨- જ્યારે જમાયત મળી ગઈ તેમ ગણાશે?

જો ઈમામ સાથે એક રકાત મળી જાય તો જમાયત મળી જશે, કારણેકે નબી ﷺ એ કહ્યું:

«من أدرك ركعة من الصلاة فقد أدرك الصلاة»

«જોણે નમાઝની એક રકાત મેળવી લીધી તો ખરેખર તેણે નમાઝ મેળવી લીધી». ²⁴

૩- જે મળવાથી રકાત મળી જશે:

દુફ્રાથ મળવાથી રકાત પણ મળી જશ, જ્યારે કોઈ પાછળ આવવા વાળો ઈમાનને દુફ્રાથની સ્થિતિમાં જોવે તેના માટે વાજિબ છે કે ઉભો રહી

²³ આ હદીષ અભ્યુ હુરૈરહ રહી. થી વર્ણન છે, મુસ્લિમ, હદીષ નંબર: (૧૪૮) (૩/૧૫૭).

²⁴ બુખારી, હદીષ નંબર: (૬૦૮), મુસ્લિમ, હદીષ નંબર: (૬૦૨).

તકબીરે તહરીમા (અલ્લાહુ અકબર) પઢે અને ફરી બીજુ વાર તકબીર કહી રૂફુઅમાં જતો રહે, ને જો તે ફક્ત તકબીરે તહરીમા (અલ્લાહુ અકબર) જ કહે અને બીજુ તકબીર ન કહે તો કોઈ વાંધો નથી.

૪- અમુક કારણોસર જમાઅત છોડવી જાઈઝ છે:

૧- એવી બીમારી જેના કારણે જુગ્મા અને જમાઅતમાં હાજરી આપવી શક્ય ન હોઈ.

૨- જયારે પેશાબ પાણીની સખત જરૂરત હોઈ, કારણકે તે સ્થિતિમાં નમાઝમાં ખુશૂઅ (શાંતિ) ખુજૂઅ (વિનમ્રતા) શક્ય નહીં હોઈ, અને તેના કારણે તેના શરીરને નુકશાન પણ પહોંચી શકે છે.

૩- જયારે માનવીને સખત ભુખ લાગી હોઈ અથવા ખાવાની સખત ઈચ્છા હોઈ, અથવા ખાવાનું હાજર હોઈ, પરંતુ શર્ત એ છે કે તેને આદત અથવા જમાઅત છોડવાનું બહાનું ન બનાવવામાં આવે.

૪- જયારે પોતાના પ્રાણ અને માલ બળ બાબતે કોઈ ભય હોઈ.

તેરમું: સલાતુલ ખલ્ફ (ભયના સમયે પઠવામાં આવતી નમાઝ).

દરેક યોગ્ય યુદ્ધ વચ્ચે નમાઝ પઠવી જાઈઝ છે, જેમકે કાફિરો, બળવો કરનાર અને યોધાઓ સાથે કરવામાં આવતું યુદ્ધ, કારણકે અલ્લાહ તાદ્દાલા એ કહ્યું:

{...إِنْ خَفْتُمْ أَنْ يَفْتَنَكُمُ الَّذِينَ كَفَرُواٰ...} [النساء: ٣٦]

{(ખાસ કરીને) જ્યારે તમને ભય હોય કે કાફિરો તમને સત્તાવશે} [અન્ નિસા: 101].

અને આના પર અન્ય તે લોકોને પણ ગણવામાં આવશે, જે લોકો સાથે લડાઈ કરવી જાઈએ છે.

ભય વખતે પઢવામાં આવતી નમાઝની બે શરતો છે:

૧- દુશ્મન એવો હોય કે તેની સાથે યુદ્ધ કરવું જાઈએ છે.

૨. મુસલમાનોને નમાઝ વખતે તેના તરફથી હમલો થવાનો ભય હોય.

સલાતુલ ખોઝ પઢવાની રીત:

આ નમાઝની ઘણી રીતો છે, પ્રખ્યાત રીતનું વર્ણન, સહલ બિન સાયદ રજી.ની હદીષમાં થએ છે:

أَن طائفه صفت مع النبِي ﷺ، وطائفه وجاه العدو، فصلى بالتي معه ركعة، ثم ثبت قائماً، وأتقوا لأنفسهم، ثم انصرفوا، وصفوا وجاه العدو، وجاءت الطائفة الأخرى، فصلى بهم الركعة التي بقيت من صلاته، ثم ثبت جالساً، وأتقوا لأنفسهم، ثم سلم بهم

એક જૂથ આપ ²⁵ ની સાથે સફરમાં ઉભા રહ્યું, અને એક જૂથ દુશ્મન સામે અડગા રહી ટટાર ઉલ્લંઘા રહે, જે જૂથ આપ ²⁵ની સાથે હતું તેમને આપ ²⁵એ એક રકાત નમાઝ પढાવી, પછી આપ ²⁵ ઉભા રહ્યા અને સહાબા રજી. જાતે જ બીજુ રકાત પૂરી કરી લીધી, પછી તેઓ જતા રહ્યા, અને તેઓએ દુશ્મન સામે ઉભા રહ્યા, અને બીજું જૂથ આવીને આપ ²⁵ સાથે બીજુ રકાતમાં ઉભા રહ્યા, આપ ²⁵એ તેમને બીજુ રકાત પડાવી, પછી આપ ²⁵ બેસી રહ્યા અને સહાબાઓએ બીજુ રકાત જાતે જ પૂરી કરી લીધી. પછી આપ ²⁵ એ બધાની સાથે સલામ ફેરવાયું.²⁵

²⁵ બુખારી, હદીષ નંબર: (૪૧૩૦), મુस્લિમ, હદીષ નંબર: (૮૪૨).

સલાતુલ ખોફથી મળતા ફાયદાઓ:

૧- ઇસ્લામમાં નમાજ અને ખાસ કરીને જમાઅત સાથે પઢવાનું મહત્વ.

કે આટલી અધરી પરિસ્થિતિમાં પણ નમાજ માફ નથી.

૨- આ કોમ પરથી તંગીને દૂર કરી દેવામાં આવી છે.

ઇસ્લામ શરીઅતની સરળતા અને તેનું દરેક સમય અને જગ્યા માટે યોગ્ય હોવું.

૩- ઇસ્લામ શરીઅતની સંપૂર્ણતા.

જેણે દરેક સ્થિતિમાં યોગ્ય આદેશો આપ્યા છે.

ચૌદમુ: જુમ્માની નમાજ:

પહેલું: તેનો હક્કમ:

જુમ્માની નમાજ દરેક બુદ્ધિશાળી, પુષ્ટવય અને મુસલમાન પુરુષ પર ફરજ છે, જે સફરમાં ન હોય અને તે માઝુર (બીમાર) પણ ન હોય. કારણકે અલ્લાહ તથાલા એ કહ્યું:

﴿يَأَيُّهَا الَّذِينَ ءَامَنُوا إِذَا نُودِي لِلصَّلَاةِ مِنْ يَوْمٍ أَجْمَعِةٍ فَاسْعُوا إِلَى ذِكْرِ اللَّهِ وَذَرُوا الْبَيْعَ
ذَلِكُمْ خَيْرٌ لَكُمْ إِنْ كُنْتُمْ تَعْلَمُونَ ﴾ [الجمعة: ٦]

{હે ઈમાનવાળાઓ ! શુક્વારનાં દિવસે જ્યારે નમાજ માટે અજીબ કહેવામાં આવે તો અલ્લાહના લિકર તરફ દોડીને આવો, અને લે-વેચ કરવાનું છોડું દો, જો તમે સમજતા હોવ તો આ જ વાત તમારા માટે ઉત્તમ છે} [અલ જુમાખ: ૬]. અને આપ કહે છે:

«لينتهين أقوام عن دعهم الجماعات، أو ليختمن الله على قلوبهم، ثم ليكونن من الغافلين»

«ખબરદાર ! લોકો જુમાની નમાજ ન પઢવા પર સચેત થઈ જાવ, નહિ તો અલ્લાહ તથાલા તેમના કદય પર મહોર લગાવી દેશે, અને તેઓ ગાફેલ લોકો માંથી બની જાશે». ²⁶

બીજું: જુમાની નમાજ માટે યોગ્ય શરતો:

૧- સમય: જુમાની નમાઝનો સમય તે જ છે, જે ઝોહરની નમાઝનો સમય છે.

તો ઝોહર પહેલા જુમાની નમાજ પઢવી અને સમય પછી પઢવી બન્ને યોગ્ય ગણવામાં નહીં આવે.

૨- જમાઅત સાથે નમાજ પઢવી, અને સાચા મંતવ્ય પ્રમાણે જમાઅતની સોથી ઓછી સખ્યા ત્રણ છે. એકલા વ્યક્તિની જુમાની નમાજ યોગ્ય નથી અને ન તો બે વ્યક્તિની.

૩- નમાજ પઢવાવાળો એવા રહેઠાણ ઇલાકામાં હોય જેમાં સામાન્ય રીતે લોકો રહેતા હોય, તે ઘર સિમેન્ટનાં હોય કે માટીનાં હોય અથવા પથ્થરનાં હોય, વગેરે, એટલા માટે ગામડીયા લોકો અને તંબુમાં રહેતા લોકોની જુમાની નમાજ નહીં ગણાય, જેઓ કોઈ એક જગ્યા પર નથી રોકતા, પરંતુ જ્યાં પણ તે લોકોને પોતાના ઢોરો માટે ચારાપાણી મળી જાય ત્યાં તેઓ પોતાનો ડોરો નાખી દે છે.

જુમાની નમાજ પહેલા બે ખુતબા આપવા જોઈએ, કારણકે આપ  તેની પાબંદી કરતા હતા.

²⁶ મુસ્લિમ, કિતાબુલ જુમાયુન, હદીષ નંબર: ૮૬૫ (૫૮૧૧૨).

ત્રીજું: જુમાના બજે ખુતબાના રુકન:

- ૧- અલ્લાહના નામની પ્રશંસાનું વર્ણન અને શહાદતૈન (તૌહીદની સાક્ષી).
- ૨- આપ  પર દરુદ.
- ૩- તકવાની વસિયત
- ૪- કુરાખાન મજૂદ માંથી કોઈ પણ આયત પઢવી.
૫. નસીહત કરવી.

ચોથું: જુમાના બજે ખુતબાની મુસતહબ વાતો:

- ૧- મિંબર પર ખુતબો આપવો.
- ૨- બજે ખુતબાની વચ્ચે સહેજ વાર બેસવું.
- ૩- મુસલમાનો અને તેમના આગેવાનો માટે દુઅા.
- ૪- સંક્ષિપ્ત ખુતબો.
- ૫- મિંબર પર ચઢતી વખતે ખુતબો આપનારે લોકોને સલામ કહેવું.

પાંચ: જુમાના દિવસે મુસતહબ (જીઈડ) કાર્યો:

- ૧- મિસ્વાક કરવું.
- ૨- જો ખુશ્ય મળતી હોય તો લગાવવી.
- ૩- જુમાની નમાઝ પઢવા માટે જલ્દી નીકળવું.
- ૪- ચાલતા મસ્જિદમાં આવવું.
- ૫- ઇમામની નજીક બેસવું.
- ૬- દુઅા કરવી.
- ૭- સૂરે કહફની તિલાવત કરવી.

૮. આપ એ પર દકુદ પઢવું.

ઇથું: જે જુમ્માના દિવસે હાજર થાય તેના માટે અવેદ્ય વસ્તુઓ:

૧- ખુતબો ચાલતી વખતે વાતચીત કરવી, કારણકે નબી એ કહ્યું:

«إذا قلت لصاحبك يوم الجمعة: أنصت، والإمام يخطب، فقد لغوت»

જ્યારે જુમ્માના દિવસે ખુતબો આપનાર ખુતબો આપી રહ્યો હોય, અને જો તમે પોતાની નજુક બેસેલા વ્યક્તિ નો એમ કહો કે થ્યુપ થઈ જા, તો આવું કહી તમે પોતે એક વ્યર્થ કાર્ય કર્યું.²⁷ વ્યર્થ વાત અર્થાત્ ગુનાહનું કામ.

૨- ગરદનો ફૂદીને જવું એ પણ મકરૂહ છે, પરંતુ જો ઇમામ હોય અને સામે કોઈ જગ્યા ખાલી હોય તો કોઈ વાંધો નથી.

જુમ્મા પ્રાપ્ત કરવી:

જો ઇમામ સાથે બીજુ રકાતનો રુક્ખાય મેળવી લે તો તેણે જુમ્મા પ્રાપ્ત કરી લીધી, એટલા માટે તે બે રકાત પૂરી કરશે, અને જેને બીજુ રકાતનો રુક્ખાય ન મળે તેની જુમ્મા જતી રહી, એટલા માટે તે ચાર રકાત જોહર પઢશે, અને એવી જ રીતે ઊંઘ વગેરેના કારણે જતી રહી તો તે પણ ચાર રકાત જોહરની નમાઝ પઢશે.

પાંચમું: માઝુર (પીડિત) લોકોની નમાઝ:

પહેલું: બીમારની નમાઝ:

પહેલી વાત: બીમાર માટે જરૂરી છે કે તે પોતાની શક્તિ પ્રમાણે જુમ્માની નમાઝ પઢી લે, અને જ્યાં સુધી હોશ હોય નમાઝ માટે વિલંબ કરવો જાઈએ નથી.

²⁷ બુખારી ઉત્તાબુલ જુમ્મા, હદીષ નંબર: (૮૩૪) (૨/૧૩), મુસ્લિમ ઉત્તાબુલ જુમ્મા, હદીષ નંબર: (૮૫૧) (૨/૮૫૧).

બીજુ વાત: બીમાર કઈ રીતે નમાઝ પઢશે?

૧- બીમાર માટે જરૂરી છે કે તે ઉભા રહી નમાઝ પઢે જો તે કોઈ તકલીફ વગાર ઉભા રહેવાની શક્તિ ધરાવતો હોય અને રુક્ષાય તેમજ સિજદો કરી શકતો હોય.

૨- અને જો ઉભો રહેવાની શક્તિ ધરાવતો હોય અને રુક્ષાય અને સિજદો કરવામાં તકલીફ થઈ રહી હોય, તો ઉભા ઉભા રુક્ષાય માટે ઈશારો કરશે અને બેઠા બેઠા સિજદા માટે પણ ઈશારો કરશે.

૩- અને જો ઉભા રહી નમાઝ પઢવાની શક્તિ ન ધરાવતો હોય તો તે બેઠા-બેઠા નમાઝ પઢશે. અને સુજ્ઞત એ છે કે ચાર જાંધના ભાગે બેસે અને ઈશારાથી રુક્ષાય કરે અને જો શક્ય હોય તો જમીન પર સિજદો કરે, નહીં તો ઈશારો કરી લે અને સિજદો કરતી વખતે રુક્ષાય કરતા સહેજ વધારે ઝુકવું જોઈએ.

૪- અને જો બેસીને પણ ન પઢી શકતો હોય તો કિબલા તરફ મોહું કરી, પાંસુ ફેરવી નમાઝ પઢવી જોઈએ, અને જમણી બાજુ પાસું ફેરવી નમાઝ પઢવી અફઝલ (શ્રેષ્ઠ) છે, અને તે સ્થિતિમાં રુક્ષાય અને સિજદો ઈશારામાં કરશે.

૫- અને જો પાંસુ ફેરવીને પણ નમાઝ ન પઢી શકતો હોય તો અને પીઠ પર જ જે તેની સ્થિતિ હોય નમાઝ પઢશે, પગ કિબલા તરફ હોવા જોઈએ અને પછી રુક્ષાય અને સિજદો કરશે.

૬- અને જો રુક્ષાય અને સિજદો કરતા તકલીફ થતી હોય તો માથા વડે ઈશારો કરશે, અને જો એમ પણ તકલીફ થતી હોય તો ઈશારો પણ ન કરે

ચાલી જશે, અને નમાજના દરેક અમલ દિલથી અદા કરશે, રુકુઅ, સિજદાની નિયત કરી પોતાની સ્થિતિમાં જ દરેક કાર્યો પુરા કરશે અને ઝીકર કરશે.

૭- નમાજ માટે જે જે શરતો હોય તેને પુરી પાડશે, જેમ કે કિબલા તરફ મોહું કરવું, પાણીથી વુજ્ઝ કરવું અને જો તે શક્ય ન હોય તો તયમ્મુમ કરવું, નજાસત (અશુદ્ધતા) દૂર કરવી અને જો તેમાં પણ તકલીફ થતી હોય તો આ શરત પણ પુરી પાડવી જરૂરી નથી, અને બીમાર પોતાની સ્થિતિમાં નમાજ પઢી લેશે પરંતુ વિલંબ નહીં કરી શકે.

૮- સુજ્ઞત એ કે બીમાર કિયામ અને રુક્ષઅની સ્થિતિમાં ચાર રાન પર બેસે અને અન્ય સ્થિતિમાં પગ ફેલાવી બેસે.

બીજું: મુસાફરની નમાજ:

૧- મુસાફર પણ મય્યૂર (લાચાર) લોકો માંથી છે, અને તેના માટે જાઈએ છે કે ચાર રક્ખતને કસર (ઓછી) કરી બે રક્ખત પઢી લે; કારણેકે અલ્લાહ તચાલા એ કહ્યું:

﴿وَإِذَا ضَرَبْتُمْ فِي الْأَرْضِ فَلَيْسَ عَلَيْكُمْ جُنَاحٌ أَنْ تَقْصُرُوا مِنَ الْصَّلَاةِ...﴾ [النساء: ٢٩]

{જ્યારે તમે ઝીનમાં સફર કરો તો તમારા પર નમાજોને કસ (સંસ્ક્રિપ્ત) કરવામાં કોઈ ગુનોહ નથી, (ખાસ કરીને) જ્યારે તમને બય હોય કે કાફિરો તમને સત્તાવશે, નિઃશંક કાફિરો તમારા ખુલ્લા દુષ્મન છે} (અનુનિસા: ૧૦૧).

وَعَنْ أَنْسِ بْنِ مَالِكَ رَضِيَ اللَّهُ عَنْهُ قَالَ: «خَرَجْنَا مَعَ النَّبِيِّ ﷺ مِنَ الْمَدِينَةِ إِلَى مَكَّةَ، فَكَانَ يَصْلِي رَكْعَتَيْنِ رَكْعَتَيْنِ، حَتَّى رَجَعْنَا إِلَى الْمَدِينَةِ»

અને અનસ બિન મલિક રજી.એ કહ્યું: «અમે આપ  સાથે મદીનાથી મક્કા જવા નીકળ્યા, આપ બે બે રક્ખત પઢતા રહ્યા અહીં સુધી કે અમે મદીના પાછા આવી ગયા».²⁸

અને કસર નમાઝની શરૂઆતમાં શહેર માંથી નીકળ્યા પછી થશે, કારણે કસરને તેના માટે જાઈજ કરવામાં આવી છે, જે ધરતી પર ચાલતો હોય.

અને શહેર માંથી નીકળતા પહેલા વ્યક્તિ ન તો જમીન પર ચાલનારો ગણાય છે અને ન તો મુસાફર હોય છે, અને એટલા માટે પણ કે આપ  જ્યારે નીકળ્યા પછી જ કસર નમાઝ કરતા હતા.

૨- જ્યારે મુસાફર એસી કિલોમીટર દૂર જવાનો ઈરાદો કરે તો તેના માટે કસર કરવી જાઈજ છે.

૩- મુસાફર જ્યાં સુધી શહેરમાં દાખલ ન થાય ત્યાં સુધી કસર કરી શકે છે.

જ્યારે મુસાફર કોઈ શહેરમાં પહોંચે અને ત્યાં રોકાવવાની ઈચ્છા હોય તો તેની ત્રણ સ્થિતિઓ હોઈ શકે છે:

અ- ચાર દિવસથી વધારે રોકાવવાની નિયત હોય, આ સ્થિતિમાં તેણે સંપૂર્ણ નમાઝ પઢવી પડશે, અને સફરની કોઈ છૂટ તેને નહીં મળે.

બ- ચાર દિવસ અથવા તેના કરતા ઓછું રોકાવવાની નિયત હોય તો નમાઝમાં કસર કરી શકે છે અને સફરની અન્ય છૂટો પણ તેને મળશે.

²⁸ બુખારી, હદીષ નંબર: (૧૦૮૧), મુસ્લિમ, હદીષ નંબર: (૫૬૩).

૪- જો તેના રોકાવવાનો કોઈ સમય નક્કી ન હોય, શક્ય છે એક દિવસ પણ રોકાય અથવા જગ્યાના કારણે, સંજોગો વસાત દસ દિવસ સુધી રોકાય શકે છે, અથવા સારવારના હેતુથી અથવા મુલાકાતના હેતુથી આવ્યો હોય, અને જ્યારે હેતુ પૂરો થાય તો પરત થશે, તો આવા સંજોગોમાં પરત આવ્યા સુધી સફરમાં કસર કરવું અને અન્ય છૂટ પર અમલ કરવો જાઈજ છે, ભલેને ચાર દિવસ કરતા વધારે હોય.

૫- જ્યારે મુસાફર કોઈ રહેવાસી ઇમામ પાછળ નમાઝ પઢે તો તેને સંપૂર્ણ નમાઝ પઢવી પડશે, ભલેને તેને છેલ્લી રકાત જ મળી હોય.

૬- જ્યારે રહેવાસી કોઈ કસર કરનાર મુસાફર પાછળ નમાઝ પઢતો હોય તો રહેવાસીએ મુસાફર ઇમામના સલામ કર્યા પછી નમાઝ પૂરી કરવી પડશે.

સોટમું: ઇદની નમાઝ:

મુસલમાનોની બજો ઇદો અલ્લાહ તરફથી શરીઅત છે, તેમણે પોતે બનાવેલી નથી, તેમની ફક્ત બે જ ઇદો છે: ઇદુલ ફિતર (રમાન ઇદ), અને ઇદુઅ અઝૃહા (બકરી ઇદ).

કાફિરોની અને બિદઅતી લોકોની ઇદ વિદુષ જેમની ઇદોને અલ્લાહએ શરીઅત રૂપે કોઈ આદેશ આપ્યો નથી, પરંતુ તે લોકોએ પોતે જ તે ઇદો બનાવી લીધી છે.

ઇદની નમાઝનો હુકમ:

ઇદની નમાઝ ફર્જ કિફાયા છે, આપ અને સહાબા રાઝી. હંમેશા આ નમાઝ પઢતા હતા, અને આ દીનની નિશાનીઓ અને શરીઅત માંથી છે.

ઇદની નમાઝનો સમય: ઇદ ની નમાઝનો સમય જ્યારે સૂર્ય એક ભાલા જેટલો ઉંચો થાય ત્યારથી શરૂ થાય છે અને અર્થાત् સૂર્યોદય થયા પછી લગભગ પંદર મિનિટ પછી અને જવાલ સુધી રહે છે.

ઇદની નમાઝની રીત:

૧- પહેલી રકઅતમાં તકબીરે તહરીમાં પછી દુઆએ ષના પઢીને છ તકબીરો કહેવી, દરેક તકબીર સાથે હાથ ઉઠાવવામાં આવશે, અને દરેક તકબીર વચ્ચે અલ્લાહના નામની પ્રશંસા અને આપ ﷺ પર દરુદ પઢવામાં આવશે, પછી અઉજુબિલ્લાહ અને બિસ્મિલ્લાહ પઢી કુરાન પઢવાનું શરૂ કરવું જોઈએ.

૨- અને બીજુ રકઅતમાં તકબીર કર્યા પછી પાંચ તકબીરો કહેવી, પછી અઉજુબિલ્લાહ અને બિસ્મિલ્લાહ પઢી કુરાન પઢવાનું શરૂ કરવું, પહેલી રકઅતમાં સૂરે અખલા અને બીજુ રકઅતમાં સૂરે ગોશિયહ પઢવી મુસ્તહબ (જાઈજ) છે.

૩- સલામ ફેરવ્યા બાદ ઇમામ મિયર પર ચઢશે અને જુમ્માના ખુતબાની જેમ બે ખુતબા આપશે, અને ખુતબા વચ્ચે થોડીક વાર બેસશે.

ઇદના દિવસની સુન્નતો:

અ- ગુસલ કરવું.

બ- પાક સાફ થવું અને ખુશ્યુનો ઉપયોગ કરવો.

ક- ઇદુલ ફિતરમાં નીકળતા પહેલા કંઈક ખાવું અને ઇદુઝ અઝુહામાં જો કુરબાની હોયપાછા આવી તેનું માસ ખાવું.

દ- ચાલતા જવું.

હ- એક રસ્તા પરથી જવું અને બીજા રસ્તેથી પાછું આવવું.

વ- મુક્તદી માટે મુસ્તહબ (જાઈઝ) છે કે તે ઇંગાહ જલ્દી પહોંચે ન કે ઇમામ માટે.

તકબીર પઢવી:

ઇંદની બજે રાત, ઝૂલુ હિજાના દસ દિવસો અને તશ્રીકના દિવસો (૧૧,૧૨,૧૩) માં તકબીર પઢવી સુજ્ઞત છે, અને તકબીરના બે પ્રકાર છે:

પ્રથમ પ્રકાર: તકબીરે મુતલક (સામાન્ય તકબીર): જેનો કોઈ સમય નક્કી નથી.

૧- ઇંદુલુ ફિતરમાં આ તકબીર ઇંદની રાત્રે સૂર્યાસ્ત પછી લઈને ઇંદની નમાઝ શરૂ થતા પહેલા સુધી રહેશે.

૨- અને ઇંદુલુ અજ્ઞામાં ઝૂલુ હિજાની પ્રથમ રાત્રથી સૂર્યાસ્ત પછી લઈને કે તશ્રીકના છેલ્લા દિવસ સુધી રહેશે.

બીજો પ્રકાર તકબીરે મુકાયદ (નક્કી તકબીર): આ તકબીર ફર્જ નમાઝ પછી પઢવામાં આવે છે.

૧. ગેર મહરિમ (એહરામ ન બાંધવાવાળો) માટે આ તકબીર અરફાના દિવસથી ફરજરથી લઈને કે તશ્રીકના છેલ્લા દિવસે સૂર્યાસ્ત સુધી રહેશે.

૨- અને મુહરિમ (એહરામ બંધવાવાળો) માટે ઇંદના દિવસે જોહરથી લઈને તશ્રીકના દિવસે સૂર્યાસ્ત સુધી રહેશે.

સતરમુ: સલાતુલ કુસૂફ (સુર્ય અને ચંદ્ર ગ્રહણની નમાજ):

ખુસૂફ અને કુસૂફનો અર્થ:

ખુસૂફ: રાત્રે ચંદ્રનું સંપૂર્ણ અથવા થોડુંક પ્રકાશહીન થઈ જવું.

કુસૂફ: સવારના સમયે સૂર્યનું સંપૂર્ણ અથવા થોડુંક પ્રકાશહીન થઈ જવું.

સલાતુલ કુસૂફનો હુકમ:

કુસૂફની નમાજ સુજ્ઞતે મૂખકકદહ છે, તેની દલીલ આપ  નો અમલ છે, જ્યારે આપના સમયમાં સૂર્યગ્રહણ થયું, તો આપ  એ કુસૂફની નમાજ અદા કરી.

અને આપ  એ તેનો આદેશ પણ આપ્યો, અને તેની મશ્રૂઇયત (કાયદેસર) હોવા પર આલિમોનો ઇજમાખ (એકમત) છે.

તેનો સમય:

ગ્રહણ લાગ્યા પછીથી લઈને કે ગ્રહણ ખતમ થયા સુધી.

તેનો તરીકો:

આ બે રકાયત વાળી એક નમાજ છે, જેમાં બે રકાયત પઢવામાં આવે છે, અને તેનો તરીકો નીચે પ્રમાણે છે:

અ- તકબીરે તહરિમા, દુઅએ ખના, અઉજુબિલ્લાહ અને બિસ્મિલ્લાહ પઢી અને સૂરે ફાતિહા પઢયા પછી લાંબી કિરાયત થશે.

બ- પછી એક લાંબો દુષ્ટાય કરવામાં આવશે.

ક- દુષ્ટાય માંથી ઉભા થઈ, (સમિઅલ્લાહુ લિમન્ હમીદહ) પઢયા પછી સૂરે ફાતિહા પઢવામાં આવશે અને આ વખતે કિરાયત પહેલા કરતા થોડીક ટૂંકી કરવામાં આવશે.

દ- પછી લાંબો રુક્ષઅ કરવામાં આવશે પરંતુ પહેલા રુક્ષઅ કરતા તે રુક્ષઅ ટ્રંકો હોવો જોઈએ.

હ- પછી રુક્ષઅ માંથી ઉભા થઇ (સમિઅલ્લાહુ લિમન् હમિદ્હ) કહેવું.

વ- પછી બે લાંબા સિજદા કરવા.

ગ- બીજુ રકાત પહેલી રકાતની જેમ જ પઢવામાં આવશે, પરંતુ તે પહેલી રકાત કરતા થોડીક ટ્રંકી રહેશે.

તેની સુન્નતો:

અ- (અસ્ સલાતુ જામિઅતૂન) કહી તેનું એલાન કરવું.

બ- જમાઅત સાથે પઢવી.

જ- કિયામ, રુક્ષઅ અને સિજદા લાંબા કરવા.

દ - બીજુ રકાત પહેલી રકાત કરતા ટ્રંકી હોવી જોઈએ.

હ- નમાઝ પઢી નસીહત કરવી, અને ઈતાઅતના કામ પર પ્રોત્સાહન અને ગુનાહના કામ છોડવાનું કહેવું.

વ- વધુમાં વધુ દુઆ કરવી, આજુજુ કરવી, માફી માંગવી અને સદકો કરવો જોઈએ.

અફારમુ: સલાતુલ ઇસ્તિસ્કાય:

અલ ઇસ્તિસ્કા: નો અર્થ થાય છે કે દુકાળના સમયે અલ્લાહ પાસે વરસાદ માંગવો.

સલાતુલ ઇસ્તિસ્કા માટે સમય:

સલાતુલ ઇસ્તિસ્કા, જ્યારે દુકાળ પડે અને વરસાદ રોકાઈ જાય, અને તેના કારણે લોકોને નુકસાન પહોંચે, તે સમયે શરીઅતે આદેશ આપ્યો છે કે નમાઝ પઢવી જોઈએ અને તે સ્થિતિમાં ખૂબ જ આજુજુ કરવી જોઈએ.

અ- ક્યારેક જમાઅત સાથે અને ક્યારેક એકલા પણ નમાજ પઢવામાં આવે.

બ- ક્યારેક ખુતબો આપનાર દુઆમાં તેની દુઆ કરશે, અને મુસલમાન તેમની દુઆ પર આમીન કહેશે.

ક- અને ક્યારેક સામાન્ય સમયમાં નમાજ પઢયા વગાર અને ખુતબો આપ્યા વગાર પણ દુઆ કરી શકીએ છીએ.

સલાતુલ ઇસ્તિસ્કા નો હકમ:

જો દુકાળ જેવી સ્થિતિ આવી જાય ત્યારે સલાતુલ ઇસ્તિસ્કા પઢવી સુજ્ઞતે મુઅકકદહ ગણાશે, કારણ કે નબી ﷺ એ નમાજ પઢી છે, જેવું કે અબુલ્લાહ બિન ઝૈદની હદીખમાં છે:

આપ ﷺ સલાતુલ ઇસ્તિસ્કાના ઈરાદા સાથે એક મુસલ્લો લઈ પહોંચ્યા, કિબલા તરફ મોઢું કર્યું, ચાદર ફેલાવી અને બે રકાયત નમાજ પઢી. 29

સલાતુલ ઇસ્તિસ્કાનો તરીકો:

સલાતુલ ઇસ્તિસ્કા ઈદની નમાજની જેમ છે, સલાતુલ ઇસ્તિસ્કા ઈદ ગાહમાં પઢવી બહેતર છે, ઈદની નમાજની જેમ જ, અને તેના આદેશો પણ ઈદની નમાજની જેમ જ છે, તેની પણ બે રકાયત છે, જે ખુતબા પહેલા પઢવામાં આવશે, ઊચા અવાજે કિરાયત પઢવામાં આવશે અને બજે રકાયતમાં વધારાની તકબીર કહેવામાં આવશે. જેવું કે આ વાતોનું વર્ણન ઈદની નમાજ વખતે થઈ ગયું છે. અને ત્યારબાદ એક ખુતબો આપવામાં આવશે.

²⁹ બુખારી, હદીખ નંબર: (૧૦૧૨), મુસ્લિમ, હદીખ નંબર: (૮૮૪).

ઓગાણીસમુઃ જનાઝાના આદેશો:

પહેલી વાતઃ જેનો સમય નજીક હોય અને તેની પાસે બેઠેલાં વ્યક્તિ માટે:

૧- જે બીમાર વ્યક્તિ પાસે બેઠા હોય તે લોકોએ તેને લા ઇલાહા ઇલ્લાહાનું પઢવાની તાકીદ કરવી જોઈએ.

૨- તેનું કિબલા તરફ મોઢું ફેરવવું જોઈએ.

૩- વફાત પછી તેની આંખો બંધ કરવી મુસતહબ (જાઈજ) છે.

૪- મૃત્યુ પછી મૃતકને એક કપડાં વડે ઢાંકી દેવો જોઈએ.

૫- તેની દફનવિધિમાં ઉતાવળ કરવી જોઈએ.

૬- તેનું દેવું ચુકવવામાં પણ ઉતાવળ કરવી જોઈએ.

૭- મૃતકને ગુસલ આપવામાં આવશે પછી કફન પહેરાવવામાં આવશે, અને આ બજે ફર્જ કિફાયા છે.

બીજું: જનાઝાની નમાઝના આદેશો:

તેનો હુકમ: ફર્જ કિફાયા છે:

તેની શરતો:

૧- કિબલા તરફ મોઢું કરવું.

૨- તેના ગુપ્તાગને છુપાવવું.

૩- નજાસતથી બચવું.

૪- જનાઝાની નમાઝ પઢનાર અને મૃતક બજે પાક હોવા જોઈએ.

૫- જનાઝાની નમાઝ પઢનાર અને નમાઝ માટે આવેલ મુસલ્લીનું મુસલમાન હોવું.

૬- જો શહેરમાં હોય તો જનાગ્રામાં શરીક થવું.

૭- મુકલ્લફ હોવું.

તેના અરકાન:

૧- કિયામ.

૨- ચાર તકબીર

૩- સૂરે ફાતિહા પઢવી.

૪- રસૂલ ﷺ પર દરુદ પઢવું.

૫- મૃતક માટે દુઓ કરવી.

૬- તરતીબનો ઘ્યાલ કરવો.

૭- સલામ ફેરવવું.

તેની સુજ્ઞતો:

૧- દરેક તકબીર સાથે રફઉલ થદૈન કરવું.

૨- અઉઝુબિલ્લાહ પઢવું

૩- પોતાના માટે અને મુસલમાનો માટે દુઓ કરવી.

૪- કિરખત ધીમા અવાજે કરવી.

૫- ચોથી તકબીર પછી અને સલામ ફેરવ્યા પહેલા થોડીક વાર રૂકવું.

૬- જમણા હાથને ડાબા હાથ પર ઉપર મૂકવો.

૭- સલામ ફેરતી વખતે જમણી બાજુ ફરવું.

તેનો તરીકો:

ઇમામ અને પાછળ પઢનાર વ્યક્તિ પુરુષની છાતીના ભાગ પાસે અને સ્ત્રીની વચ્ચે ઉભો રહેશે, તકબીરે તહરીમા કહેશે, અઉઝુબિલ્લાહ પઢશે, અને દુઆએ ધના નહીં પઢે, અને બિસ્મિલ્લાહ કહી સ્વીકારે ફાતિહા પઢશે.

પછી તકબીર કહી દરૂર પઢશે, ત્યારબાદ તકબીર કહી આપ થી સુજ્ઞતથી સાબિત કોઈ દુઆ પઢશે, જેવું કે આપ ની આ દુઆ:

«اللهم اغفر لحينا ومتتنا، وصغيرنا وكبيرنا، وذكرنا وأئتنا، وشاهدنا وغائبنا، اللهم من أحسيت به منا فاحيه على الإيمان، ومن توفيت به منا فتوفه على الإسلام، اللهم لا تحرمنا أجره ولا تضلنا بعده»

«"અલ્લાહુમ્મગ! કિર લિહાયિના, વમાયિતિના, વસગિરિના, વકબિરિના, વઝકરિના, વઉનષાના, વશાહિદિના, વગાઈબિના, અલ્લાહુમ્મ મન્ અખયતહુ, મિજ્જા, ફઅહિહિ અલ્ ઈમાન, વમન તવફ્યતહુ મિજ્જા ફતવફક્કુ અલલુ ઇસ્લામ, અલ્લાહુમ્મ, લા તહિમના અજરહુ, વલા તુજિલ લના બયદહ" (હે અલ્લાહ ! અમારા જીવિત તેમજ જે લોકોની વફાત થઈ ગઈ છે, તેમને માફ કરી હે, તેમજ હાજર અને ગાયબ લોકોને માફ કરી હે, તેમજ અમારા નાના અને મોટા લોકોને માફ કરી હે, અમારા પુરુષો અને સ્ત્રીઓને માફ કરી હે, હે અલ્લાહ ! અમારા માંથી તું જેને જીવિત રાખે તેને ઇસ્લામ પર જીવિત રાખે અને અમારા માંથી જેની વફાત લખી હોય તો તેને ઈમાન પર વફાત આપ, હે અલ્લાહ ! તું અમને આ વફાત પામેલ વ્યક્તિના સવાબથી વંચિત ન કરજે અને અમને આ પછી પથખુષ્ટ ન કરજે)».³⁰ અને કહ્યું:

³⁰ અબુદાવુદ: (૩/૨૧૧) તિમિઝી, હદીષ નંબર: (૩/૨૧૧), (૧૦૨૪) અને તેમણે કહ્યું: આ હદીષ હસન દરજાની છે.

«اللهم اغفر له وارحمه، وعافه واعف عنه، واكرم نزله، ووسع مدخله، واغسله بالماء والثلج والبرد، ونقه من الخطايا كما نقئت الشوب الأبيض من الدنس، وأبدل داراً خيراً من داره، وأهلاً خيراً من أهله، وزوجاً خيراً من زوجه، وأدخله الجنة، وأعذه من عذاب القبر، ومن عذاب النار»

«"અલ્લાહુમ્મગ! કિર લહુ વહીમહુ, વઆફિહિ વઅકુ અન્દુ, વક્તિમ નુજુલહુ, વવસ્સેએ મુદખલહુ, વગ્સેલહુ બિલુ માઈ વષ્ણલજિ વલુ બર્દ, વનક્કિહિ મિનલુ ખતાયા કમા યુનક્કસ છબ્બુલુ અબ્યજુ મિનદનસ, વઅબ્દિલહુ દારનુ ઘૈરનુ મિન દારિહિ, વઅહ્બન ઘૈરનુ મિન અહ્લિહિ, વઝવજનુ ઘૈરમુ મિન ઝવજિહિ, વઅદ્ભિલુલુ જજ્ઞહ, વઅઇઝુ મિન અજાબિલ કબ્રી, વમિન અજાબિનુ નાર" (હે અલ્લાહ! તેને માફ કરી દે, તેનાં પર રહેમ કર, તેને આફિયત આપ, તેને માફ કરી દે, અને તેની મહેમાન નવાજી ઈજ્જત સાથે કર, અને તેના દાખલ થવાની જગ્યા ને વિશાળ કરી દે, અને તેને પાણી, બરક અને ઓલાઓ ની સાથે ધોઈ નાંખ, અને તેને ગુનાહોથી એવી રીતે સાફ કરી દે જેવી રીતે સફેદ કપડાં માંથી મેલ સાફ કરે છે, અને તેને તેનાં ધરના બદલામા શ્રેષ્ઠ ધર આપ, તેનાં ધરવાળાઓના બદલામા શ્રેષ્ઠ ધરવાળાઓ આપ, અને પત્નીના બદલામા શ્રેષ્ઠ પત્ની આપ, અને તેને જજ્ઞતમાં દાખલ કર, અને તેને કબરના અજાબ અને આગથી બચાવ)».³¹

પછી તકબીર કહી થોડીક વાર રુકી જશે અને પછી જમણી બાજુ એક સલામ ફેરવશે.

³¹ મુસ્લિમ: (૫/૬૨૨) હદીષ નંબર: (૮૬૨).

ત્રીજો વિભાગ : ઝકાત

૧- ઝકાતની વ્યાખ્યા અને તેનો દરજજો:

ઝકાતનો શાબ્દિક અર્થ: વધવું અને વધારે થવું.

ઝકાતનો કાયદાકીય અર્થ: નક્કી કરેલ માલ માંથી ખાસ લોકોના જરૂરી હકને કહે છે.

ઝકાત ઇસ્લામનો ત્રીજો રૂકન છે, ઝકાત એટલી મહત્વની ઈબાદત છે કે અલ્લાહ તથાલાએ કુરાઓન મજુદમાં નમાજ સાથે બયાસી વખત વર્ણન કર્યું છે, અલ્લાહ તથાલાએ કહ્યું:

﴿وَأَقِيمُوا الصَّلَاةَ وَءَاتُوا الْزَكُوَةَ﴾ [البقرة: ٤٣]

{નમાજ કાયમ પઢતા રહો, ઝકાત આપતા રહો} [અલ બકરહ: ૪૩].

આપ  એ કહ્યું:

«بَنِي إِسْلَامٍ عَلَىٰ خَمْسٍ: شَهادَةُ أَنْ لَا إِلَهَ إِلَّا اللَّهُ، وَأَنَّ مُحَمَّداً رَسُولَ اللَّهِ، وِإِقَامُ الصَّلَاةِ، وِإِيتَاءِ الزَّكَاةِ، وَحِجَّةِ الْبَيْتِ، وَصُومُ رَمَضَانَ»

«ઇસ્લામના પાંચ (સ્તંભો) છે: સાક્ષી આપવી કે અલ્લાહ સિવાય કોઈ ઈબાદતને લાયક નથી અને મુહમ્મદ  અલ્લાહના રસૂલ છે, નમાજ કાયમ કરવી, ઝકાત આપવી, રમાત્રાન મહિનાના રોજા રાખવા, અને બૈતુલ્લાહની હજ કરવી».³²

અને ઝકાત ફર્જ હોવામાં મુસલમાનોનો ઇજમાય છે.

અને એ વાત ઉપર પણ કે જે ઝકાતને ફર્જ હોવાનો ઇન્કાર કરે, તે કાફિર છે.

અને જે ઝકાતનો ઇન્કાર કરે તેની સાથે યુદ્ધ કરવામાં આવશે.

³² બુખારી, હદીષ નંબર: (૮) (૧/૬૮), મુસ્લિમ, હદીષ નંબર: (૧૧૧) (૧/૧૨૮).

૨- ઝકાતને વાજિબ કારવાવાળી શરતો:

અ- સ્વત્રત (આકાદ): ગુલામ પર ઝકાત વાજિબ નથી, કારણકે તેની પાસે પોતાનો માલ નથી હોતો, અને જે તેની પાસે હોય છે, તે તેના માલિકનું હોય છે, એટલા માટે તેની ઝકાત તેના માલિકના શિરે રહેશે.

બ- મુસલમાન હોવું, કાફિર પર ઝકાત વાજિબ નથી, કારણકે આ ઈબાદત છે, અને કાફિરનો ઈબાદતથી કોઈ સંબંધ નથી.

જ- નિસાબ સુધી માલ પહોંચવો, તેનાથી ઓછા માલમાં ઝકાત ફર્જ નથી, માલનો નિસાબની એક નક્કી કરેલ સંખ્યાનું નામ છે.

દ- સંપૂર્ણ માલિક હોવું: માનવી તેના માલનો સંપૂર્ણ માલિક હોય, એટલા માટે એવા માલમાં ઝકાત વાજિબ નથી જેના પર સંપૂર્ણ માલિકીનો હક ન હોય.

હ- માલ પર એક વર્ષનો સમયગાળો પસાર થઈ ગયો હોય; કારણકે આયશા રડી. ની હદીષ છે:

«لَا زَكَاةٌ فِي مَالٍ حَتَّى يَحُولَ عَلَيْهِ الْحُولُ»

«કોઈ માલમાં ત્યાં સુધી ઝકાત નથી, જ્યાં સુધી તેના પર એક વર્ષ પસાર ન થઈ હોય».³³

૩- જે માલમાં ઝકાત વાજિબ છે:

પહેલું: ઢોર:

અર્થાતું ઊંઠ, ગાય, બકરી અને આ ઢોરમાં ઝકાત બે શરતો પ્રમાણે જરૂરી છે:

૧- કે તે ઢોરને દૂધ અને નસલમાં વધારો કરવા માટે રાખવામાં આવે, કામ માટે નહીં.

³³ ઈને માજહ, હદીષ નંબર: (૧૭૮૨) (૨/૩૭૩), તિમિતી, હદીષ નંબર: (૬૩) અને (૬૩૧), (૩/૨૫, ૨૯).

૨-તે જાનવર ચરવાવાળું હોય, એટલા માટે તે જાનવરોમાં ઝકાત જરૂરી નથી જેમને ખરીદીને અથવા ક્યાંકથી ભેગું કરી ચારો આપવામાં આવે, અને તે જાનવર પર પણ ઝકાત નથી જે સંપૂર્ણ વર્ષ અથવા થોડોક સમય પણ ચરતા ન હોય.

ફોરોનો નિસાબ (માલની એટલી માત્રા જેના પર ઝકાત વાજ્જિબ થઈ જાય):

૧- ઉંટની ઝકાત:

શરત પુરી થયા બાદ; દરેક પાંચ ઉંટ પર એક બકરી વાજ્જિબ છે, દસ ઉટમાં બે બકરી, પંદરમાં ત્રણ અને વિસમાં ચાર બકરીઓ.

જેવું કે સુજ્ઞત અને ઇજમાઝ (આલિમોના એકમત) દ્વારા આ વાત સાબિત છે, જ્યારે ઉંટની સંખ્યા પચીસ થઈ જાય તો તેની ઝકાત માટે એક "બિનતે મખાજ" આપવી પડશે, બિનતે મખાજ: એવી ઉંટણી જે બીજા વર્ષમાં આવી ગઈ હોય, અને જો બિનતે મખાજ ન હોય તો ઈંઝે લબૂન આપવું પડશે.

અને જ્યારે ઉંટોની સંખ્યા છત્રીસ સુધી પહોંચી જાય તો પછી ઝકાત રૂપે એક "બિનતે લબૂન" આપવી પડશે, બિનતે લબૂન: તે ઉંટણી જેના બે વર્ષ પૂરા થઈ ગયા હોય.

અને જો ઉંટોની સંખ્યા છેતાલીસ થઈ જાય તો પછી ઝકાત રૂપે એક "હક્કહ" આપવી પડશે, હક્કહ: તે ઉંટણી જેના ત્રણ વર્ષ પૂરા થઈ ગયા હોય.

અને જો ઉંટોની સંખ્યા એકસઠ થઈ જાય તો પછી ઝકાત રૂપે એક "જિઝતુન" આપવી પડશે, જિઝતુન: તે ઉંટણી જેના ચાર વર્ષ પૂરા થઈ ગયા હોય.

અને જો ઊંઠોની સંખ્યા છોતેર થઈ જાય તો પછી ઝકાત રૂપે બે "બિનતે લબ્બુન" આપવી પડશે, અને જો ઊંઠોની સંખ્યા એકાણું થઈ જાય તો પછી ઝકાત રૂપે બે "હક્કાહ" આપવી પડશે, અને જો ઊંઠોની સંખ્યા એક ચોવીસ થી વધારે થઈ જાય તો પછી ઝકાત રૂપે ત્રણ "બિનતે લબ્બુન" આપવી પડશે, અને પછી દરેક ચાળીસ પર એક "બિનતે લબ્બુન" વધારવું અને પચાસની સંખ્યા વધે તો એક "હક્કાહ" વધારવું.

૨- ગાય ની ઝકાત:

શરત પુરી થઈ ગયા પછી જ્યારે ગાયની સંખ્યા ત્રીસ થઈ જાય તો તેમાં એક "તબીઉન" અથવા એક તબીઅહ આપવી પડશે, "તબીઉન" અથવા "તબીઅતુન": તે ગાય અથવા વાછરડા ને કહે છે જેનું એક વર્ષ પૂરું થઈ ગઇ હોય.

જો ત્રીસથી ઓછી સંખ્યા હોય તો કંઈ પણ આપવું વાજિબ નથી. જ્યારે તેમની સંખ્યા ચાળીસ થઈ જાય તો તેમાંથી એક "મુસિજ્જહ" વાજિબ છે, મુસિજ્જહ: જેના બે વર્ષ પુરા થઈ ગયા હોય.

જ્યારે તેમની સંખ્યા ચાળીસથી વધારે થઈ જાય તો તેમાંથી એક "તબીઉન" અથવા એક "તબીઅતુન" આપવું વાજિબ છે, અને દરેક ચાળીસ ગાય પર એક "મુસિજ્જહ" વાજિબ છે, મુસિજ્જહ: તે ગાય જેના બે વર્ષ પુરા થઈ ગયા હોય.

૩- બકરીઓની ઝકાત:

જ્યારે બકરીઓ અથવા ઘેટાંની સંખ્યા ચાળીસ થઈ જાય તો તેમાંથી એક બકરી અથવા એક ઘેટું જે એક વર્ષથી ઓછી ઊંમરનું હોય, આપવું વાજિબ છે,

અને ચાળીસથી ઓછી બકરીઓમાં કોઈ ઝકાત નથી, જ્યારે બકરીઓ અથવા ઘેટાની સંખ્યા એકસો એકવીસ થઈ જાય તો તેમાંથી બે બકરીઓ ઝકાત રૂપે આપવી જરૂરી છે, જ્યારે બકરીઓ અથવા ઘેટાની સંખ્યા બસો એક થઈ જાય તો તેમાંથી ત્રણ બકરીઓ ઝકાત રૂપે આપવી જરૂરી છે, ત્યારબાદ આ માત્રામાં ફરજ પૂરો થઈ જાય છે, જેથી દરેક સો બકરીઓ માંથી એક બકરી વાજિબ થશે, તો ચારસો બકરીઓમાં ચાર બકારીઓ.

બીજું: જમીન માંથી નીકળતી ઉપજોની ઝકાત:

જમીન માંથી નીકળતી ઉપજોના બે પ્રકાર છે:

- ૧) અનાજ અને ફળો.
- ૨) ખનીજો.

પ્રથમ પ્રકાર: અનાજ અને ફળ:

અનાજ જેવું કે ઘઉં, જુવાર અને ચોખામાં ઝકાત આપવી જરૂરી છે. અને ફળોમાં પણ: જેવું કે ખજૂર અને દ્રાક્ષમાં. તે વગર અન્ય પાંદડા જેવું કે શાકભાજુ વગેરેમાં ઝકાત વાજિબ નથી. અનાજ અને ફળોમાં ઝકાત આપવાની શરતો:

- ૧) તેનો સંગ્રહ કરી રાખવામાં આવે: એટલા માટે એવા ફળો અને અનાજમાં ઝકાત વાજિબ નહીં થાય, જેનો સંગ્રહ કરવામાં નથી આવતો.
- ૨) તેનો માપતોલ થતો હોય: એટલા માટે તે ફળો અથવા શાકભાજુમાં ઝકાત વાજિબ નથી, જે ગણીને અથવા વજન કરીને વેચવામાં આવે છે, જેવું કે તરબૂચ, કુંગળી, દાડમ વગેરે.

૩) નિસાબ સુધી પહોંચી જાય: જે પાંચ "વસક" (વસક એક માપણું છે જેમાં એક "વસક" માં સાહીઠ "સાચ" હોઇ છે, જે ટોટલ ત્રણસો સાચ થાય છે, જે છસો કિલોગ્રામ એટલે પંદર મણ બરાબર થઈ, અમુક આલિમોના મતે પાંચ વસકનું વજન વીસ મણ પણ વર્ણન કરે છે.) છે, તેનાથી ઓછામાં ઝકાત વાજિબ નથી.

૪) જ્યારે ઝકાત આપવી જરૂરી થાય ત્યારે તે માલ સંપૂર્ણ માલિકી ફેઠળ હોવો જરૂરી છે.

એટલા માટે જ્યારે કોઈ ઝકાત વાજિબ થયા પછી તેનો માલિક બને, જેવું કે ઉપજને કાપવામાં આવ્યા પછી તેને ખરીદે અથવા તેને ભેટ આપવામાં આવે તો તેમાં ઝકાત વાજિબ નથી.

અનાજ અને ફળોમાં ઝકાત આપવાનો સમય:

જ્યારે અનાજ ઉપયોગ કરવા જેવું બની જાય, પછી ઝકાત વાજિબ થઈ જાય છે, તેની નિશાનીઓ નીચે પ્રમાણે છે:

અ- અનાજમાં: જ્યારે તેનો દાણો સખત થઈ જાય.

બ- ખજૂરમાં: જ્યારે તે લાલ અથવા પીળી થઈ જાય:

ક- દ્રાક્ષમાં: જ્યારે નરમ અને મીઠી બની જાય.

અનાજ અને ફળોનો નિસાબ:

અનાજ અને ફળોનો નિસાબ પાંચ વસક છે, એક વસક સાઈટ સાચનો હોય છે, તેનો નિસાબ ત્રણસો (300) નબવી સાચ થશે, અને કિલોગ્રામમાં જોઈએ તો તેનો વજન નવસો (૮૦૦) કિલો થાય છે.

અનાજ અને ફળોમાં વાજિબ ઝકાત:

જે ઉપજો વગર મહેનતે અને કોઈ ખર્ચ વગર થઈ હોય તો તેમાંથી દસમો ભાગ ઝકાત રૂપે કાઢવો વાજિબ થશે, જેવું કે જે ઉપજ વરસાદના પાણી અથવા ધોધના પાણીથી સિંચાઈ કરવામાં આવી હોઈ.

અને જેની સિંચાઈ કરવામાં ખર્ચ થયો હોય અથવા મહેનત લાગી હોય, જેવું કે કુંવાનું પાણી, નહેર અથવા મશીનોનો ઉપયોગ થયો હોય તો તેમાં વિસમો ભાગ ઝકાત રૂપે કાઢવામાં આવશે.

બીજો પ્રકાર: ખનીજો:

જમીનની ઉપજો માંથી એક પ્રકાર ખનીજ પણ છે,

જમીન માંથી તેની ગુણવત્તા સિવાયની અન્ય વસ્તુઓ પણ કાઢવામાં આવે તો તેને ખનીજ કહે છે, જેવું કે સોનુ, ચાંદી, લોખડ, અને હીરાઓ.

તેમાં ઝકાત આપવાનો સમય:

જ્યારે તેને પોતાના કબજામાં લઇ લો તો તરત જ તેની ઝકાત આપવી પડે છે, તેમાં વર્ષની શરત લગાવવામાં આવતી નથી.

તેનો નિસાબ સોના અને ચાંદીનો જ નિસાબ છે, અને તેની કિંમતનો ચાળીસમો ભાગ ઝકાત રૂપે આપવામાં આવે.

કિંમતી વસ્તુઓની ઝકાત:

જેવું કે સોનુ, ચાંદી, અને રોકકડ રકમ અને તેમાં પણ ઝકાત આપવી વાજિબ છે.

તેની દલીલ, અલ્લાહ તાલાલા એ કહ્યું:

(...وَالَّذِينَ يَكْنِزُونَ الْدَّهَبَ وَالْفِضَّةَ وَلَا يُنفِقُونَهَا فِي سَبِيلِ اللَّهِ فَبَسِّرْهُم بِعَذَابٍ أَلِيمٍ) [التوبه: ١٠]

{જે લોકો સોનું અને ચાંદી ભેગું કરીને રાખે છે અને અલ્લાહના માર્ગમાં ખર્ચ નથી કરતા, તેઓને તમે દુઃખદાયી અઝાબની ખુશખબર આપી દો} [અત્ તૌબા: ૩૪].

હદીષમાં છે:

«مَنْ صَاحِبْ ذَهَبٍ وَلَا فَضْةً لَا يُؤْدِي فِيهَا حَقُّهَا؛ إِلَّا إِذَا كَانَ يَوْمُ الْقِيَامَةِ صَفَحَتْ لَهُ صَفَائِحُ مِنْ نَارٍ».

«જેણે પણ સોના અને ચાંદીમાં વાજિબ ઝકાત ન આપી તો તેના માટે આગાની પ્લેટો તૈયાર કરવામાં આવશે».³⁴

સોના અને ચાંદીમાં ઝકાત વાજિબ છે, આના પર આલિમોનો ઇજમાચ્ય (એકમત) છે, અને રોકકડ રકમનો પણ સોના અને ચાંદી પ્રમાણે જ હુકમ છે, કારણકે રકમ સોના અને ચાંદીની જગ્યાએ ઉપયોગ થાય છે.

રોકકડ રકમમાં વાજિબ ઝકાત અને સોના તેમજ ચાંદીનો નિસાબ:

જ્યારે સોનું વિસ મિસ્કાલ સુધી પહોંચી જાય,

અને ચાંદી બસો ઇસ્લામી દિરહમ સુધી પહોંચી જાય, તો બજે માંથી ચાળીસમો ભાગ આપવો વાજિબ થાય છે, ઝવેરાત બનાવ્યા હોય કે ન બનાવ્યા હોય, અને રોકકડ રકમને પણ સોના અને ચાંદી પ્રમાણે કાઢવામાં આવશે, કારણકે કિંમતમાં આ ત્રણેય બરાબર છે, જ્યારે રકમ સોનું અને ચાંદીના નિસાબ સુધી પહોંચી જાય ત્યારે ઝકાત આપવી જરૂરી બને છે.

³⁴ બુખારી, હદીષ નંબર: (૧૪૦૨) (૩/૩૩૮), મુસ્લિમ, હદીષ નંબર: (૨૨૮૭) (૪/૫૭).

હાલ રોકકડ રકમની ઝકાતની ગણતરી ચાંદીની રકમ પ્રમાણે થતી હોય છે, કારણકે તે સોનુ કરતા સસ્તું હોય છે અને તેનો નિસાબ પહેલા થતો હોય છે.

એટલા માટે જ્યારે એક મુસલમાન પદ્ધત ગ્રામ ચાંદીનો માલિક બની જાય, અને તેના પર એક વર્ષ પણ પસાર થઈ જાય તો તેમાં ઝકાત વાજીબ બની જાય છે.

અને ચાંદીની કિંમત બદલતી રહે છે, એટલા માટે જેની પાસે શોડોક પણ માલ હોય અને તે જાણતો ન હોય કે માલ નિસાબ સુધી પહોંચી ગયો છે કે નહીં તો તે ચાંદીના વેપારીઓને એક ગ્રામ ચાંદીની કિંમત પૂછી લે અને પછી તેને પદ્ધત વડે ગુણાકાર કરી લે, જે જવાબ આવશે તે જ નિસાબ ગણાશે.

ફાયદા: જ્યારે કોઈ પોતાના માલની ઝકાત આપવા માગે તો નિસાબને ચાળીસ વડે બાગાકાર કરી લે, જે જવાબ આવશે તે જ તેની ઝકાત ગણાશે.

ચોથું: વેપાર ધંધાના સામાન પર ઝકાત:

આ તે સામાન છે, જે ફાયદા માટે લે વેચ કરવામાં આવતો હોય, વેપાર ધંધાના માલમાં રૂપિયા સિવાય સંપૂર્ણ માલનો સમાવેશ થશે, જેવું કે ગાડી, કપડાં, લોખંડ, લાકડી વગેરે, અન્ય સામાન જે વેપાર ધંધા માટે ખાસ હોય.

વેપાર ધંધાના સામાનમા ઝકાત આપવા માટેની કેટલીક શરતો:

૧- પોતાની મહેનતથી તેના માલિક બન્યા હોય, જેવું કે વેચવું, ભાડે આપવું, અને તેના સિવાય અન્ય વેપાર ધંધા માટેના સ્વોત.

૨- વેપારની નિયત કરી તેના માલિક બનવું: અર્થાત् તેનાથી કમાણી કરવાની નિયત હોય, કારણે કે "કાર્યોનો આધાર નિયતો પર હોઈ છે, અને વેપાર પણ એક કાર્ય જ છે.

૩- તેની કિંમત સોના અથવા ચાંદી પ્રમાણે નિસાબ સુધી પહોંચી જાય.

૪- એક વર્ષ પસાર થઈ જવો.

વેપાર ધંધાના સામાનમાં ઝકાત આપવાની રીત:

વર્ષ પૂરું થઈ ગયા પછી સોના અથવા ચાંદી પ્રમાણે સામાનની કિંમત નક્કી કરવામાં આવશે, જો સામાન નિસાબ સુધી પહોંચી જાય તો તેનો ચાળીસમો ભાગ કાઢવામાં આવશે.

પાંચમું: ઝકાતુલ ફિત્ર:

આ તે સદકો છે, જે ૨માન મહિનો પૂરો થયા પછી વાજ્બિબ થાય છે.

સદકએ ફિત્ર બીજુ હિજરી સનમાં ફરજ કરવામાં આવ્યો.

તેનો હુકમ:

સદકએ ફિત્ર દરેક તે મુસલમાન પર વાજ્બિબ છે, જેની પાસે ઈદના દિવસે અને રાત પોતાના અને પોતાના ધરવાળાઓ માટે પૂરતો ઘોરાક કરતા વધારે હોય.

અને સદકએ ફિતર દરેક મુસલમાન પુરુષ, સ્ત્રી, નાના, મોટા, આજાદ, ગુલામ પર વાજ્બિબ છે. તેની દલીલ આ હદીષ છે.

«فِرْضَ رَسُولِ اللَّهِ زَكَاةُ الْفَطَرِ عَلَى الْعَبْدِ وَالْمُحْرَمِ وَالذِّكْرِ وَالْأَنْشَى، وَالصَّغِيرِ وَالكَبِيرِ، مِنَ الْمُسْلِمِينَ».

«અલ્લાહના રસૂલ ﷺ એ દરેક મુસલમાન પુરુષ, સ્ત્રી, નાના, મોટા,
આગાડ અને ગુલામ પર સદકએ ફિત્ર ફરજ કર્યો છે».³⁵

ફરજનો અર્થ: જરૂરી અને લાગીમ.

સદકએ ફિત્ર વાજિબ કરવાની હિકમતો:

અબ્દુલ્લાહ બિન અબ્બાસ રાઝી. કહે છે:

«فرض رسول الله ﷺ زَكَاةُ النَّفَرِ؛ طَهْرٌ لِلصَّائِمِ مِنَ الْلُّغُوِ وَالرُّفْثِ، وَطَعْمَةٌ لِلْمَسَاكِينِ».»

«અલ્લાહના રસૂલ ﷺ એ રોજદાર ને વ્યર્થ વાતો, અને ખરાબ
વાતોથી પાક કરવા અને ગરીબો માટે ખાવાનો બંદોબસ્ત કરવા માટે
ફરજ કરવામાં આવ્યું છે».³⁶

સદકએ ફિત્ર વાજિબ થવાનો અને તેને આપવાનો સમય:

સદકએ ફિતર છદના દિવસે રાત્રે સૂર્યાસ્ત પછી વાજિબ થાય છે,
અને તેને છદની નમાજ પહેલા છદગાહ જતા પહેલા આપી દેવું
મુસતહબ (જાઈજ) છે.

અને તેને છદની નમાજ પછી આપવો જાઈજ નથી.

જો છદની નમાજ પછી આપે તો તેને તેની કારા કરવી પડશે, અને
વિલંબ કર્યું તે માટે તે ગુનેગાર થશે. હા, ઈદના એક અથવા બે દિવસ
પહેલા આપવું જાઈજ છે.

³⁵ બુખારી, હદીષ નંબર: (૧૪૩૨), મુસ્લિમ, હદીષ નંબર: (૮૮૪).

³⁶ અબૂ દાવુદ, હદીષ નંબર: (૧૬૦૮), ઈબ્ને માજહ, હદીષ નંબર: (૧૮૨૭), ઇમામ અલ્બાની
રહ. એ સહીહુલ જામીયમાં આ હદીષ સહીહ કહી છે. (૧૩/૫૮).

સદકચે ફિત્રનો માપ અને કઈ વસ્તુ આપવામાં આવે:

શહેરના લોકો જે ખોરાક ખાતા હોય તેમાંથી એક સાચ, જેવું કે ચોખા, ખજૂર, અને જુવાર વગેરે.

એક સાચનો માપ: લગભગ ત્રણ કિલોનો હોય છે.

અને તેની કિંમત આપવી જાઈઝ નથી, કારણકે આપ  ના આદેશનો વિરોધ ગણવામાં આવશે.

ઝકાત કાઢવી અને કોને આપવી તેનું વર્ણન:

ઝકાત આપવાનો સમય:

ઝકાત તરત જ આપી દેવી જરૂરી છે. કારણ વગર વિલંબ કરવું જાઈઝ નથી, જેવું કે માલ દૂર બીજા શહેરમાં હોય, અને ત્યાં કોઈ વકીલ ન હોય.

કાત આપવાની જગ્યા:

બહેતર એ છે કે જગ્યાં માલ હોય ત્યાં જ ઝકાત આપવામાં આવે, પરંતુ અમુક પરિસ્થિતિમાં બીજા શહેરમાં પણ આપવી જાઈઝ છે:

અ- જગ્યારે પોતાના શહેરમાં કોઈ લાયાર ન મળે.

બ- બીજા શહેરમાં કોઈ નજુકનો લાયાર રહેતો હોય.

જ- જગ્યાં કોઈ શરાઇ કારણ હોય, જેવું કે તોફાનના કારણે મુસલમાનોનું શહેર અસરકારક થઈ હોય, અને જગ્યાં દુકાળ જેવી પરિસ્થિતિ હોય.

અને સામાન્ય રિતે જગ્યારે દલીલો જોઈશું, તો જાણવા મળશે કે બાળક અને પાગલના માલ માંથી પણ ઝકાત વાજ્બિબ છે, અને તેમાંથી ઝકાત આપવાની જવાબદારી તેના જવાબદારની રહેશે. અને નિયત કર્યા વગર ઝકાત આપવી જાઈઝ નથી; કારણકે નબી  એ કહ્યું:

«إِنَّمَا الْأَعْمَالَ بِالنِّيَاتِ»

«કાર્યોનો આધાર નિયત પર છે».³⁷

ઝકાતના હકદાર લોકો:

ઝકાતના હકદાર આઠ પ્રકારના લોકો છે:

પહેલો પ્રકાર: ફકીરો:

આ તે લોકો છે, જેમની મૂળ જરૂરતો પુરી થતી ન હોય, જેવું કે ઘર, ખોરાક અને કપડાં, તેમને એટલી ઝકાત આપવામાં આવશે કે તેમને અને તેમના ઘરવાળાઓને એક વર્ષ માટે પૂરતી થઈ જાય.

બીજો પ્રકાર: લાચાર, મિસ્કિન:

જેમની મૂળ જરૂરતો માંથી વધુ જરૂરતો પુરી થતી હોય પરંતુ પૂરતી નહીં, જેવું કે કોઈને પગાર મળતો હોય અને એક વર્ષ સુધી પૂરતો ન હોય.

તેમને એટલી ઝકાત આપવામાં આવશે કે એક વર્ષ સુધી તેમની અને ઘરવાળાઓની મૂળ જરૂરતો પુરી થઈ જાય.

ત્રીજો પ્રકાર: ઝકાત લેનારા: અર્થાત् જે ઝકાત ઉધરાવતા હોય:

જેમને હાકિમ ઝકાત ઉધરાવવાની જવાબદારી સોંપે અથવા જે ઝકાતની હિફાજત કરતા હોય અથવા ઝકાતને તેના હકદાર લોકો સુધી પહોંચાડતા હોય.

જો હુકુમત દ્વારા તેમનો કોઈ પગાર નક્કી ન હોય તો તેમને તેમના કામ પ્રમાણે ઝકાત માંથી રકમ આપવામાં આવશે.

ચોથો પ્રકાર: જેમનું દિલ રાખવા માટે ઝકાત આપવામાં આવે:

³⁷ બુખારી, હદીષ નંબર: (૧) મુસ્ਲિમ, હદીષ નંબર: (૧૬૦૭).

આ તે લોકો છે કે જો તેમને ઝકાત આપવામાં આવે તો તેઓ મુસલમાન બનવા અથવા ઈમાનની મજબૂતી અથવા તેમની તકલીફથી મુસલમાનોની સુરક્ષિત રહેવાની આશા કરવામાં આવે.

તેમની ઝકાત આપવાની રકમ: જેનાથી તે લોકોનું દિલ ઇસ્લામ તરફ ઝૂકી જાય.

પાંચમો પ્રકાર: ગરદન:

અર્થાત् ગુલામો અને મુકાતિબિનને આજાદ કરવા માટે.

મુકાતિબ: તે ગુલામને કહે છે, જેણે પોતાના માલિક પાસેથી ખરીદી લીધો હોય, અને તેમાં મુસલમાન કેદીઓને ફીદયાની રકમ આપી આજાદ કરવું પણ શામેલ છે.

છણો પ્રકાર: દેવાદાર અને તેમના બે પ્રકાર છે:

પહેલો: જેણે પોતાના માટે જરૂરત માટે દેવું કર્યું હોય અને આપી ન શકતો હોય, તો તેને એટલી ઝકાત આપવામાં આવે જેથી એનું દેવું પૂરું થઈ જાય.

બીજો પ્રકાર: જેણે લોકો વચ્ચે ઇસ્લાહ કરવા માટે દેવું કર્યું હોય.

તેને એટલી ઝકાત આપવામાં આવશે કે તેનું દેવું પૂરું થઈ જાય, ભલેને તે માલદાર હોય.

સાતમો પ્રકાર: અલ્લાહના માર્ગમાં રહેવાવાળા:

અર્થાત् અલ્લાહના માર્ગમાં જિહાદ કરનાર.

તેમના માટે ઝકાત કેટલી? જેનાથી જિહાદની જરૂરત પુરી થઈ જાય, જેવું કે સવારી, હથિયાર, ખાવાનું વગેરે.

આઠમો પ્રકાર: ઈંબે સબીલ (મુસાફિર):

આ તે મુસાફિરને કહેવામાં આવે છે, જેમનું સફર દરમિયાનનું ભાથું પૂરું થઈ ગઈ હોય, અથવા તો ચોરી થઈ ગઈ હોય અને પોતાના શહેર સુધી પહોંચવા માટે તેની પાસે માલ પણ ન હોય.

તેમના માટે ઝકાત કેટલી? એટલી આપવામાં આવશે કે તેના શહેર સુધી પહોંચી જાય, ભલેને તે માલદાર હોય.

ચોથો વિભાગ:

રોજા: ઈબાદતના હેતુથી તુલૂએ ફજરથી લઈ સૂર્યાસ્ત સુધી જે વસ્તુથી રોજો તૂટી જાય તેનાથી બચીને રહેવું.

અને તે ઇસ્લામનો એક રુકન છે, અલ્લાહ તખાલા તરફથી ફર્જ કરવામાં આવ્યો છે, અને ઇસ્લામની જરૂરી શિક્ષાઓ માંથી એક છે, તેના વાજિબ થવાની દલીલ કુરાયાન, હદીષ અને ઇજમાય દ્વારા સાબિત છે. અલ્લાહ તખાલાએ કહ્યું:

(شَهْرُ رَمَضَانَ الَّذِي أُنْزِلَ فِيهِ الْقُرْءَانُ هُدًى لِلنَّاسِ وَبَيِّنَاتٍ مِّنَ الْهُدَىٰ وَالْفُرْقَانِ فَمَنْ شَهِدَ مِنْكُمُ الشَّهْرَ فَلِيَصُمِّمْ...) [البقرة: ١٩٥]

{રમજાન તે મહિનો છે, જેમાં કુરાયાન ઉતારવામાં આવ્યું છે, જે લોકો માટે હિદાયત છે, અને તેમાં હિદાયત તેમજ સત્ય અને અસત્ય વાતની વચ્ચે તફાવત માટેની નિશાનીઓ છે, તમારા માંથી જે વ્યક્તિ આ મહિનો મેળવી લે, તેના માટે મહિનાના સંપૂર્ણ રોજા રાખવા જરૂરી છે} [અલ્ બકરહ: ૧૮૫].

રમાનના રોજા ફરજ થવાની શરતો:

૧- મુસલમાન હોવું, કાફિર દ્વારા રોજો સહીહ નહીં ગણાય.

૨- પુખ્તવયનું હોવું: બાળક પર રોજા ફરજ નથી.

હા, જે તમીજ ધરાવતો હોય તેના માટે રોજા રાખવા સહીહ છે અને તે રોજા તેના માટે નફીલ ગણવામાં આવશે.

૩- બુઝી હોય, પાગલ પર રોજા વાજિબ નથી, અને ન તો તેનો રોજો સહીહ ગણવામાં આવશે કારણકે તે નિયત નથી કરી શકતો.

૪- રોજા રાખવાની શક્તિ ધરાવતો હોય, એટલા માટે બીમાર, જે રોજા રાખવાની ક્ષમતા ન ધરાવતો હોય તેના પર વાજિબ નથી, અને ન તો મુસાફર પર, પરંતુ કારણ અર્થાત् બીમારી અને સફર બજો ખતમ થઈ ગયા પછી રોજાની કાંઈ જરૂર કરશે.

અને સ્ત્રીના રોજા માટે શરત એ છે કે તેને હૈજ અને નિફાસનું લોહી ન આવતું હોય.

રમાનના રોજા બે વસ્તુઓ પછી શરૂ થાય છે:

અ- રમાનનો ચાંદ નજર આવ્યા પછી, નબી ﷺ એ કહ્યું:

«صوموا لرؤيته، وافطروا لرؤيته».

«ચાંદ જોઈને રોજા રાખવાનું શરૂ કરો અને ચાંદ જોઈને રોજા રાખવાનું બંધ કરો».³⁸

³⁸ બુખારી, હદીષ નંબર: (૧૮૧૦) (૨/૬૭૪), મુસ્લિમ, હદીષ નંબર: (૧૦૮૬) (૨/૭૬૨).

બ- શાખબાનના ત્રીસ દિવસ પુરા કરો, જ્યારે વાદળ અથવા જ્યારે વાદળના કારણે ચાંદ નજર ન આવે, અલ્લાહના રસૂલ ﷺ કહે છે: «જો ચાંદ જોવાનું શક્ય ન હોય તો તો શાખબાન મહિનાના ત્રીસ દિવસ પુરા કરો».³⁹

રોજાની નિયત:

અન્ય ઈબાદતોની જેમ નિયત વગાર રોજો રાખવો પણ યોગ્ય નથી, ફર્જ રોજાની નિયત કરવાનો સમય અન્ય રોજા કરતા અલગ છે, અને તેનું વર્ણન નીચે પ્રમાણે છે:

પહેલું: ફર્જ રોજા જેવું કે રમાનના રોજા, કઝ અથવા નજરના રોજા તુલૂએ ફજર પહેલા રાત્રે નિયત કરવી જરૂરો છે, આપ ﷺ નું વર્ણન છે:

«من لم يبيت الصيام من الليل فلا صيام له».

«જેણે રોજાની નિયત રાત્રે ન કરી તેનો કોઈ રોજો નથી».⁴⁰

બીજું: નક્કિલ રોજાની નિયત: તેની નિયત દિવસ દરમિયાન પણ કરવામાં આવી શકે છે, શરત એ કે તેણે તુલૂઅ ફજર પછી એવું કંઈ ન કર્યું હોય જેનાથી રોજો તૂટી જાય.

રોજાને ખરાબ કરવાવાળી બાબતો:

પહેલી: જિમાઅ (સંભોગ), તેનાથી રોજો બાતેલ થઈ જાય છે, અને તે દિવસના રોજાની કઝ કરવી જરૂરી છે, જે દિવસે તેણે સંભોગ કર્યું હોય, સાથે સાથે એક ગરદન આઝાદ કરવી પડશે, અર્થાત् એક ગુલામ, જો આવું કરી ન શકે તો સતત બે મહિનાના રોજા રાખવા પડશે.

³⁹ બુખારી, હદીષ નંબર: (૧૮૦૯).

⁴⁰ અહમદ: (૬/૨૮૭) અબુ દાવુદ: (૨/૩૨૮) (૨૪૫૪), નિસાઈ: (૪/૧૯૬) (૨૩૩૧) અને આ નિસાઈના શબ્દો છે.

ઇલાકા પ્રમાણે મધ્યસ્થ ખાવાનું ખવડાવવું પડશે.

બીજું: વીર્ય નીકળવું: ભલેને મનેચાના કારણે અથવા હસ્તમૈથુનના કારણે હોય અથવા વારેવાર જોવાના કારણે હોય, અને તેમાં બસ કગા રૂપે રોજો રાખવાનો રહેશે, કારણકે કફકારો જિમાઅ સાથે ખાસ છે.

હા ઉંઘમાં સ્વભન્દોષના કારણે હોય તો તેમાં કંઈ પણ વાજિબ નથી, કારણકે આ વસ્તુ માનવીના હાથમાં નથી, પરંતુ ગુસલ કરવું વાજિબ છે.

ત્રીજું: જાણી જોઈને ખાવું પીવું, કારણકે અલ્લાહ તાયાલા એ કહ્યું:

«...وَلُكُوا وَأَشْرِبُوا حَتَّىٰ يَتَبَيَّنَ لَكُمْ أَحْبَطُ الْأَبْيَضُ مِنَ الْخَيْطِ الْأَسْوَدِ مِنَ الْفَجْرِ...» [البقرة: ١٩٧]

{અને ફજરના સમય સુધી જ્યાં સુધી સફેદ દોરો કાળા દોરા દ્વારા જહેર ન થઈ જાય તમે ખાઈ-પી શકો છો} [અલ્ બકરહ: ١٨٧].

પરંતુ જો ભૂલથી ખાઈ પી લો તો કંઈ વાંધો નથી; તેની દલીલ આ હદીષ છે.

«من نسي وهو صائم، فأكل أو شرب، فليتم صومه، فإنما أطعمه الله وسقاه». ٢٠

«જે રોજદારે ભૂલથી ખાઈ પી લે તે પોતાનો રોજો પૂરો કરે, તેને અલ્લાહએ ખવડાવ્યું છે અને પીવડાવ્યું છે». ٤١

ચોથું: જાણી જોઈને ઉલટી કરવી, જો કોઈને કુદરતી ઉલટી થાય તો તે પોતાનો રોજો પૂરો કરશે, તેનાથી તેના રોજા પર કોઈ અસર નથી. કારણકે નબી ﷺ એ કહ્યું:

«من ذرعه القيء فليس عليه قضاء، ومن استقاء عمداً فليقض». ٤٢

^{٤١} બુખારી, હદીષ નંબર: ૬૬૬ (૧૧/૬૬૬), મુસ્લિમ, હદીષ નંબર: (૨૭૦૬) (૪/૨૭૭).

«જેને ઉલટી આવી જાય તેના પર કોઈ કાંઈ નથી, અને જે જાણી જોઈને ઉલટી કરે તેના પર કાંઈ જરૂરી છે».⁴²

પાંચમું: હિજામો કરાવવો અથવા કોઈ બીમારી માટે લોહી આપવું, તેનાથી રોઝો તૂટી જશે, પરંતુ જો ચેકઅપ કરાવવા માટે થોડુંક લોહી કાઢવામાં આવે તો કંઈ વાંધો નથી, એવી જ રીતે શરીર માંથી લોહી જાતે જ નીકળે તો પણ કંઈ વાંધો નથી,

જે લોકોને રમત્તાનના રોઝા છોડવાની છૂટ આપવામાં આવી છે:

પહેલો પ્રકાર: તે લોકો જેમને રમત્તાનના રોઝા છોડી શકે છે, પરંતુ તેઓને કાંઈ કરવી જરૂરી છે, જેમાંથી:

પહેલું: એવો બીમાર જેને શિક્ષાની આશા હોય અને રોઝો રાખવાથી તેને નુકસાન અથવા તકલીફ થતી હોય.

બીજું: મુસાફર; ભલેને સફરમાં તેને કોઈ તકલીફ થતી હોય કે ન થતી હોય.

આ બજો વાતોની દલીલ, અલ્લાહ તાયાલા કહે છે:

[...] ... وَمَنْ كَانَ مَرِيضًا أَوْ عَلَى سَفَرٍ فَعَدَّهُ مِنْ أَيَامِ أُخْرَ...] [البقرة: ١٦٥]

{જો તમારા માંથી કોઈ વ્યક્તિ બીમાર હોય અથવા સફરમાં હોય તો તે બીજા દિવસોમાં ગણતરી પુરી કરી લે} [અલ્ બકરહ: ૧૮૫].

ત્રીજું: ગર્ભવતી અથવા દૂધ પીવડાવનારી સ્ત્રી, તેણીઓ બીમાર જેવી જ છે, તેમના માટે રોઝા છોડવા જાઈએ છે, જો તેમને તકલીફ

⁴² અબૂ દાવુદ, હદીષ નંબર: ૨૩૮૦ (૨/૫૩૬), તિમિતી, હદીષ નંબર: (૭૧૮) ઈન્ને માજહ, હદીષ નંબર: ૬૭૬ (૨/૩૧૫).

થતી હોય અથવા તેમના બાળકને તકલીફ થતી હોય, પરંતુ તેણીઓ અન્ય દિવસોમાં રોજાની કર્તા જરૂર કરશે.

ચોથું: હૈજ અને નિઝાસ વાળી સ્ત્રી, રોજા ન રાખવાની છૂટ આપવામાં આવી છે, અને તેમના પર અન્ય દિવસોમાં રોજાની કર્તા જરૂરી છે.

બીજો પ્રકાર: એવા લોકો જેઓ રમઝાનના રોજા છોડી શકે છે પરંતુ તેમના માટે કર્તા કરવી વાજીબ છે, તેમાંથી:

પહેલું: એવો બીમાર જેની શિક્ષા થવાની કોઈ આશા ન હોય.

બીજું: વૃદ્ધ વ્યક્તિ જે રોજો રાખી ન શકતો હોય.

આ લોકો દરરોજ પ્રત્યેક દિવસમાં બદલામાં રમઝાનમાં જ એક મિસ્કિનને ખાવાનું ખવડાવશે, પરંતુ જો વ્યક્તિ વધારે વચે પહોંચી પોતાની બુદ્ધિ ગુમાવી દે તો તેના પરથી તકલીફ હટાવી લેવામાં આવે છે, તો તે રોજો છોડી શકે છે અને તેના પર કોઈ ગુનો નથી.

કરવાનો સમય અને તેમાં વિલંબ કરવાનો હુકમ:

આગળનો રમઝાન આવતા પહેલા જ પાછળના રમઝાનની કર્તા જરૂરી છે, અને બહેતર એ છે કે કર્તા કરવામાં ઉતાવળ કરવામાં આવે, અને આગલા રમઝાન સુધી રોજામાં વિલંબ કરવો જાઈઝ નથી, આયશા રહી. રિવાયત કરે છે તેમણે કહ્યું:

«كَانَ يَكُونُ عَلَيِّ الصَّوْمُ مِنْ رَمَضَانَ، فَمَا أَسْتَطَعْتُمْ إِلَّا فِي شَعْبَانَ لِمَكَانٍ رَسُولُ اللَّهِ

صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ» -

«મારા પર રમઝાનના રોજાની કર્તા હોતી પરંતુ હું આપ ﷺ નો ઘ્યાલ કરતા તેને શઅબ્દાનના મહિનામાં રાખતી હતી».⁴³

⁴³ બુખારી, હદીષ નંબર: (૧૮૪૮) (૨/૬૮), મુસ્કિમ, હદીષ નંબર: ૧૮૪૬ (૨/૮૦૨).

જેઓ આગલા રમજાન સુધી પણ કઝા ન કરી શકે તો તેની બે પરિસ્થિતિ હોઈ શકે છે:

૧- કોઈ શરદ કારણસર તે રોજા ન રાખી શક્યો, ઉદાહરણ તરીકે તે એક વર્ષ સુધી બીમાર રહ્યો, તો તેના પર ફક્ત કઝા જરૂરી છે.

૨- કોઈ કારણ વગર વાર કરે તો તે ગુનેગાર થશે, તેણે તૌબા કરવી જોઈએ, અને રોજાની કઝા કરવી પડશે અને ગરીબોને ખાવાનું ખવડાવવું પડશે.

જેના પર પાછલા રોજા બાકી હોય તેના માટે નફિલ રોજા રાખવાનો આદેશ:

જેના રમજાનના રોજા બાકી હોય તેના માટે શ્રેષ્ઠ તે છે કે તે કઝા કરે, પરંતુ જો કોઈ નફિલ રોજો હોય, જેનો દિવસ નક્કી હોય, જેમદે અરફાનો રોજો, આશૂરાના રોજો તો કઝા પહેલા રાખી શકે છે; કારણકે કઝા કરવાનો સમય લાંબો છે, જ્યારે કે અરફા અને આશૂરાના રોજો જો તેના સમયમાં રાખવામાં ન આવે તો તે છૂટી જશે, પરંતુ શવ્વાલના છો રોજા કઝા કર્યા પછી જ રાખશે.

હરામ રોજા:

૧- બંને ઈદ (ઈદુલ ફિત્ર અને ઈદુલ અઝહા) ના દિવસે રોજો રાખવો; કારણકે તેનાથી રોકવામાં આવ્યા છે.

૨- ઝુલુ હિજજના મહિનામાં અચ્યામે તશીકમાં (ઝુલુ હિજજના મહિનામાં અગિયાર, બાર અને તેર તારીખે) રોજા રાખવા, પરંતુ જો કોઈ હજજે મુતમતિઅ (હજજના મહિનામાં ઉમરાહ માટે એહરામ

બાંધવો અને તેનાથી ફારિગ થઈ તેજ વર્ષે ફરી હજ્જ માટે એહરામ બાંધવો) અને હજ્જે કિરાન (હજ્જ અને ઉમરાહ બંનેની એક સાથે નિયત કરી એહરામ બાંધવો) કરનાર પાસે હૃદયનું જાનવર ન હોઈ તો રોઝા રાખી શકે છે, અને અથ્યામે તશ્રીક: ઝુલ હિજજાના મહિનાનો અગિયાર, બાર અને તેરમી તારીખનો દિવસ.

૩ - શંકાના દિવસે શંકાના કારણે રાખવામાં આવતો રોઝો અને શાબાન મહિનાની ત્રીસમી તારીખ હોય છે, જ્યારે ત્રીસમી તારીખે વાદળ અથવા ધુણવારી રાતના કારણે ચાંદ ન દેખાયો હોઈ.

મકરુહ (તે કાર્ય જેને છોડવા પર સવાબ મળે છે અને કરવાથી માનવી ગુનેગાર થાય છે) રોઝા:

અ- રજબના મહિનાને રોઝા રાખવા માટે ખાસ કરવો.

બ- ફક્ત જુમાના દિવસે રોઝો રાખવો; કારણકે તેનાથી રોકવામાં આવ્યા છે, પરંતુ જો તેના એક દિવસ પહેલા કે પછી રોઝો રાખવાનો હોય તો કોઈ વાંધો નહીં.

મસ્નૂન (હદીષમાં વર્ણન કરેલા) રોઝા:

અ- શાવ્વાતના છો રોઝા.

બ- ઝુલ હિજજાના નવ રોઝા અને તેમાં સૌથી મહત્વનો રોઝો અરફાનો રોઝો છે, જેનાથી બે વર્ષના ગુનાહ માફ થઈ જાય છે, પરંતુ હજ્જ કરવાવાળો નથી રાખી શકતો.

જ- દર મહિનાના ત્રણ રોઝા અને તેમાં શ્રેષ્ઠ, અથ્યામે બીજાના રોઝા, અને તે હિજરી મહિનાની તેર, ચૌદ અને પંદરમી તારીખને અથ્યાબે બીજ કહે છે.

સ- દર અઠવાડિયે સોમવાર અને ગુરુવારના દિવસે રોજો રાખવો, કારણકે નબી ﷺ આ રોજા રાખતા હતા, એટલા માટે કે આ દિવસોમાં બંદાઓના કાર્યો રજૂ કરવામાં આવે છે.

નફિલ રોજા:

અ- દાવૂદ અલહિસુ સલામના રોજા, તેઓ એક દિવસ રોજો રાખતા હતા અને બીજા દિવસે રોજો ન હતા રાખતા.

બ- મુહર્રમ મહિનાના રોજા અને આ સૌથી શ્રેષ્ઠ મહિનો છે, જેમાં રોજા રાખવા જાઈઝ છે, આ મહિનાનો સૌથી શ્રેષ્ઠ રોજો આશૂરાનો રોજો છે, અને તે મુહર્રમની દસમી તારીખનો રોજો છે, અને તેની સાથે સાથે નવમી તારીખનો પણ રોજો રાખવામાં આવશે કારણકે નબી ﷺ એ કહ્યું:

«لَئِنْ بَقِيَتْ إِلَى قَابِلٍ لِأَصْوَمِ النَّاسِ».

«જો હું આવતા વર્ષ જીવતો રહ્યો તો (મુહર્રમની) નવમી તારીખે પણ રોજો રાખીશ»..

અને આ રોજાથી પાછલા એક વર્ષના ગુનાહ માફ થઈ જાય છે.

પાંચમો વિભાગ: હજ

હજની શાબ્દિક અને ઇસ્લામી વ્યાખ્યા:

હજનો શાબ્દિક અર્થ: ઈરાદો કરવો અને ઇસ્લામી વ્યાખ્યા: હજ: ચોક્કસ સમયમાં, ચોક્કસ કાર્યો કરવા માટે બૈતુલ્લાહ તરફ જવાનો ઈરાદો કરવાને હજ કહે છે.

ઉમરાહનો શાબ્દિક અર્થ: જિયારત કરવી, મુલાકાત લેવી.

ઇસ્લામની કાયદાકીય વ્યાખ્યાઃ કોઈ પણ સમયે, ચોક્કસ કાર્યો કરવા માટે મસ્જિદે હરામ ની જિયારત કરવી.

અને હજ તે ઇસ્લામનો એક મહાન રૂકન (સ્થંભ) અને મહાન આધાર છે, હજ સન ૮ હિજરીમાં ફરજ કરવામાં આવી, અને નબી ﷺ એ ફક્ત એક જ હજ કરી તે (હજજતુલ વદાય) હતી.

અને જેની પાસે તાકાત હોઈ તેના પર જીવનમાં એક વખત હજ કરવી ફરજ છે, અને જો તેનાથી વધારે કરે તો તે નેકી છે, અને રહી વાત ઉમરાહની તો ઘણા આલિમોના પાસે વાજિબ છે, જેની દલીલ એ છે કે જયારે નબી ﷺ ને પૂછવામાં આવ્યું કે શું સ્ત્રીઓ પણ પર જિહાદ ફરજ છે? તો કહ્યું:

«نعم، عليهن جهاد لا قتال فيه: الحج والعمرة»

«હાં, તેમના પર એવો જિહાદ ફરજ છે જેમાં યુદ્ધ ન હોઈ, અર્થાત् હજ અને ઉમરાહ».⁴⁴

હજ અને ઉમરાહ વાજિબ થવાની શર્તો:

૧- ઇસ્લામ

૨- અકલ

૩- પુષ્પતવથી હોવું

૪- આઝાદ હોવું

૫- શક્તિ હોવી

⁴⁴ અહમદ, હદીષ નંબર: (૨૫૧૮૮) (૬/૧૯૯), નસાઈ, હદીષ નંબર: (૨૬૨૭) (૩/૧૨૧), ઇન્દ્રે માજહ, હદીષ નંબર: (૨૮૦૧) (૩/૪૧૩).

અને સ્ત્રી માટે એક છદ્રી શર્ત એ કે તે પોતાના મહરમ સાથે હજ કરે, કારણકે તેના માટે હજ હોઈ કે બીજો કોઈ સફર મહરમ વગાર કરવો જાઈઝ નથી, કારણકે નબી ﷺ એ કહ્યું:

«لَا تساور المرأة إِلا مَعْ ذِي مُحْرَمٍ، وَلَا يَدْخُلُ عَلَيْهَا رَجُلٌ إِلا مَعْهَا مُحْرَمٌ»

«કોઈ પણ સ્ત્રી પોતાના મહરમ વગાર સફર ન કરે, અને સ્ત્રી પાસે કોઈ પણ અજનબી વ્યક્તિ ન આવે સિવાય કે તે (સ્ત્રી) સાથે કોઈ મહરમ હોઈ».⁴⁵

અને સ્ત્રીના મહરમ નીચે પ્રમાણે છે: તેનો પતિ, અથવા તે દરેક વ્યક્તિ જેની સાથે તેનો નિકાહ હરામ હોઈ; ખાનદાનના કારણે: જેમકે ભાઈ, પિતા, કાકા, ભત્રીજી અને મામા, અથવા કોઈ જાઈઝ કારણે: જેમકે લે પાલક ભાઈ, અથવા સાસરિયાં સંબંધના કારણે, જેમકે તેની માતાનો પતિ અને તેના પતિનો પુત્ર.

અને શક્તિ અર્થ એટલે કે: શારીરિક અને ભૌતિક બને શક્તિ શામેલ છે, કે તે સવારી કરી શકે સફરની પરેશાનીઓ સહન કરી શકે, અને આવવા જવાનો ખર્ચ હોઈ, અને જો બાળકો અને જેનો ખર્ચ તેના પર વાજ્ઞિબ છે તેમના માટે એટલું છોડીને જાય કે તેના પાછા ફરતા સુધી પુરતું થઇ જાય. અને હજના માર્ગમાં જાન અને માલનો ભય ન હોઈ.

અને જો કોઈ પાસે ફક્ત પૈસા હોય અને તેની પાસે શારીરિક શક્તિ ન હોય તો અથવા તે વૃદ્ધ થઇ ગયો હોઈ અથવા કોઈ એવી બીમારી લાગેતી હોય, જેનો ઈલાજ શક્ય ન હોય તો તેના પર વાજ્ઞિબ છે કે તે કોઈ બીજા વ્યક્તિને નાયબ બનાવી, જે તેની તરફથી હજ અને ઉમરાહ કરે.

⁴⁵ બુખારી, હદીષ નંબર: (૧૮૫૨), મુस્લિમ, હદીષ નંબર: (૧૩૪૧) (૨/૬૭૮).

ହଜ ଅନେ ଉମରାହମାଂ ନାୟବ ବନଵୁଣ୍ଡ ବେ ଶତୋ ସାଥେ ସହିହ ଗଣ୍ଠାଶେ:

୧- ଜେନା ମାଟେ ହଜ ଅନେ ଉମରାହ କରିବାନୀ ହୋଇ ତେ ଅକଲିବାଜୀ, ପୁଖିବିଦ୍ୟନୋ ଅନେ ମୁସଲମାନ ହୋଇ.

୨- ତେ ପୋତାନୀ ହଜ କରି ଚୁକ୍ଯୋ ହୋଇ.

ଏହରାମନୀ ମିକାତୋ:

ମାଵାକୀତ ଜେ ମିକାତନୁ ବହୁବିଚନ ଛେ, ତେନୋ ଶାବ୍ଦିକ ଅର୍ଥ: ହଦ ଛେ , ଅନେ ଇସ୍ଲାମୀ ଅର୍ଥ: ଈବାଦତନୀ ଜୀବା ଅଥବା ସମୟନେ କେହିବାମାଂ ଆବେ ଛେ.

ହଜନୀ ମିକାତ ବେ ପ୍ରକାରନୀ ଛେ: ଜୀବା ଅନେ ସମୟ:

ଘ- ସମୟନୀ ମିକାତ: ଜେନୁ ଵର୍ଷନ ଅଲଲାହ ତଆଲା ଏ କର୍ଯ୍ୟ:

[١٦] {الْحُجَّ أَكْثُرُهُ مَعْلُومٌ فَمَنْ فَرَضَ فِيهِنَّ الْحُجَّ فَلَا رَفَثٌ وَلَا فُسُوقٌ وَلَا جِدَالٌ فِي الْحُجَّ...} [البقرة: ١٦]

{ହଜନା ମହିନା ଦରେକ ଲୋକୋ ଜାଣେ ଛେ, ଏଟଲା ମାଟେ ଜେ ବ୍ୟକ୍ତି ତେ ମାସମାଂ ହଜ କରେ} [ଅଲ୍ ବକରହ: ୧୯୭].

ଅନେ ତେ ମହିନାଓ: ଶବ୍ଦବାଲ, ଝୁଲୁ କର୍ଯ୍ୟରେ ଅନେ ଝୁଲୁ ହିଜଜନା ଦସ ଦିଵସୋ ଛେ.

ବ- ଜୀବାନୀ ମିକାତ: ଆ ତେ ହଦନେ କେହିବାମାଂ ଆବେ ଛେ ଜେନେ ଏହରାମ ବଗାର କରିବି ହାଜୁ ମାଟେ ଜାଇଁଙ୍ଗ ନଥି, ଆ ଜୀବାଓ ନିଚେ ମୁଜବ୍ବ ଛେ:

୧- ଝୁଲୁ ହୁଲୈଫା: ଜେ ମଦିନାହନା ଲୋକୋନୀ ମିକାତ ଛେ.

୨- ଝୁଣ୍ଫା: ତେ ଶାମ ଅନେ ମିସର ଅନେ ମଗରିବନା ଲୋକୋନୀ ମିକାତ ଛେ.

୩- କରନେ ମନାତିଳ: ଜେନେ ଅତ୍ୟାରେ ସୈଲ କେହିବାମାଂ ଆବେ ଛେ, ତେ ନଜଦନା ଲୋକୋନୀ ମିକାତ ଛେ.

୪- ଆତେ ଈର୍କ: ତେ ଈରାକନା ଲୋକୋନୀ ମିକାତ ଛେ.

પ- યલમલમ: જે યમનના લોકોની મિકાત છે.

અને જેનું ઘર તે મિકાતની અંદર હોઈ તે હજ અને ઉમરાહ માટે એહરામ પોતાના ઘરેથી બાંધે.

અને મક્કાહના લોકો મક્કાહથી જે એહરામ બાંધશે, તેમણે બહાર નીકળી મિકાત જઈ એહરામ બાંધવાની જરૂર નથી, અને જ્યાં સુધી ઉમરાહની વાત છે, તો તેઓ હરમની હદથી નજીક કોઈ હલાલ જગ્યાએ (જે હરમની હદથી બહાર હોઈ) જઈ અને ત્યાંથી એહરામ બાંધશે, અને જે વ્યક્તિ હજ અથવા ઉમરાહ કરવા માંગતો હોઈ તો તેણે જે જગ્યાઓથી દાખલ થવું જોઈએ જે નબી ﷺ એ જણાવી છે, અને તે મીકાત છે જેના વિષે ઉપર વર્ણન થઇ ચુક્યું છે, જે વ્યક્તિ હજ અથવા ઉમરાહ કરવા માંગતો હોઈ તેના માટે એહરામ વગર મિકાત પાર કરવી જાઈઝ નથી.

- જો કોઈ વ્યક્તિ આ મિકાત પાસે રેહતો ન હોઈ તો તે ઉપર વર્ણન કરેલ કોઈ પણ મીકાત પાસેથી પસાર થઇ તો તે ત્યાંથી જ એહરામ બાંધી લે.

- જે કોઈ મક્કાહ જવાના માર્ગે છે, તે જમીન, સમુક્ર અથવા હવા દ્વારા ઉપરોક્ત કોઈ પણ મીકાતમાંથી પસાર થાય તો તે નજીકની મીકાતથી એહરામ બાંધી લે, કારણકે ઉમર બિન ખતાબ રહી. એ કહ્યું: જુઓ ક્યારે તમે મિકાતની બરાબર આવો છો.

- જો કોઈ હજ અથવા ઉમરાહ માટે વિમાનમાં સફર કરે તો તેને તે સમયે એહરામ બાંધવો અને તે જાઈઝ નથી તે એરપોટ પર ઉત્તરતા સુધી એહરામ ન બાંધે.

એહરામ:

હજ અથવા ઉમરાહમાં દાખલ થવાની નિયત કરવી, તો ઉમરાહમાં એહરામનો અર્થ: ઉમરાહમાં દાખલ થવાની નિયત કરવી, અને હજમાં એહરામનો અર્થ: હજની નિયત કરવી, અને નિયત વગાર કોઈ મોહરમ નથી બની શકતો, જો નિયત ન હોઈ તો ફક્ત એહરામના કપડા પહેરી લેવા એહરામ નહીં ગણાય.

એહરામની સ્થિતિમાં કરવાના કાર્યો:

- ૧- એહરામ પહેરતા પહેલા નહાવું (સંપૂર્ણ બદનને ધોવું).
- ૨- શરીર પર સુગંધ લગાવવી, એહરામના કપડામાં લગાવવી નહીં.
- ૩- એક સફેદ ઈજાર અને એક સફેદ ચાદર અને બે પગરખા પહેરવા.
- ૪- સવારીની સ્થિતિમાં કિબ્લા તરફ થઇ એહરામ બાંધવું.

હજના પ્રકારો:

એહરામ બાંધવાવાળા વ્યક્તિ એ પોતાની ઈચ્છા મુજબ હજના ત્રણ પ્રકારોમાંથી એક અપનાવવું જોઈએ, અને તે ત્રણ પ્રકારો નીચે મુજબ છે:

- ૧- તમતુઅ: જે હજના મહિનામાં ઉમરાહ માટે એહરામ બાંધે અને તેનાથી ફારિગ થઇ તેજ વર્ષે હજ માટે એહરામ બાંધે.
- ૨- ઇફાદ: મીકાત પર ફક્ત હજ માટે એહરામ બાંધે અને તે જ એહરામમાં હજના દરેક કાર્યો કરે.
- ૩- કિરાન: તે કે મીકાત પર આવી એક સાથે હજ અને ઉમરાહ અથવા ફક્ત ઉમરાહ માટે એહરામ બાંધે, ફરી તવાફ શરૂ કરતા

પહેલા હજને તેમાં શામેલ કરીલે, તે ઉમરાહ અને હજની નિયત મીકાત પર થી જ કરે અથવા ઉમરાહનો તવાફ શરૂ કરતા પહેલા કરે, અને હજ અને ઉમરાહ બંને માટે તવાફ અને સઈ કરે.

હજજે તમતુઅ અને હજજે કિરાન કરનારને કુરબાની કરવી પડશે જે તે મસ્ઝિદ હરામનો રહેવાસી ન હોઈ.

અને ત્રણેય હજમાં શ્રેષ્ઠ હજજે તમતુઅ છે કારણકે નબી ﷺ એ પોતાના સહાબાઓને આનો જ આદેશ આપ્યો.⁴⁶ ફરી હજજે કિરાન, કારણકે તેમાં પણ હજ અને ઉમરાહ બંને કરવામાં આવે છે, ફરી હજજે ઇફાદનો દરજજો છે.

ફરી જયારે ત્રણેય માંથી કોઈ એકની નિયત કરે તે ત્યારબાદ તલ્ખીયાના આ શર્દૂ કહે:

«لَبِيكَ اللَّهُمَّ لَبِيكَ، لَبِيكَ لَا شَرِيكَ لَكَ لَبِيكَ، إِنَّ الْحَمْدَ وَالْعَمَّةَ لَكَ وَالْمُلْكَ لَا شَرِيكَ لَكَ».

«"લબ્બયદ્ધલાહુમ્ લબ્બયદ્ધ, લબ્બયદ્ધ લા શરીક લક લબ્બયદ્ધ, ઇજ્જલ હૃદ વન્ નેઅમત લક વલ્ મુલ્ક, લા શરીક લક" (હું હાજર છું, હે અલ્લાહ ! હું હાજર છું, હું હાજર છું, તારો કોઇ ભાગીદાર નથી, હું હાજર છું, ખરેખર દરેક પ્રકારની પ્રસંશા તારા માટે જ છે અને દરેક નેઅમતો તેજ આપેલી છે, સામ્રાજ્ય તારું જ છે, તારો ભાગીદાર નથી)».

આ સુજ્ઞત છે અને વધુ વખત કહેવું જાઈઝ છે, અને પુરુષો ઉંચા અવાજે કહેશે અને સ્ત્રીઓ ધીમાં અવાજે કહેશે.

⁴⁶ મુસ્લિમ, હદીષ નંબર: (૧૨૧૧) (૨/૮૭૦).

તલ્બીયાનો સમય: તલ્બીયાનો સમય એહરામ બાંધવાની સાથેશી શરૂ થાય છે, અને તેનો છેલ્લો સમય નીચે પ્રમાણે છે:

- ૧- ઉમરાહ કરવાવાળો તવાફ શરૂ કરતા પહેલા તલ્બીના કહેવાનું છોડી દે.
- ૨- હજ કરવાવાળો ત્યારે તલ્બીના કહેવાનું છોડશે જયારે તે જમરએ ઉક્ખા પર પથ્થર મારવાનું શરૂ કરશે.

એહરામની સ્થિતિમાં ના કરવાના કામ:

- ૧- શરીરના કોઈ પણ ભાગના વાળ દૂર કરવા કે કાપવા કે ઉખાડવા.
- ૨- કોઈ કારણ વગર હાથ અથવા પગના નખ કાપવા, પરંતુ જો કોઈ નખ તૂટી જાય તેને અલગ કરે તો તેના પર કોઈ ફિદચો (ખંડણી) નથી.
- ૩- પુરુષે પોતાના માથાને કોઈ જોડાયેલી વસ્તુ વડે ઢાંકવું, જેમકે ટોપી વગેરે.
- ૪- પુરુષે પોતાના શરીર અથવા શરીરના કોઈ ભાગ પર સીવેલું કપડું પહેરવું, જેમકે ખમીસ, પાદડી અથવા પાયજામો.

મુખ્યિત (સીવેલું કપડું): જે શરીરના અંગો બરાબર તૈયાર કરવામાં આવે, જેમકે પગના મોજાં, હાથના મોજાં વગેરે, અને સ્ત્રી એહરામની સ્થિતિમાં કોઈ પણ કપડા પહેરી શકે છે, કારણકે તેને પોતાનું શરીર ઢાંકવાની જરૂર હોઈ છે, પરંતુ તે બુરાઓ (ચહેરાને ઢાંકવાવાળું કપડું) નહીં પહેરે, પરંતુ જયારે તેની સામે કોઈ અજનબી વ્યક્તિ આવી જાય તો કોઈ કપડાથી ચહેરો ઢાંકી લે શે, અને તે હાથના મોજાં પણ નહીં પહેરે.

૫- સુગંધ; કારણકે એહરામ બાંધવાવાળા પાસે એવી ઈચ્છા કરવામાં આવે છે કે તે રંગબેરંગી દુનિયાની અને તેના આનંદથી દૂર રહે અને આભિરત તરફ આગળ વધે.

૬- જમીન પરના શિકારને કતલ કરવું અથવા શિકાર કરવું, કારણકે એહરામ બાંધવાવાળો શિકાર નથી કરી શકતો અને ન તો તે શિકાર કરવામાં કોઈની મદદ કરી શકે છે, અને તે જનાવર પણ અબેહ નથી કરી શકતો અને જો એહરામની સ્થિતિમાં (જમીન પર) કોઈ શિકાર કર્યો હોય અથવા તેમાં મદદ કરી હોય અથવા તેના માટે શિકાર કરવામાં આવેલ જાનવરની શાક તે ખાઇ નથી શકતો, કારણકે તે તેના માટે એક મૃત જેવું છે, પરંતુ તે સમુક્રમાં શિકાર કરી શકે છે, અને એવી જ રીતે પાલનું જાનવર જેમકે મરધી, ઘેટાં બકરા વગેરે, કારણકે તે શિકાર નથી.

૭- પોતે શાદી કરે અથવા કોઈ બીજા માટે ગવાહ બને.

૮- સમાગમ જે પ્રથમ હલાલ થતા (ઈદના દિવસે અબેહ અને હલક કરવું) પહેલા તો તેની હજ અમાન્ય ગણાશે, પરંતુ તેને હજના દરેક કાર્યો પુરા કરવા પડશે, અને આવતા વર્ષે કઝા કરવી પડશે અને એક ઊંઠ અથવા ઊંટણી અબેહ કરવી પડશે, અને જો તે હલાલ થયા પછી કરે તો તેની હજ માન્ય ગણાશે પરંતુ તેને દમ આપવું પડશે, અને સ્વી માટે પણ આજ આદેશ છે, જો સમાગમ કરવામાં તેની ઈચ્છા શામેલ હોઈ.

૯- ગુપ્તાંગ સિવાય સ્વીને ઈચ્છા સાથે સ્પર્શ કરવું, આ પણ એક એહરામ બાંધવાવાળા માટે જાઈઝ નથી કારણકે તે તેને હરામ સમાગમ તરફ દોરી જશે.

ઉમરાહઃ

અ- ઉમરાહના અરકાનઃ

૧- એહરામ.

૨- તવાફ.

૩- સઈ.

બ- ઉમરાહના વાજિબ કાર્યો:

૧- નક્કી મિકાત પર એહરામ બાંધવો.

૨- હલક કરવું (માથાના સંપૂર્ણ વાળ કપાવવા) અથવા થોડા થો વાળ કપાવવા.

જ- ઉમરાહનો તરીકો:

સૌથી પહેલા તવાફના સાત ચક્કર પુરા કરશે, હજરે અસ્વદથી (કાળા પથ્થર) શરૂઆત કરશે અને તેના પર જ ખત્મ કરશે, વગ્ઝની સ્થિતિમાં અને નાભિ થી લઇ ધૂટણ સુધી ગુપ્તાંગને ઢાંકી તવાફ કરશે, અને સંપૂર્ણ તવાફ દરમિયાન ઇઝૂતિબાઘ કરવું સુજ્ઞત છે; અને ઇઝૂતિબાઘ તે છે કે જમણા હાથને ખુલ્લો રાખવો અને ચાદરના બંને કિનારાને ડાબા ખભા મુકવા, અને સાતમું ચક્કર પૂરું થઇ જાય તો પોતાના બંને ખભાને ઢાંકી લે, અને હજરે અસ્વદ (કાળા પથ્થર) તરફ જાય, ફરી જો બોસો આપવો શક્ય હોઈ તો આપે અને જો બોસો આપવો શક્ય ન હોઈ તો શક્યતા પ્રમાણે હજરે અસ્વદને જમણા હાથ વડે ઇસ્તિલામ કરે અર્થાત્ પોતાના જમણા હાથ વડે સ્પર્શ કરશે, અને હાથથી જ બોસો આપશે, અને જો હાથ

વડે સ્પર્શ કરવું પણ શક્ય ન હોઈ તો «અલ્લાહુ એકબર» એક વખત કહી જમણા હાથ વડે તેની તરફ ઈશારો કરે પણ હાથને બોસો ન આપે, અને ન તો ત્યાં ઉભો રહે, ફરી કઅબાની ડાબે બાજુ કરી તવાફ કરશે, અને પેહલા ત્રણ તવાફમાં રમલ કરવું જાઈએ છે, અને રમલનો અર્થ: નાના નાના પગલા ભરી જડપથી ચાલવું.

અને જયારે રુકને યમાની પાસેથી પસાર થાય -રુકને યમાની તે કઅબાનો ચોથો રુકન છે- તો જો શક્ય હોઈ તો તેને જમણા હાથ વડે સ્પર્શ કરે, ન તો તકબીર કહે ન તો બોસો આપે, અને જો સ્પર્શ કરવું શક્ય ન હોઈ તો પસાર થછ જાય ન તો ઈશારો કરે ન તો તકબીર (અલ્લાહુ એકબર) કહે, અને રુકને યમાની અને હજરે અસ્વદ દરમિયાન આ દુઆ પઢે:

(... رَبَّنَا إِنَّا فِي الْدُّنْيَا حَسَنَةٌ وَفِي الْآخِرَةِ حَسَنَةٌ وَقَنَا عَذَابَ الْكَارِ ﴿٦﴾ [البقرة: ٦])

{ "રબ્બના આતિના ફિદ્ દુનિયા હસનતવ વફિલ આભિરતિ હસનતવ વકિના અઝાબનું નાર" } (હે અમારા પાલનહાર ! અમને દુનિયામાં સદકાર્ય કરવાની પ્રેરણા આપ અને આભિરતમાં પણ ભલાઇ આપ અને અમને જહૃજમના અઝાબથી બચાવી લે} [અલ્ બકરહ: ૨૦૧].

અને તવાફ પૂરો કર્યા પછી મકામે ઈબ્રાહીમની પાછળ બે રકાઅત નમાઝ પઢે -જો શક્ય હોઈ તો- અને જો જગ્યા ન હોઈ તો મરિઝિદે હરામમાં ક્યાં પણ નમાઝ પઢી શકે છે, અને પેહલી રકાઅતમાં સૂરે ફાતિહા પછી સૂરે (કાફિરન) પઢવી સુજ્ઞત છે, અને બીજી રકાઅતમાં સૂરે (ઇખ્લાસ) પઢવી સુજ્ઞત છે, ફરી તે સઈ તરફ આગળ વધશે

અને સફા અને મરવા પર્વતના પર સાત ચક્કર લગાવશે, એક જવું અને એક પાછું આવવું, તે સઈ સફાથી શરૂ કરશે, જેથી તે સફા પર ચઢશે અને શ્રેષ્ઠ તે જ છે, જો શક્ય હોઈ તો નહીં તો તેની પાસે ઉબો રહેશે, અને સઈ શરૂ કરતી વખતે આ આયત પઢશે:

﴿ إِنَّ الصَّفَا وَالْمَرْوَةَ مِنْ شَعَابِ اللَّهِ ... ﴾ [البقرة: ٩٦]

{સફા અને મરવહ અલ્લાહની નિશાનીઓ માંથી છે} [અલ્ બકરહ: ٩٦].

અને સુજ્ઞત તે છે કિબ્લા તરફ મોહું કરી અલ્લાહની પ્રસંશા અને તેના વખાણ કરે, અને કહે:

« لَا إِلَهَ إِلَّا اللَّهُ، وَاللَّهُ أَكْبَرُ، لَا إِلَهَ إِلَّا اللَّهُ وَحْدَهُ لَا شَرِيكَ لَهُ، لَهُ الْحَمْدُ، يَحْيِي وَيَمْتَيْتُ،
وَهُوَ عَلَى كُلِّ شَيْءٍ قَدِيرٌ، لَا إِلَهَ إِلَّا اللَّهُ وَحْدَهُ، أَنْجَزَ وَعْدَهُ، وَنَصَرَ عَبْدَهُ، وَهَزَمَ الْأَحْزَابَ وَهُدَّهُ».

« "લા ઈલાહ ઈલ્લાહ, વલ્લાહ અકબર, લા ઈલાહ ઈલ્લાહ વહદનું
લા શરીક લહુ, લહુલ મુલ્ક, વલહુલ હમુદુ, યુહ્વી વયુમિતુ, વહુવ અલા
કુલ્લી શૈધન કદીર, લા ઈલાહ ઈલ્લાહ વહદનું, અન્જઝ વઅદનું, વનસર
અબદનું, વહજિમલ અહ્યાબ વહદનું" (અલ્લાહ સિવાય કોઈ ઈબાદત ને
લાયક નથી, તે એકલો છે, તેનો કોઈ ભાગીદાર નથી, તેના માટે જ
સામ્રાજ્ય છે અને તેનાં માટે જ પ્રશંસા છે અને તે દરેક વસ્તુ પર કુદરત
ધરાવે છે, અલ્લાહ સિવાય કોઈ ઈબાદત ને લાયક નથી, તે એકલો છે,
તેણે પોતાનું વચ્ચન પૂરો કર્યો, અને પોતાના બંદાઓ ની મદદ કરી અને
તેણે એકલા એ સંપૂર્ણ લશ્કરને હરાવી દીધું)».

ફરી બંને હાથ ઉઠાવી દુઆ કરે, અને ઉપરોક્ત દુઆ ત્રણ વખત
પઢે, ફરી સફા પરથી ઉતરી અને મરવા તરફ આગળ વધશે, અહીં

સુધી કે સિઝનલ (લીલી લાઈટ) સુધી પહોંચી જાય, તો પુરુષ બીજા સિઝનલ સુધી જડપથી ચાલશે, અને સ્વી માટે પડદાનો ખ્યાલ કરી જડપથી ચાલવું જાઈએ નથી, પરંતુ તેણી સંપૂર્ણ સર્દ દરમિયાન શાંતિથી ચાલશે, ફરી મરવા પાસે પહોંચીને તેના પર ચઢશે અને તે જ શ્રેષ્ઠ છે, અને શક્ય ન હોઈ તો તેની પાસે ઉભો રહે, અને જે સફા પર્વત પર જે કહ્યું અને કર્યું તેજ કરે અને આ આયત પઢે:

﴿ إِنَّ الْصَّفَا وَالْمَرْوَةَ مِنْ شَعَابِ اللَّهِ ... ﴾ [البقرة: ١٩٠]

{સફા અને મરવહ અલ્લાહની નિશાનીઓ માંથી છે}

અને આ આયત ફક્ત સફા ચઢતી વખતે પહેલા ચક્કરમાં જ પઢવી જાઈએ છે, અને નીચે ઉત્તરી, અને જડપથી ચાલવાની જગ્યા અને શાંતિથી ચાલવાની જગ્યાઓને ધ્યાનમાં રાખી સફા સુધી પહોંચે, આવી રીતે સાત વખત કરે, એક જાય ત્યારે એક ચક્કર ગણાશે અને પાછો આવે તે બીજું ચક્કર, અને સર્દ દરમિયાન જેટલું શક્ય હોઈ તેટલી દુઅા પઢવી જાઈએ છે, અને તે પણ તે નાની અને મોટી ગંદકીથી પાક થઇ જાય અને જો તે તહારત વગર સર્દ કરે તો પણ પુરતી થઇ જશે, એટલા માટે જે સ્વીને હૈઝ અથવા નિફાસનું લોહી આવતું હોઈ તે પણ સર્દ કરી શકે છે, કારણકે સર્દમાં તહારત (પાક હોવું) શર્ત નથી ફક્ત જાઈએ છે.

જો સર્દ (સફા અને મરવાની દોડ) પૂરી થઇ જાય તો હલક (સંપૂર્ણ વાળ મૂંડાવી દેવા) અથવા તકસીર (વાળ નાના કરાવવા) કરાવે અને પુરુષ માટે હલક અફઝલ (શ્રેષ્ઠ) છે.

અને આવી રીતે તેના ઉમરાહના કાર્યો પુરા થઇ જશે.

અ- હજના અરકાન:

- એહરામ.
- ૨- અરફામાં ઠહેરવું
- ૩- તવાફે ઇફાગા
- ૪- સઈ.

બ- હજના વાજિબ (જરૂરી) કાર્યો:

- ૧- નક્કી મિકાત પર એહરામ બાંધવો.
- ૨- ઝુલ્દ હિજજાની નવમી તારીખે અરફાના મૈદાનમાં રોકાવવું, જે દિવસે રોકાઈ તે સુર્યાસ્ત સુધી રોકાઈ.
- ૩- ઝુલ્દ હિજજાની દસમી તારીખે અડધી રાત સુધી મુઝદલિફામાં રોકાઈ.
- ૪- ઝુલ્દ હિજજાના અથ્યામે તશ્રીકમાં મિનામાં રોકાઈ.
- ૫- જમરહને કાંકરીઓ મારવી.
- ૬- હલક કરવું (માથાના સંપૂણ વાળ કપાવવા) અથવા થોડા થોડા વાળ કપાવવા.
- ૭- તવાફે વિદાઘ.

૮- હજનો તરીકો:

મિકાત પર પહીંચીને જો સમય ઓછો હોઈ તો હજજે ઇફાદ માટે તલ્બીના કહે, મક્કહ પહોંચીને તવાફ અને સઈ કરે, એને એહરામની

અથીતીમાં ઝુલ હિજાની નવમી તારીખે અરફાત તરફ જાય, અને ત્યાં સુર્યાસ્ત સુધી રોકાઈ, ફરી તલ્બીના (લઘેક કહેવું) કહેતા કેહતા મુજદલિફા પાછો આવી જાય, મુજદલિફામાં રાત રોકાય અને ત્યાં ફજરની નમાજ પઢે, અને લાલાશ આવતા સુધી દુઆ અને અલ્લાહની ચાદમાં વ્યસ્ત રહે, ફરી સૂર્યોદય પહેલા જ મિના તરફ નીકળી જાય, મિનામાં આવી જમરહ ઉક્ખાને સાત કાંકરીઓ મારે, ફરી હલક (સંપૂર્ણ વાળ મુંડાવી દેવા) અથવા તકસીર (વાળ નાના કરાવવા) કરાવે, ફરી તવાફે છફાઝા કરે અને પહેલી કરેલી સઈ પુરતી થછ જશે (બીજી વખત કરવાની જરૂર નથી), આવી રેતી તેની હજ પૂરી થછ જશે, અને તે સંપૂર્ણ હલાલ થછ જશે.

હવે તેના માટે ફક્ત અગિયાર અને બારમી તારીખે કાંકરીઓ મારવાનું બાકી રહે છે, જો ઉતાવળ હોઈ; ફરી તે ત્રણેય જમરાત પાસે આવી દરેકને સાત સાથ કાંકરીઓ મારશે, અને દરેક કાંકરી સાથે તકબીર (અલ્લાહ અકબર) કહેશે, તે નાના જમરાહથી શરૂઆત કરશે ફરી વચ્ચેના જમરાહ પાસે ફરી છેલ્લા જમરાહ ઉક્ખા પાસે, ત્રણેય જમરાતને સાત કાંકરીઓ મારશે.

અને જો તે બારમી તારીખ પણ રોકાવવા માંગતો હોઈ તો તે તેરમી તારીખે પણ એવી જ રીતે જમરાતને કાંકરીઓ મારશે જેવી રીતે તેણે અગિયારમી તારીખે મારી હતી.

કાંકરીઓ મારવાનો સમય: ત્રણેય દિવસોમાં ઝવાલ પછી.

અને જો બારમી તારીખે સુર્યાસ્ત પહેલા જ મિનાથી નીકળી જાય તો કોઈ વાંધો નહીં, અને જો તે તેરમી તારીખે ઝવાલ સુધી કાંકરીઓ મારવા રોકાય, તો તે શ્રેષ્ઠ છે, કારણકે અલ્લાહ તચાતા એ કહ્યું:

(* وَأَذْكُرُوا اللَّهَ فِي أَيَّامٍ مَعْدُودَاتٍ فَمَن تَعَجَّلَ فِي يَوْمَيْنِ فَلَا إِثْمٌ عَلَيْهِ وَمَن تَأَخَّرَ فَلَا إِثْمٌ

عَلَيْهِ لِمَن أَنْقَلَ ...} [البقرة: ١٦٣]

એ દિવસ માટે ઉતાવળ કરનાર પર પણ કોઈ ગુનો નથી અને જે પાછળ રહી જાય તેના પર પણ કોઈ ગુનો નથી, શરત એ કે તે અલ્લાહથી ડરવાવાળાઓ હોય} [અલ બકરહ: ૨૦૩].

અને જે સફર કરવાનો ઈરાદો કરે તે, તવાફે વિદાય કરશે પણ સઈ નહીં કરે. અને જો તેની સાથે હૃદયનું જાનવર ન હોઈ તો તે શ્રેષ્ઠ છે, કે તમતુઅની નિયતથી એહરામ બાંધે, ફરી તે આઠમી તારીખે હજ માટે તલ્બીના (લઘ્બેક) કહે, અને તે ઉપરોક્ત વર્ણન કરેલ હજના કાર્યો કરે, અને જો તે હજ અને ઉમરાહ બંને માટે એહરામ બાંધે તો પણ કોઈ વાંધો નથી, અને તેને હજજે કિરાન કહેવામાં આવશે, અને હજજે કિરાનમાં હજ અને ઉમરાહ બંને માટે એક સાથે નિયત કરવામાં આવે છે.

ત્રીજો વિભાગ:

મુખ્યામલાત (બાબતો, વ્યવહાર) નું વર્ણન

આલિમો એ આ વિભાગમાં જે જરૂરી બાબતો છે, તે વર્ણન કરી છે, જેને શીખવું દરેક માટે જરૂરી છે, અને તેઓએ આ વિષય પર ચર્ચા કરી છે, કે (આ વિષય વિષે) કેટલું જ્ઞાન પ્રાપ્ત કરવું એક મુસલમાન માટે ફરજ છે, તેમાં તેઓએ વર્ણન કર્યું: વેપારી માટે વેચાણ અને ખરીદીના આદેશોનું જ્ઞાન પ્રાપ્ત કરવું જરૂરી છે, જેથી તે અજાણતામાં હરામ કે વ્યાજખોરીમાં ન સપદાઈ જાય, અને આ વિષય પર સમર્થન માટે કેટલાક સહાબા - રહી.- ની કેટલીક વાતોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

ઉમર બિન ખત્તાબ -રહી.- એ કહ્યું: (અમારા બજારમાં તે જ ધંધો કરી શકે છે, જેની પાસે દીનનું જ્ઞાન હોઈ).⁴⁷

અલી બિન અબી તાલિબ -રહી.- એ કહ્યું: જે વ્યક્તિ દીનના જ્ઞાન વગર વેપાર, ધંધો કરે છે, તો ખરેખર તે વ્યાજખોરીમાં સપદાઈ જશે.⁴⁸

ઇથે આબિદીને અલ્લામી દ્વારા નકલ કરી કહ્યું: (દરેક બંધન કર્તા પુરુષ અને સ્ત્રી માટે દીનની જ્ઞાન અને માર્ગદર્શન શીખ્યા પાછી આ પણ ફરજ છે કે તે વજૂ, ગુસલ, નમાઝ અને રોઝા વિષે ઇલમ પ્રાપ્ત કરે,, અને જો તેનો માલ નિસાબ સુધી પહોંચી ગયો હોય તો ઝકાત વિષે પણ ઇલમ પ્રાપ્ત કરે અને હજનો તરીકો પણ શીખે જો તેના પર હજ વાજિબ થછ

⁴⁷ તિમિતી, હદીષ નંબર: (૪૮૭), અને ઈમામ તિમિતી રહ. એ કહ્યું: આ હદીષ હસન ગરીબ છે, અને ઈમામ અલ્બાની રહ. એ આ હદીષને હસન દરજાની કહી છે.

⁴⁸ જુઓ: મુની અલ મોહતાજ (૨/૨૨).

ગઈ હોઈ) અને વેપારીઓ માટે જરૂરી છે કે તેઓ વેપાર ધંધાના આદેશો શીખે, જેથી દરેક બાબતોમાં મકરૂહ (ધૂણાસ્પદ) કર્યો અને શંકા વારી વસ્તુઓથી બચી શકે, એવી જ રીતે કારીગારો પણ, અથવા કોઈ પણ કામમાં લાગેલ વ્યક્તિની પણ ફરજ બને છે કે તે તે કામ વિષેના આદેશો શીખે જેથી તે હરામમાં ન સપદાઈ જાય.

અને નવવી -રહ.- એ કહ્યું:- (વેપાર, ધંધો, શાદી અને તેના જેવા કાર્યો જે વાજ્ઝિબ નથી તેની શર્તો, સ્થિતિ જાણ્યા વગાર તેમાં આગળ વધવું હરામ છે).⁴⁹

ઇસ્લામી શરીઅતમાં વર્ણન કરેલ માલ બાબતેના કાયદાઓ નીચે વર્ણન કરવામાં આવી રહ્યા છે:

૧- તે દરેક વસ્તુ જાઈજ છે, જેમાં ખાલિસ મસલહત (શુદ્ધ અનુકૃતતા) અથવા પ્રતિકૃતા હોઈ, જેમકે જાઈજ વસ્તુઓને ખરીદવી અથવા વેચવી, ભાડે આપવું અથવા ખરીદીનો અગ્રાધિકાર આપવી.

૨- તે દરેક વસ્તુ જાઈજ છે, જેમાં લોકોના અધિકારો સુરક્ષિત રહેતા હોઈ; જેમકે ગીરવે મુકવું અને સાક્ષી બનાવવું.

૩- તે દરેક વસ્તુ જાઈજ છે તેના બંને પક્ષોની અનુકૃતતા હોઈ; જેમકે વેચાણને સમાપ્ત કરવું, વેચાણ ખત્મ કરવાનો અધિકાર અને ખરીદી અને વેચાણમાં થતી શર્તો.

⁴⁹ જુઓ: અલુ મજમુઅ, (૧/૫૦).

૪- તે દરેક બાબતથી રોકવામાં આવ્યા છે જેનાથી લોકો પર જુલમ થાય અથવા તેમનો અન્યાયી રીપે માલ હડપી લેવામાં આવે; જેમકે વ્યાજ, હડપવું અને ગેરકાયદેસર રીતે સંગ્રહખોરી કરવી.

૫- તે દરેક બાબતો જાઈઝ છે, જેના દ્વારા નેકીમાં સહકારી બનાય; જેમકે કરજ આપવું, ભાડે આપવું અને અમાનત સાચવવી.

૬- સખત મહેનત અને કોઈ કારણ વગર પ્રાપ્ત થતી કમાણી હરામ છે; જેમકે જુગાર અને વ્યાજ.

૭- તે દરેક બાબત હરામ છે, જેમાં અજ્ઞાનતા અને ધોખો આપવામાં આવે; જેમકે જની માલિકી ન હોઈ અથવા જાણ ના હોઈ તે વસ્તુને વેચવી.

૮- કોઈ હરામ કાર્યને પૂર્ણ કરવા માટે યુક્તિઓ કરાવી જાઈઝ નથી; જેમકે "અયનહ" (૧) નામનો વેપાર.

(૧) એવો ધંધો જેમાં કોઈ વસ્તુને ઉધાર વેચી દેવામાં આવે, જ્યારે પરત કરવા માટે આવે ત્યારે ઓછી કીમતે ખરીદે, જેમકે એક ગાડીને વીસ હજાર રૂપિયે ઉધાર વેચી, તેને પંદર હજાર રૂપિયા રોકડા આપી ખરીદી લે, અને વીસ હજાર રૂપિયા સમય પૂરો થાય ત્યારે આપવા ફરજિયાત હોય, આ ધંધો પણ હરામ છે કારણકે આ પણ એક પ્રકારનું વ્યાજ છે.

૯- જે બાબત અલ્લાહની યાદથી ગાફ્લેલ કરી દે તે હરામ છે; જેમકે જુમ્માના દિવસે બીજુ અઝાન પણી વેપાર કરવો.

૧૦- જેમાં પણ કોઈ નુકસાન હોઈ અથવા તેના વડે મુસલમાનો વચ્ચે શત્રુતા થતી હોઈ તો તે પણ હરામ છે; જેમકે હરામ કરેલ વસ્તુઓને ખરીદવી અથવા વેચવી, અને એક ભાઈના સોદા પર સોદો લગાવવો.

અને જ્યારે કોઈ બાબત ન સમજાય તો આલિમોને પૂછે અને તેના વિષે દીનનો આદેશ શું છે, તેનું જ્ઞાન પ્રાપ્ત કર્યા વગાર તેમાં આગળ ન વધે,

(... فَسْأَلُوا أَهْلَ الْذِكْرِ إِنْ كُنْتُمْ لَا تَعْلَمُونَ ﴿٣٦﴾) [التحل: ٣٦]

જેમકે અલ્લાહ તચાલા એ કહ્યું: {બસ ! જો તમે ન જાણતા હોવ તો જ્ઞાનવાળાઓને પૂછી લો} [અનુનાત: ૪૩].

આ વિભાગમાં આટલી વાતોનો જ ઉલ્લેખ કરવો શક્ય છે, હું અલ્લાહથી દુઓ કરું છું કે અલ્લાહ આપણને ફાયદાકારક જ્ઞાન અને સત્કાર્યો કરવાની તૌફિક આપે, ખરેખર તે ઉદાર અને પ્રતિષ્ઠિત છે.

અને ઘણા દર્દ અને સલામતી ઉત્તરે આપણા નબી મુહમ્મદ ﷺ પર, તેમના સંતાન અને તેમના દરેક સાથીઓ પર.

અનુકમણિકા

પ્રસ્તાવના	4
પહેલો ભાગ	6
અકીદહનું વર્ણન	6
પહેલો વિભાગ: ઇસ્લામનો અર્થ અને તેના અરકાન (સ્તંભ).....	6
તૌહીદની મહત્વતા:	6
બીજો વિભાગ: ઈમાનનો અર્થ અને તેના અરકાન (સ્તંભો)	10
અ- અલ્લાહ પર ઈમાન:	11
શિક્ષના પ્રકારો:.....	15
કુર્ઝના પ્રકારો:	19
બ- ફરિશ્તાઓ પર ઈમાન:	21
જ- કિતાબો પર ઈમાન:	22
દ- પયગંબરો પર ઈમાન:	23
હ- આખિરતના દિવસ પર ઈમાન:.....	24
અ- ફરીવાર જીવિત થઈ ઉઠાવવા પર ઈમાન:.....	24
બ- હિસાબ અને બદલો મળવા પર ઈમાન:	24
જ- જગત અને જહનમ પર ઈમાન:	25
વ- સારી અને ખરાબ તકદીર પર ઈમાન:	25
ત્રીજો વિભાગ: અલ્ અહેસાન	26

ચોથો વિભાગ: અહલે સુજ્ઞત વલ્ જમાઅતના ઉસૂલ અને નિયમો:	27
બીજો વિભાગ:	29
ઈબાદતોનું વર્ણન.....	29
પહેલો વિભાગ: પાકી સફાઈનું વર્ણન	29
ત્રીજો: તે અમલ જે હદ્ધ (નાપાક) વ્યક્તિ માટે હરામ છે:.....	32
ચોથું: પેશાબ પાખાનાના આદાબ:.....	34
પાંચમું: પથ્થર વડે ઇસ્તેનજા કરવાનો હુકમ:	35
છઠું: વુગુના આદેશો:.....	36
સાતમું: દરેક પ્રકારના મોજા પર મસો કરવાનો આદેશ:.....	39
આઠમું: તયામુમના આદેશો:	41
નવમું: હેઝ અને નિફાસના આદેશો:	43
બીજો વિભાગ: નમાઝ.....	46
પહેલું: અઝાન અને ઇકામતના આદેશો:	46
બીજું: નમાઝનો દરજો અને તેની મહત્વતા:	49
ત્રીજું: નમાઝની શર્તો:	51
ચોથું: નમાઝના રૂકનો:.....	53
પાંચમું: નમાઝની ફરજો:	58
છઠું: નમાઝની સુજ્ઞતો:	59
સાતમું: નમાઝ પઢવાનો તરીકો:.....	62

આઠમું: નમાજ દરમિયાન ન કરવાના કાર્યો:.....	67
નવમું: નમાજને બાતેલ કરવાવાળી બાબતો:.....	68
દસમું: સજદએ સહવ (નમાજમાં કોઈ ભૂલચૂક થઇ હોઈ ત્યારે કરવામાં આવતો સિજદો):.....	69
અગ્યારમું: તે સમયો જેમાં નમાજ પઢી શકાય નહીં:.....	71
બારમું: નમાજની જમાખત:.....	71
તેરમું: સલાતુલ ખજ્ઝ (બયના સમયે પદ્ધતિના આવતી નમાજ). .	74
ચૌદમું: જુમ્માની નમાજ:	76
પાંચમું: માઝૂર (પીડિત) લોકોની નમાજ:	79
સોણમું: ઇદની નમાજ:	83
સત્તરમું: સલાતુલ કુસૂફ (સુર્ય અને ચંદ્ર ગ્રહણની નમાજ):	86
અઢારમું: સલાતુલ ઇસ્ટિસકાઓ:	87
ઓગણીસમું: જનાગના આદેશો:	89
ત્રીજો વિભાગ : અકાત	93
૧- અકાતની વ્યાખ્યા અને તેનો દરજજો:	93
૨- અકાતને વાજિબ કારવાવાળી શરતો:.....	94
૩- જે માલમાં અકાત વાજિબ છે:	94
ચોથો વિભાગ:	107
રમજાનના રોજા ફર્જ થવાની શરતો:	108

પાંચમો વિભાગ: હજ	115
હજની શાલ્કિક અને ઇસ્લામી વ્યાખ્યાઃ	115
હજ અને ઉમરાહ વાજિબ થવાની શર્તોઃ	116
એહરામની મિકાતોઃ	118
એહરામ:	120
ઉમરાહ:	124
હજ:	128
ત્રીજો વિભાગ:	131
મુઆમલાત (બાબતો, વ્યવહાર) નું વર્ણન	131

Get to know more about Islam

in more than
100 languages



موسوعة الأحاديث الشبهية
HadeethEnc.com



Accurate translations of
Prophetic Hadiths and their
explanations in more than
(60) languages.



بيان الإسلام
byenah.com



Selected materials to
introduce and teach
Islam in more than
(120) languages.



موسوعة القرآن الكريم
QuranEnc.com



Accurate translations
of the meanings of the
Quran in more than
(75) languages.



موسوعات وخدمات إسلامية باللغات
s.islamenc.com



For more websites
in world languages
(s.islamcontent.com)



مكتبة المعرفة الإسلامية العالمية
islamcontent.com



Various and comprehensive
Islamic materials in more
than (125) languages.



ما لا يسع أطفال المسلمين به
kids.islamenc.com



Questions and answers for
Muslim children and public in
more than (40) languages.



Get to know more about Islam

in more than
100 languages



موسوعة الأحاديث البررة
HadeethEnc.com



Accurate translations of
Prophetic Hadiths and their
explanations in more than
(60) languages.



بيان الإسلام
byenah.com



Selected materials to
introduce and teach
Islam in more than
(120) languages.



موسوعة القرآن الكريم
QuranEnc.com



Accurate translations
of the meanings of the
Quran in more than
(75) languages.



موسوعات وخدمات إسلامية باللغات
s.islamenc.com



For more websites
in world languages
(s.islamcontent.com)



مكتبة إسلامية عربية إنجليزية
islamcontent.com



Various and comprehensive
Islamic materials in more
than (125) languages.



مَا لا يُعْلَمُ أَطْفَالُ الْمُسْلِمِينَ جَهَنَّمَ
kids.islamenc.com



Questions and answers for
Muslim children and public in
more than (40) languages.

978-603-8442-09-8



Gu227